




મોતિયા - અંધત્વમુક્ત ગુજરાત બનાવવાનો શંખનાદ

- 10 કરોડ વેક્સિનેશન ડોઝ ◆ ગુજરાતની નવી IT પોલિસી
મિશન ઇન્દ્રધનુષ 4.0 ◆ ધોળાવીરામાં વિકાસકાર્યો

કોરોના રસીકરણ મહાઅભિયાન હેઠળ ગુજરાતની વધુ એક અપ્રતિમ સિદ્ધિ



કરોડ ઉપરાંત

ડોઝનુ રસીકરણ સંપન્ન



Gujarat

The Reliable fortnightly of Gujaratis

Year : 62 ■ Issue : 4 ■ Date 16-2-2022

તંત્રી : ડી. પી. દેસાઈ
સહતંત્રી : અરવિંદ પટેલ
કાર્યવાહક તંત્રી : પુલક ત્રિવેદી
સંપાદક : મિનેશ ત્રિવેદી
સહસંપાદક : દેવાંગ મેવાડા, હર્ષદ રૂપાપરા
કલાનિર્દેશક : જસ્મીન દલે

ગુજરાત પાશ્ચિમ ન મળતું હોય તો નીચે દર્શાવેલા
 નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.

વિતરણ વિભાગ : ફોન : ૦૭૯-૨૩૨૫૩૪૪૦,
 ૦૭૯-૨૩૨૫૩૪૪૨

ઈ-મેઇલ એડ્રેસ : gujaratmagazine@gmail.com

ફેસબુક લિંક : gujaratinformation.official

તંત્રી વિભાગ

‘ગુજરાત’ પાશ્ચિમ કાર્યાલય, માહિતી નિયામકશ્રીની કચેરી,
 ગુજરાત રાજ્ય, બ્લોક નં. ૧૮/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન,
 ગાંધીનગર - ૩૮૨૦૧૦.

ફોન : ૦૭૯-૨૩૨૫૩૪૪૦, ૨૩૨૫૪૪૧૨

વાર્ષિક લવાજમ : ₹ ૫૦-૦૦

રાજ્ય સરકારના સત્તાવાર અહેવાલો સિવાય આ સામયિકમાં
 પ્રસિદ્ધ થતા અન્ય લેખોમાં વ્યક્ત થયેલા વિચારો સાથે રાજ્ય
 સરકાર સંમત છે જ, એમ માનવું નહીં.

માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રકાશિત
 અને સાહિત્ય મુદ્રણાલય પ્રા. લિ. તથા
 ગુજરાત ઓફસેટ પ્રા. લિ., અમદાવાદ દ્વારા મુદ્રિત

48 + 4 Cover = Total 52 Pages

આ અંક નીચેની વેબસાઇટ પરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે
www.gujaratinformation.gujarat.gov.in

લવાજમ નીચેનાં સ્થળોએ સ્વીકારાય છે

- ગુજરાત પાશ્ચિમ વાર્ષિક લવાજમ રાજ્યની તમામ કમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફિસમાં સર્વિસ ચાર્જ ચૂકવી ભરી શકાશે.
- ગુજરાત પાશ્ચિમ વાર્ષિક લવાજમ રોકડથી તથા ક્રોસ ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે માહિતી નિયામકશ્રીની કચેરી, હિસાબી શાખા, બ્લોક નં. ૧૮, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામા પર સ્વીકારવામાં આવશે.
- ગુજરાત પાશ્ચિમ વાર્ષિક લવાજમ જિલ્લાની માહિતી ખાતાની કચેરીઓ પણ સ્વીકારશે.
- સંપર્ક અધિકારીની કચેરી, ગુજરાત સરકાર, મહાડા બિલ્ડિંગ નં. ૩૬, પ્લોટ નં. ૧૫૦, ઓશીવારા પોલીસ સ્ટેશનની બાજુમાં, જોગેશ્વરી (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦૧૦૨.
- લવાજમ સ્વીકારવા કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને એજન્સી આપી નથી.

આપના વિસ્તારમાં રાજ્ય સરકારની જનહિતલક્ષી કોઈ મહત્વપૂર્ણ ધ્યાનાકર્ષક બાબત ગુજરાત પાશ્ચિમમાં પ્રસિદ્ધ કરવા યોગ્ય લાગે તો આપ gujaratmagazine@gmail.com ઇમેઇલ આઇડી ઉપર તસવીર સાથે વિગત મોકલી આપશો તો યોગ્યતા અનુસાર તેને ગુજરાત પાશ્ચિમમાં સ્થાન આપવાનો અવશ્ય પ્રયત્ન કરવામાં આવશે.



શબ્દશ:

- વિનામૂલ્યે નેત્રમણિ પુરું પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.
- વડાપ્રધાનશ્રીએ મોતિયા-અંધત્વમુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે કરેલા નિર્ધારને ગુજરાત સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
- વર્ષ ૨૦૨૫ સુધીમાં અંધત્વ દર ઘટાડી ૦.૨૫ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
- નવી IT પોલિસી દ્વારા IT ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે.
- ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટ્સમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે.
- IT અને ITeS ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય છે.
- ગુજરાત પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે.
- “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર” અન્વયે સ્વસ્થ દ્રષ્ટિ માટે પ્રાકૃતિક ખેતીથી પકવેલ સ્વસ્થ ખોરાક અપનાવીએ.
- ટ્રસ્ટ બેઇઝડ ગવર્નન્સ-ઇઝ ઓફ લિવિંગની સંકલ્પના ગુજરાતે સાકાર કરી છે.
- મેડિકલ ઓક્સિજનના જનરેશન, સ્ટોરેજ અને સપ્લાયની બાબતમાં ગુજરાતે આત્મનિર્ભરતા કેળવી છે.
- સહકારી ક્ષેત્રે રિડિફાઇન, રિઇવેન્ટ અને રિફોર્મની વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાકાર કરવા ગુજરાતનો સહકાર વિભાગ સજ્જ છે.

(મુખ્યમંત્રીશ્રીએ આપેલાં વિવિધ વક્તવ્યોના સંકલિત અંશો)



16 કવર સ્ટોરી

ગુજરાતની નવી IT પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી

06 આરોગ્ય સુધા

મોતિયા - અંધત્વમુક્ત ગુજરાત બનાવવાનો શંખનાદ

08 "મિશન ઇન્દ્રધનુષ 4.0"

09 ૧૦ કરોડ વેક્સિનેશન ડોઝ - અમિતસિંહ ચૌહાણ

11 સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ બન્યો

કોરોના વોરરૂમ - મહેન્દ્ર વેકરિયા

13 ૧૯ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ

15 ચિંતન

ગુજરાતનું સહકારી ક્ષેત્ર દેશભરમાં નમૂનેદાર

20 પ્રતિભાવ

કેન્દ્રીય બજેટ આત્મનિર્ભર ભારતને સાકાર કરશે: CM

22 અભિયાન

ગરીબ કલ્યાણમોળા વિકાસને નવી ગતિ આપશે

23 શ્રદ્ધાસુમન

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ - ડી. ડી. કાતરીયા

24 વિરાસત

વડનગર : વિસ્મયભરી વિરાસત... - રમેશ ઠક્કર

25 વડનગરમાં પ્રવાસન વિકાસ કાર્યોની સમીક્ષા

26 શિક્ષણજ્યોત

નવા ભારતના નિર્માણ માટે નવી શિક્ષણનીતિ



14 વિકાસગાથા

ઘોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્ય-તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે



28 સૌર ઊર્જા

વડોદરામાં ઓવરબ્રિજ સોલર રૂફટોપ - દર્શન ત્રિવેદી



41 ગૌરવ

ખીજડિયા રામસર સાઇટ જાહેર - વિરેન્દ્રસિંહ પરમાર

29 પ્રવાસન

નડાબેટના સીમાદર્શન પ્રોજેક્ટનાં કામો પૂર્ણતાના આરે

30 આસપાસ

32 વિશેષ

34 સમાચાર વિશેષ

40 અન્ન સુરક્ષા

ભોજનની શુદ્ધતાની ચકાસણી કરતી FRL - વિપુલ ચૌહાણ

42 સાફલ્યગાથા

દાડમની ખેતીમાંથી મબલખ કમાણી - હેમલતા પારેખ

42 સરકારી સહાયથી વ્યવસાય ફુલ્યો ફાલ્યો - મહેન્દ્ર પરમાર

43 'વેસ્ટ'માંથી 'બેસ્ટ' સર્જન - રાજ લક્કડ

44 સંજીવની સાબિત થતી પ્રાકૃતિક કૃષિ - સુરેશ મિશ્રા

45 નિર્ણય

46 પારિજાત

ગીતા એક મહાજ્ઞાન - ડૉ. અશોક નારાયણ

47 આંસુની ઓળખ... - નીલમ દોશી

48 કોણ આવી પોંખશે ? - ઉમેશ જોશી

49 ...તરફ છે જવાનું - વિનોદ ગાંધી



ગુજરાતને અનેક વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવું કેન્દ્રીય અંદાજપત્ર...

આનંદ અને ઉત્સાહની છડી પોકરતી વસંત ઋતુના પગરણ મંડાઈ ચૂક્યા છે. પ્રકૃતિ સોળે કળાએ ખિલી છે. વસંતના આગમનની સાથે જ પ્રકૃતિએ પણ પોતાનો અનોખો અંદાજ પ્રદર્શિત કર્યો છે. કોરોનાનો કહેર ઓસરવા લાગ્યો છે. વસંતના થનગનાટ સાથે દેશના અર્થતંત્રના પાના પણ ફરફરતા આવકનાં હિસાબો અને નવા વર્ષનાં જનહિતના કાર્યો માટે થનારા ખર્ચના અંદાજો મૂકી વિકાસની દિશા નક્કી કરે છે. આ વર્ષનું કેન્દ્રીય બજેટ નિઃસંદેહપણે ભારતનાં ભાવિનું સીમાચિહ્ન સાબિત થવાનું છે. કોરોના કાળમાં નાગરિકો પર કોઈ આર્થિક બોજ નાંખ્યા વિના આત્મનિર્ભર ભારતના સોણલાને સાકાર કરનારૂ વર્ષ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર સર્વપોષક અને સર્વ સમાવેશ બની રહેશે.

કેન્દ્રીય બજેટમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીફ્ટ સિટી, હિરા ઉદ્યોગ, નદીઓનાં આંતર જોડાણ, નવા રેલવે પ્રોજેક્ટ્સ તેમ જ ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓનાં સર્વગ્રાહી વિકાસ અને ઉત્થાનની પ્રતિબદ્ધતા તેમાં સુપેરે જોવા મળે છે. કેન્દ્રીય બજેટ વિશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યથાર્થ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત પર્વે ૨૪ થયેલું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આગામી ૨૫ વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઈ જવાનો પાયો નાંખનારૂ બની રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને આઈ.ટી. ક્ષેત્રે અગ્રેસર બનાવવાના લક્ષ્ય સાથે તાજેતરમાં આઈટી-આઈટીઈએસ પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસીથી ગુજરાતમાં આઈટી ક્ષેત્રે રોજગારીની નવી તકોનું નિર્માણ થવાનું પાકુ છે વળી નિકાસને પણ પ્રોત્સાહન મળવાનું છે. આ સાથે, એમાં રાજ્યનાં સ્કીલ્ડ યુવાધનને સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દેશને અંધત્વથી મુક્ત કરવાનો નિર્ધાર છે. આને ફળિભૂત કરવા ગુજરાત સુપેરે તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં અંધત્વનાં દરમાં ઘટાડો કરવા અને રાજ્યનાં તમામ નાગરિકો આંખનાં દર્દથી મુક્ત બને તે માટે નક્કર કામ શરૂ કર્યું છે. તાજેતરમાં અંધત્વમુક્ત ગુજરાત અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો. આ અભિયાનને પૂર્ણ કરવા રાજ્યમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન સાધનો વસાવવાનો આગોતરો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ ઉપરાંત, ગુજરાતે ૧૦ કરોડ કોવિડ વેક્સીનનો ડોઝ પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે અને ઉલ્લેખ પણ કરવો રહ્યો. ગુજરાત પ્રતિ મિલિયન વેક્સીનેશનમાં દેશભરમાં અગ્રેસર છે. વેક્સીનેશનની આ અદ્વિતીય કામગીરીના કારણે જ આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં જોવા મળી રહી છે.

ગુજરાત પાશ્ચિમના સુજ્ઞ વાયકોને જણાવતાં આનંદ થાય છે કે, આ અંકથી અમે આપના માટે 'પારિજાત'ના પાને ગુજરાતનાં ભવ્ય સાહિત્યિક વારસાને ઉજાગર કરવા જઈ રહ્યાં છીએ. જેમાં ટૂંકી વાર્તા, કવિતા, અભ્યાસ લેખ વગેરેનો સાહિત્યિક રસથાળ પીરસવામાં આવશે. અમને વિશ્વાસ છે કે આ કોલમ વાયકોને ગમશે. આ ઉપરાંત પ્રસ્તુત અંકમાં આ સાથે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા જનહિતલક્ષી નિર્ણયો, ગૌરવપૂર્ણ બાબતો અને ગુજરાતની કલ્યાણકારી યોજનાકીય બાબતોને વણી લેવામાં આવી છે.

જય જય ગરવી ગુજરાત...

- ડી.પી. દેસાઈ આઈ.એ.એસ.
માહિતી નિયામક

મોતિયા - અંધત્વમુક્ત ગુજરાત બનાવવાનો શંખનાદ

માનવશરીરમાં આંખ ખૂબ જ મહત્વનું અને નાજુક અંગ છે. સાહિત્યકારની દૃષ્ટિએ આંખ એ હૃદયના ભાવોનો દસ્તાવેજ છે. અન્યના હૃદય સુધી પહોંચવાનો રસ્તો અને અભાણ વાંચી શકે તેવી ભાષા પણ છે. જે આંખથી આપણે સુંદર દુનિયા જોઈ શકીએ છીએ તે જ રતનરૂપી આંખોનું જતન જરૂરી છે. માનવશરીર જેમ જેમ વૃદ્ધત્વ તરફ જાય તેમ તેમ શરીરમાં જુદી-જુદી બીમારીઓ આવતી હોય છે. પ્રૌઢ કે વૃદ્ધ લોકો મોતિયાની પરેશાનીનો સામનો કરતા જોવા મળતા હોય છે. ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને ‘મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત’ બનાવવાનું અભિયાન ગાંધીનગરથી રાજ્યવ્યાપી શરૂ કર્યું હતું. આ અભિયાનને સાર્થક કરવા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. આ માટે આશા વર્કર બહેનો ઘરે-ઘરે સર્વે કરીને મોતિયાના દર્દીઓને તાલુકા લેવલ પર રિફર કરશે, ત્યાર બાદ જરૂર જણાયે જિલ્લા હોસ્પિટલ પર દર્દીઓને રિફર કરીને તેઓની આંખનું વિનામૂલ્યે ઓપરેશન કરાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોતિયા - અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી વર્ષ

૨૦૨૫ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫ ટકા સુધી લઈ જવાનું ધ્યેય દર્શાવ્યું છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ૨૦૧૪માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર ૦.૭ ટકા હતો તે ઘટીને ૨૦૧૮-૧૯માં ૦.૩૬ ટકા થયો છે. મુખ્યમંત્રીશ્રીએ આંખની તથા મોતિયાવિદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી.

મોતિયાની અસર સામાન્ય રીતે ૫૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મૂકાવીને કરાવી શકાય છે. ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦૦૦થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે.

સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦થી ૫૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઈમ્પ્લિફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં





પોરબંદર જિલ્લાનાં છ ગામો બન્યા મોતિયામુક્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોતિયા-અંધત્વમુક્ત ગુજરાતની ઝુંબેશનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જે સંદર્ભે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં ઘર-ઘર સર્વે માટે ૧૮૦થી વધુ આશા વર્કર બહેનોની ટીમ તૈયાર કરવામાં આવી છે. હાલ જિલ્લાનાં છ ગામોને મોતિયા-અંધત્વમુક્ત જાહેર કરાયાં છે, જ્યારે અન્ય ગામોનો સર્વે હાથ ધરાશે. જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લામાં ઘર-ઘર સર્વે માટે આશાબહેનોને તાલીમ આપી ઈ-ચાર્ટ અપાયા છે. આંખ વિભાગનાં ડૉ. વિભૂતિબહેન કોરિયાએ કહ્યું કે, પોરબંદર જિલ્લાને મોતિયા-અંધત્વમુક્ત કરવા અમે કટિબદ્ધ છીએ. હાલ છ ગામ એવાં છે, જ્યાં મોતિયાના એકેય કેસ નથી, જેથી તે ગામને કેટરેક્ટ બેકલોંગ ફ્રી જાહેર કરાયાં છે, જ્યારે અન્ય ગામોનો સર્વે હાથ ધરાશે.

વિનામૂલ્યે કરવામાં આવે છે.

એટલું જ નહીં, સમગ્ર દેશમાં હાઈડ્રોફોબિક ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પૂરું પાડનારું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં મોતિયાના કારણે અંધ હોય તેવી વ્યક્તિઓની શસ્ત્રક્રિયા કરીને મોતિયા અંધત્વમુક્ત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના આ નિર્ધારને સંપૂર્ણતઃ પાર પાડવા પ્રતિબદ્ધ છે. રાજ્યમાં બિય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દૃષ્ટિ બંને આંખે ૩ મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુક્ત ગુજરાતની આ ઝુંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યું છે. રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં ૧૮ વર્ષ સુધીનાં બાળકોની દૃષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતાં તમામ બાળકોને વિનામૂલ્યે ચશમાં વિતરણ કરવામાં આવે છે .

મુખ્યમંત્રીશ્રીએ દૃષ્ટિ તેવી સૃષ્ટિની વિભાવના સમજાવતાં કહ્યું કે, સ્વસ્થ દૃષ્ટિ માટે સ્વસ્થ ખોરાક પણ એટલો જ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ ખોરાક, રાસાયણિક ખાતરમુક્ત ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક ખેતીનું જે આહ્વાન કર્યું છે તેને અપનાવી સ્વસ્થ ખોરાકથી સ્વસ્થ દૃષ્ટિ અને સ્વસ્થ-સમૃદ્ધ ગુજરાતની નેમ પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો. આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથારે મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં

રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ દ્વારા નાગરિકોને દૃષ્ટિ આપવા માટે હાકલ કરી હતી. મંત્રી શ્રીમતી સુથારે ઉમેર્યું કે, સામાન્ય રીતે ૫૦ વર્ષ ઉપરના લોકોમાં મોતિયાના કેસ જોવા મળે છે. આવા નાગરિકોને શોધીને છેવાડાના વિસ્તાર સુધી સ્કીનિંગ કરીને મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે કરી મોતિયા અંધત્વમુક્ત ગુજરાતના પ્રયાસો રાજ્ય સરકાર કરશે. આપણાં બાળકોની પણ દૃષ્ટિની ચકાસણી માટે પ્રતિ વર્ષ યોજાતા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચકાસણી કરવામાં આવે છે અને પ્રતિવર્ષ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ચશમાંનું વિતરણ પણ કરવામાં આવે છે.

ઉંમર વધતાં દૃષ્ટિની ખામી સર્જતી હોય છે. ૫૦ વર્ષની ઉંમર બાદ મોતિયાનું ઓપરેશન કરાવવું પડતું હોય છે. જો તે ન થાય તો સમય જતાં દૃષ્ટિહીનની ખામી સર્જાય છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને મોતિયા - અંધત્વથી મુક્ત કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં આશાબહેનો અને આરોગ્યની ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી આંખોની તપાસ કરી જરૂરિયાતમંદને સ્વૈચ્છિક સંસ્થાઓ/હોસ્પિટલો સુધી પહોંચાડી સારવાર અપાવશે, જે માટે આશાબહેનોને રૂ. ૩૫૦ની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

આરોગ્યના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર સુશ્રી રેમ્યા મોહન, કલેક્ટર શ્રી કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર શ્રી ધવલ પટેલ સહિત લાભાર્થીઓ, તબીબો અને આરોગ્ય સેવાકર્મીઓ આ ઝુંબેશમાં જોડાયા હતા. ●

"મિશન ઇન્દ્રધનુષ ૪.૦"



દેશની આવતીકાલ સમાન બાળકો અને સગર્ભા માતાઓને 12 જેટલા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા વર્ષ 2014થી મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ રસીકરણ કરવામાં આવે છે. હાલ, ૧૨ જેટલા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે ૨ કરોડ ૬૦ લાખ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનુર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફલ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપાનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ અભિયાનના ચોથા તબક્કાનો તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં સગર્ભા બહેનો અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ 4.0 - ચોથા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યોના દૂર-સૂદૂર અને આંતરિયાળ વિસ્તારો સુધી મિશન ઇન્દ્રધનુષ ઝુંબેશ પહોંચે તે દિશામાં લોકભાગીદારીથી કામગીરી હાથ ધરવા તમામ રાજ્યોને મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ અનુરોધ કર્યો હતો.

કોરોના મહામારી વચ્ચે 170 કરોડ કોરોના રસીકરણ સાથે ભારત દેશે સમગ્ર વિશ્વમાં સહિયારા પ્રયાસોનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. આજે વિશ્વના અન્ય દેશો ભારતના કોરોના

રસીકરણ મહાઅભિયાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

વર્ષ 2014 અગાઉ વિવિધ પ્રકારની રસીનું પ્રમાણ 43 ટકા હતું જે આજે દેશભરમાં 76 ટકા સુધી પહોંચ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આરંભેલા મિશન ઇન્દ્રધનુષમાં દેશના 90 ટકા થી વધુ લોકો સુધી રસીનો લાભ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દેશના અન્ય રાજ્યોના સહિયારા પ્રયાસો સાથે કટિબદ્ધ છે તેમ શ્રી માંડવિયાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં આરંભ થયેલા મિશન ઇન્દ્રધનુષ 4.0. ત્રણ તબક્કામાં 7 ફેબ્રુઆરી, 7 મી માર્ચ અને 4 એપ્રિલ ના રોજ કાર્યરત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં સગર્ભા બહેનો અને બાળકોને આવરી લઈ આરોગ્ય સંલગ્ન વિવિધ રસીઓ આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયુ, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી, રૂબેલા જેવા ધાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવશે.

રાજ્યમાં અગાઉ મિશન ઇન્દ્રધનુષના ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કુલ 9,61,380 બાળકો અને 2,05,925 સગર્ભા સ્ત્રીઓને 1,94,193 વધારાના રસીકરણ/મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી દ્વારા IMI 4.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષ-4.0 લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિમિષાબેન સુથાર, આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરે, NHMના ડાયરેક્ટર શ્રીમતી રેમ્યા મોહન, અધિક નિયામક શ્રી ડો. નયન જાની વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. ●

કોરોનાને મહાત આપવા ગુજરાતનું આગેકદમ ૧૦ કરોડ ઉપરાંત વેક્સિનેશન ડોઝ અપાયા

✍ અમિતસિંહ ચૌહાણ

કોરોના સામેનાં જંગમાં ગુજરાતે મક્કમતાપૂર્વક સામનો કર્યો છે. આ મક્કતામાં કોરોનામાંથી સાજા થતા લોકોની વધતી સંખ્યામાં દેખાય છે. રસીકરણમાં ગુજરાતે સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે

ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ ૧૦ કરોડ ડોઝની સિદ્ધિ સંદર્ભે અમદાવાદના સનાથલ ગામમાં 'હર ઘર દસ્તક' દઈ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો.

ગુજરાતમાં કોરોના રસીકરણના ૧૦ કરોડ ડોઝ થયા હોવાના અવસરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સનાથલ ગામ થકી રાજ્યના તમામ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. રાજ્યમાં કોરોના રસીકરણના ૧૦ કરોડ ડોઝ પૂર્ણ થવાની અદ્વિતીય સિદ્ધિ બદલ મંત્રીશ્રીએ રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકો પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દેશભરમાં શરૂ થયેલા કોરોના રસીકરણ

કોરોનાની ત્રીજી લહેરમાં
રાજ્યના દર્દીઓનો
હોસ્પિટલાઇઝેશન દર
નીચો રાખવા રસીકરણ
આશીર્વાદરૂપ સાબિત થયું

મહાઅભિયાન સંદર્ભે અકલ્પનીય કામગીરી 'ગુજરાતે કરી બતાવ્યું છે - ૧૦ કરોડ ડોઝ' રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશનાં મોટાં રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું મંત્રીશ્રીએ ગૌરવભરે જણાવ્યું હતું.

આરોગ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીમાં

સમગ્ર રાજ્યે એકજૂથ થઈને કોરોના રસીકરણને આવકારી આ સિદ્ધિને સિદ્ધ કરી છે તેમ જણાવી રાજ્યના તમામ કોરોના વૉરિયર્સ, હેલ્થકેર વર્કર્સ, આંગણવાડી કાર્યકરો અને નાગરિકો ૧૦ કરોડ ડોઝની સિદ્ધિ સંદર્ભે અભિનંદન પણ આપ્યાં હતાં.

આવો જાણીએ કેવી રહી ૧૦ કરોડ રસીકરણની સફર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

૧૨મી જાન્યુઆરી-૨૦૨૧ના રોજ સૌપ્રથમ વખત ગુજરાતને ભારત સરકારશ્રી તરફથી કોવિડ-૧૯ રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો. સમગ્ર દેશમાં ફન્ટલાઈન વર્કરોનું રસીકરણ શરૂ કરનારું ગુજરાત



પ્રથમ રાજ્ય છે. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટલાઈન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું.

ભારત સરકારની સૂચના મુજબ ૧ માર્ચ, ૨૦૨૧થી આખા દેશની સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ની રસીકરણ શરૂ કરવામાં આવી. ૧લી એપ્રિલ, ૨૦૨૧થી ૪૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.

૧લી મે, ૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યનાં ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લામાં ૧૮-૪૪ વર્ષ વય જૂથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ



૪થી જૂન, ૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વયજૂથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

૩ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રાજ્યના ૧૫થી ૧૭ની વયના તરુણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઈ. ૧૦મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ.

ઈન્ડિયા ટુડે હેલ્થગિરિ અવોર્ડ્સ ૨૦૨૧ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા ગુજરાતને 'રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાન'ના વિજેતા તરીકે જાહેર કરી એનાયત કરવામાં આવ્યો છે. ●



‘કોરોનાની મહામારીથી બચવા માટે મેં રસીના બંને ડોઝ લીધા છે. ૧૫ વર્ષથી ઉપરની ઉંમર તમામ યુવાનોને હું કોરોના પ્રતિરોધક રસી લેવા માટે અનુરોધ કરું છું. રસીકરણથી જ કોરોના સામે સુરક્ષા મળી રહે છે. જે લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને કોરોના વાયરસની ખૂબ જ ઓછી અસર થાય છે. તેથી, કોરોનાથી બચવા માટે ફરજિયાત રસીકરણ કરાવવું જોઈએ.’

જૈમિનકુમાર ધીરજભાઈ ચૌહાણ, પાટણ



‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારશ્રી દ્વારા કોરોનાને હરાવવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાથસહકાર આપવા અને મારી જાતને કોરોનાથી બચાવવા માટે મેં કોરોનાના બંને ડોઝ લીધા છે, જ્યારે કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હતી ત્યારે તેનાથી બચવા માટે રસીકરણ જ એક ઉપાય હતો અને આજે પણ રસીકરણ જ કોરોનાનો એકમાત્ર અસરકારક ઉપાય છે. આજે રસીકરણના કારણે જ હું અને મારો પરિવાર સુરક્ષિત છીએ એમ હું માનું છું.’

રેવીબહેન નારણભાઈ મકવાણા, પાટણ



‘કોરોના પ્રતિરોધક રસી મૂકાવ્યા પછી પણ હું નિયમિત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશ, કોરોના પ્રતિરોધક રસી મૂકાવીને હું કોરોના સામે સુરક્ષિત બન્યો છું, છતાં જાહેરમાં માસ્ક પહેરવાનું ચાલુ રાખીશ, ભીડભાડવાળી જગ્યાઓમાં જવાનું ટાળીશ. કોરોના સામે મને સુરક્ષાકવચ પ્રદાન થયું છે. વેક્સિનેશનના કારણે હવે ભય વિના હું સ્કૂલ જઈને મારો અભ્યાસ કરી શકીશ.’

જય સીડા, પોરબંદર



‘ઘરના તમામ સભ્યોએ અગાઉ રસી મૂકાવી દીધી હતી અને આજે મને પણ રસી લાગતાં ખુશ છું. કોરોના સામેની લડાઈમાં દરેક લોકોએ રસીકરણ કરાવવું આવશ્યક છે. પ્રથમ ડોઝ લીધા બાદ મને કોઈ તકલીફ કે આડઅસર થઈ નથી અને તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમને શાળામાં વિનામૂલ્યે રસી આપવામાં આવી છે.’

નિરાલી તિવારી, સુરત

સુરત સિવિલનો માઈક્રોબાયોલોજી વિભાગ બન્યો કોરોના વોરરૂમ



મહેન્દ્ર વેકરિયા

કોરોના મહામારીમાં લોકોને સુરક્ષિત રાખવામાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન્સનો મોટો ફાળો છે. આ ફન્ટલાઈન કોરોના વોરિયર્સે કોરોનાકાળમાં

લોકોની સેવાશુશ્રૂષા કરી છે. તેના કારણે જ ગુજરાતમાં ત્રીજી લહેરમાં આપણે હેમખેમ પાર ઊતરી રહ્યા છીએ. ત્રીજી લહેરમાં સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગમાં જાન્યુઆરી માસ દરમિયાન ૧૦૬ જેટલા તબીબો અને ટેકનિશિયનોની ટીમ દ્વારા ૧.૬૦ લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન આ એક-એક કર્મીઓ દ્વારા સતત દૈનિક ૧૨થી ૧૫ કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી.

કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય, સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ૨૪x૭ કામગીરી કરી રહ્યા છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજિત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી રોજના સરેરાશ ૭૦૦૦થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે.

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશિયન સ્ટાફ, કમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૧૦૬ કર્મચોગીઓ RT-PCR ટેસ્ટિંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યા છે અને દૈનિક ૭૦૦૦થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યા બાદ જ ડૉક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સયોટ ટેસ્ટિંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે, જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેનન્સની જવાબદારી પણ વધી ગઈ છે, પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે.

એક માસમાં
1.60 લાખથી વધુ
RTPCR ટેસ્ટ કરાયા

માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડૉ. સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી, તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યા છે.

ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટિંગનું ભારણ વધતાં સ્ટાફની સાથે પોતે પણ દિવસ - રાત જોયા વગર ફરજ અદા કરી છે. સમયસર કોવિડ-૧૯નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેનાથી ટેસ્ટિંગ કામગીરીમાં ઘણી રાહત થઈ છે.

ડિપાર્ટમેન્ટમાં ૪૯ ટેકનિકલ સ્ટાફ, ૧૦ સર્વન્ટ, ૧૮ ડૉક્ટર, ૨૯ ડેટા ઓપરેટર મળી કુલ ૧૦૬ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યો છે, જેમાંથી ૧૨ જેટલા કર્મચોગીઓ કોરોના સંક્રમિત થયા હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે.



કોરોનામાં પિતાને ગુમાવ્યા છતાં ફરજમાંથી ન ડગ્યા

લાલ દરવાજા સિટી સેન્ટર સોસાયટીમાં રહેતાં અને નવી સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડૉ. ડિમ્પલ જેઠવા ચૌહાણે જણાવ્યું હતું કે, કોવિડની શરૂઆતથી જ માઈક્રોબાયોલોજી લેબમાં

ટેસ્ટિંગ અને રિપોર્ટિંગમાં ફરજ બજાવી રહી હતું. કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત પિતાની છત્રછાયા ગુમાવી હતી, જેથી કોરોનાથી થોડો ડર જરૂર લાગતો હતો, પરંતુ ફરજની વાત આવી ત્યારે કોરોનાનો મક્કમ સામનો કરવા તૈયાર થઈ ગઈ હતી. મારા ૭ વર્ષના દીકરા શિવ અને ૧૩ વર્ષની દીકરી ખનક બંને ભાઈબહેનને પણ કોરોના થતાં હિંમત હારી ગઈ હતી, પણ તેઓની સારસંભાળ, કાળજી લેવાની સાથે કોવિડમાં પોતાની ફરજ

બજાવવા માટે તત્પર રહી છું. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો થતાં રાત-દિવસ કામગીરી કરી છે, જેમાં પરિવારના તમામ સભ્યોએ સાથસહકાર આપ્યો છે, જેથી પરિવારની પણ આભારી છું.

બે વાર કોરોના થયો છતાં નિષ્ઠા અડગ



ન્યુ સિટીલાઈટ નેવિલ પાર્ક સોસાયટીમાં રહેતાં અને માઈકોબાયોલોજી વિભાગમાં ટ્યુટર તથા ફેકલ્ટી તરીકે સેવા આપતાં ડૉ. પૂર્વી મોદીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવી રહી છું. કોરોનાકાળમાં ટ્યુટરની ફરજ સોંપવામાં આવી ત્યારે કોરોનાનો ભય સતાવતો હતો, પરંતુ સમય જતાં નક્કી કર્યું કે કોરોના સાથે રહીને જ નોકરી કરવાની છે, મક્કમ મનોબળ રાખતાં ડર ગાયબ થઈ ગયો હતો. હું પહેલી અને ત્રીજી લહેરમાં કોરોનાગ્રસ્ત બની હતી, પરંતુ સ્વસ્થ થઈને પુનઃ ફરજ પર હાજર થઈ હતી. તાજેતરમાં મારા બંને દીકરા દેવ અને કવિશને કોરોના થતાં ફરજ અને દીકરાની સારસંભાળ રાખવાનું મારા માટે મુશ્કેલ બની ગયું હતું, પરંતુ ડ્યુટી નિભાવવાની પણ મારી નૈતિક ફરજ હતી, જેથી નોકરી પૂર્ણ કરી હું બાળકોની સારસંભાળ લેતી હતી.

એક સમય એવો પણ આવ્યો કે મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. છતાં સૌ સભ્યોને કોરોનાને હરાવવામાં સફળતા મળી હતી.

સતત ત્રણ શિફ્ટમાં કામ કર્યું



કતારગામની સ્મૃતિ સોસાયટીમાં રહેતાં તથા સિવિલ હોસ્પિટલમાં ૪ વર્ષથી ફરજ બજાવતાં ડૉ.યોગિતાબહેન મિસ્ત્રીએ જણાવ્યું કે, કોરોનાની શરૂઆતથી જ માઈકોબાયોજી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહી છું. મારા ઘરની આજુબાજુના લોકોને પરેશાની ન થાય એના માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પરિવાર સાથે રહી ફરજ નિભાવી રહી છું. કોરોના પછી સિવિલ કેમ્પસમાં રહ્યા બાદ એક વાર પણ ઘરે પરત ગયા નથી. ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં કોરોના ટેસ્ટિંગ વધતાં ત્રણ શિફ્ટમાં ડર કલાક પણ ફરજ નિભાવી છે. ત્રીજી લહેરમાં ૭૦૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવતા હતા. હજુ પણ સ્ટાફના સહયોગથી કોવિડ ટેસ્ટિંગની જવાબદારી ઉત્સાહથી નિભાવી રહ્યાં છીએ. ●

ઇન્ટર-ઓપરેબલ કિમિનલ જસ્ટિસ સિસ્ટમના અમલ અને રેન્કિંગમાં ગુજરાતે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો

ગુજરાતના જેલ વિભાગને 'ગુડ પ્રેક્ટિસિસ ઓન કાર્મ કિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS'ની વાર્ષિક મીટિંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-અવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન અવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવે કરી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે NIC દ્વારા આ CCTNS પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ICJS પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે. આ પોર્ટલ પર રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ, કોર્ટ, પ્રિઝન્સ, ગુનામાં સંડોવાયેલાં વાહનો, ગુમ/બિનવારસી વ્યક્તિઓની માહિતી, વિઝા-પાસપોર્ટ, કેન્દ્રીય એજન્સીઓ, એફ.એસ.એલ, પ્રોસિક્યુશન, એલીસ (આર્મ્સ લાઇસન્સ) વિભાગોના ડેટાનો વિનિમય કરીને તપાસ કરનાર એજન્સીને એક જ ડિજિટલ સિક્યોર પ્લેટફોર્મ ઉપર ડેટા જોઈ શકે તેવી વ્યવસ્થા કાર્યાન્વિત કરેલી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ સીસીટીએનએસ-આઈ.સી.જે. એસ.પ્રોજેક્ટ હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ અમલીકરણ અંગેના અવોર્ડની થયેલી જાહેરાતમાં આઈ.સી. જે.એસ. પ્રોજેક્ટ હેઠળ વિવિધ સ્તંભો પોલીસ, પ્રિઝન, એફ. એસ.એલ., પ્રોસિક્યુશનમાં કરેલી કાર્યવાહી અંગેના અવોર્ડ અન્વયે દેશના ૩૭ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રેષ્ઠ અમલીકરણ બદલ પ્રિઝન સ્તંભમાં ગુજરાતને દ્વિતીય ક્રમનો અવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ અવોર્ડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પ્રસ્તુત કરવાના અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ રાજ્યની જેલોના વડા અને અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવના પુસ્તક 'જેલ ઇતિહાસ અને વર્તમાન'ના અંગ્રેજી સંસ્કરણ 'જેઈલ-પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ' પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ અગાઉ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ●

૧૯ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરતા CM



કોરોનાની ત્રીજી લહેરના સામનાની તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યો ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪ જનરલ હોસ્પિટલો, ૯ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તથા એક કોવિડ કેર સેન્ટર ખાતે PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જે અનુસાર 2000, 1000, 500 LPM એમ જુદી જુદી કેપેસિટીના કુલ ૧૯ જેટલા પ્લાન્ટ કુલ રૂ. ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હતા, જેનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.

કોરોના મહામારીની ત્રીજી લહેર સામે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ કર્યું અને દેશવાસીઓને રક્ષાકવચ આપ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯.૭૬ કરોડથી વધુ રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. આમ છતાં રાજ્ય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે PSA પ્લાન્ટની સુવિધા વ્યાપક બનાવી છે. દુનિયાનાં વિકસિત અને આધુનિક શહેરોમાં જેની ગણના થાય છે તેવા અમદાવાદના નગરજનોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરવા માટે એકસાથે 19 ઓક્સિજન જનરલ પ્લાન્ટ અમદાવાદના નગરજનોને મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરેલા આ પ્લાન્ટ અમદાવાદની ત્રણ મોટી જનરલ હોસ્પિટલ, ૯ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને એક કોવિડ કેર સેન્ટર ખાતે લગાવવામાં આવ્યા છે. ૫૦૦ થી ૨૦૦૦ લિટરની કેપેસિટી ધરાવતા આ પ્લાન્ટ જરૂરિયાતના સમયે દર્દીઓની ઓક્સિજનની માગને પૂરી પાડશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સદ્ભાગ્યે ત્રીજી લહેર દરમિયાન આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી. આની પાછળનું

મુખ્ય કારણ ગુજરાતમાં ચાલુ રહેલું વ્યાપક રસીકરણ અભિયાન છે અને જેના પરિણામે રાજ્યમાં દર્દીઓનું હોસ્પિટલાઈઝેશન ઓછું થયું અને ઓક્સિજનની જરૂર પણ ઓછી પડી છે.

કોરોનાની પ્રથમ બે લહેરના અનુભવમાંથી આપણે ગુજરાતની હોસ્પિટલોને મેડિકલ ઓક્સિજનની વ્યવસ્થા બાબતે આત્મનિર્ભર બનાવવાનું આયોજન રાખ્યું હતું, જેની તૈયારીના ભાગરૂપે હાલમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં 445 psa પ્લાન્ટ કાર્યરત છે. તથા પી.એમ.કેર્સ ફંડ અંતર્ગત ગુજરાત માટે ૮૯.૯૧ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા 59 પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જેમાં તમામ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓના ફંડમાંથી પણ 55 psa પ્લાન્ટ રાજ્યોની આરોગ્ય સંસ્થાઓને મળ્યા છે. આ પ્લાન્ટની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા લગભગ ૩૧.૩૯ મેટ્રિક ટન છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે મોદીજીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે. મેડિકલ ઓક્સિજનના જનરેશન, સ્ટોરેજ અને સપ્લાયની બાબતમાં ગુજરાતે આત્મનિર્ભરતા કેળવી છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે અનેક પગલાં લીધાં છે, જેમાં સ્વદેશી માસ વેક્સિનેશન, દવાઓ, ઓક્સિજનનું ઉત્પાદન અને રાજ્યોને પણ આરોગ્ય રક્ષાકવચ ઉપાડવા માટે સતત માર્ગદર્શન આપ્યું છે.

અમદાવાદ SVPમાં ૬ પ્લાન્ટ, એલ.જી હોસ્પિટલમાં ૧, શારદાબેન હોસ્પિટલમાં ૧, સમરસ હોસ્પિટલમાં ૨, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ૯ PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કુટિરઉદ્યોગમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરા, મેયર શ્રી કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબહેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ●

ઘોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ-તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે



વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ઘોળાવીરાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુલાકાત લીધી હતી. આ સાથે, મુખ્યમંત્રીશ્રીએ ઘડુલી સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ નેશનલ હાઈવેનાં નિર્માણથી ઘોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે.

આ મુલાકાત પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રવિણા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે, જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા

ઘોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સફળતાને પરિણામે હવે આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળતા વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકૂળ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે.

ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીને ઘોળાવીરાની 5000 વર્ષ જુની આ ધરોહરની વિશેષતાઓ અને હજુ સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તેમજ પ્રવાસીઓને મળી રહેલી માહિતી સહિતની સમગ્રતથા વિગતો પુરાતત્વ

અને સંગ્રહાલય વિભાગના પૂર્વ નિયામક શ્રી યદુવીરસિંહ રાવતે આપી હતી.

ઘોળાવીરાની મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘડુલી સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કુલ 264 કી.મી.ની લંબાઈના આ નેશનલ હાઈવે નંબર 754 Kની ચાર લિંક જેમાં ઘડુલી, ઘોળાવીરા, કચ્છનું સફેદ રણ અને ખાવડાનો સમાવેશ થાય છે તે લિંકના 320 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરાઈ રહેલા માર્ગ નિર્માણ કામો નિહાળ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારે આ નેશનલ હાઈવેનું નિર્માણ હાથ ધરતા હવે ઘોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે. એટલું જ નહિ ઘોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડાને સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવિટી મળતી થશે. આ હાઈવેના નિર્માણથી 100 જેટલી બોર્ડર આઉટ પોસ્ટને પણ આ કનેક્ટિવિટીનો વ્યૂહાત્મક લાભ મળશે. ●



ઘડુલી સાંતલપુર હાઈવેના નિર્માણથી સીમાવર્તી વિસ્તારને માર્ગની સુવિધા મળશે

ગુજરાતનું સહકારી ક્ષેત્ર દેશભરમાં નમૂનેદાર

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન ચિંતન શિબિરની શરૂઆત કરી રાજ્યના વહીવટી તંત્રમાં નવી ઊર્જાનો સંચાર કર્યો. ચિંતન શિબિર દ્વારા જે તે વિભાગના પ્રશ્નો, સમસ્યાનું સમાધાન માર્ગદર્શન મળી રહે છે. તેમજ વિકાસનાં નવાં દ્વાર ખૂલવા માટે મુક્ત મને ચર્ચા કરવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પિપા) ખાતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિરનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિજિટલી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન શિબિરનો આપેલો સફળ અભિગમ આપણે વધુ વેગવંતો બનાવવો છે. સમાન હિત માટે એકસમાન ધ્યેય સાથે સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રના પાયા ઉપર સહકારી ક્ષેત્ર વિકાસનું આગવું મોડેલ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આઝાદી પછી પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે. તેની ભૂમિકા પણ

આપી હતી. દેશના પ્રથમ સહકારમંત્રી પણ ગુજરાતના પુત્ર અમિતભાઈ શાહ છે ત્યારે રાજ્યનો સહકાર વિભાગ કેન્દ્ર સાથે સંકલન સાધી સહકાર ક્ષેત્રનું આગવું મોડેલ દેશમાં બનશે. આ ચિંતન શિબિર માત્ર એક કાર્યક્રમ ન બને, પરંતુ આવનારા દિવસોમાં સહકાર વિભાગની નવી જનહિતકારી અને સહકારપૂર્ણ કાર્યપ્રણાલીને વધુ સંગીન કરનારો રોડમેપ બને તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ સહકાર વિભાગની વેબપોર્ટલનું લોન્ચિંગ પણ કર્યું હતું.

ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ ચિંતન શિબિરમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતાઓને લઈને તજજ્ઞો દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

રાજ્યના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ચિંતન શિબિર અને આઈસીએઆર તેમજ **એગ્રિકલ્ચર ટેકનોલોજી એપ્લિકેશન રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ - અટારી પુણે ખાતે યોજાયેલી 'સ્વસ્થ રાષ્ટ્ર હેતુ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા'**માં ઉપસ્થિત

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એમ ૩ રાજ્યોનાં ૮૨ કૃષિવિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકોને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું.

આ અવસરે રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જૈવિક કૃષિમાં શરૂઆતનાં વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, પરંતુ પ્રાકૃતિક કૃષિ જો યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદન ઘટતું નથી. સહકાર વિભાગે દરેક ખેડૂતો સુધી આ વાતને પહોંચાડીને તેઓને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો કરવા જોઈએ સહકાર વિભાગની આ ચિંતન શિબિરમાં વર્તમાન સમયમાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી કાનૂનમાં આવેલા પરિવર્તન તેમજ સહકારી મંડળીઓની રચનામાં નૂતન અભિગમ અંગે અને મંડળીઓની કામગીરી વધુ લોકઉપયોગી બને તે માટેના વિચારો રજૂ થયા હતા. યુવાનો અને મહિલાઓને સહકારી પ્રવૃત્તિમાં વધુ સક્રિયપણે જોડવા અંગે મનોમંથન સાથે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ ચિંતન શિબિરમાં વિવિધ સહકારી મંડળીઓની કામગીરી, પડકારો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મુજબ કુલ ૨૦ વિષય ઉપર વિચાર-વિમર્શ કરવામા આવ્યું. ઉપરાંત તજજ્ઞો દ્વારા સહકારી પ્રવૃત્તિની વર્તમાન પરિસ્થિતિ તેમજ ભવિષ્યના પડકારો અને આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું.

આ ચિંતન શિબિર દરમિયાન સહકારમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર વિભાગ સચિવ શ્રી નલિન ઉપાધ્યાય, સહકાર કમિશનર શ્રી દિનેશ પટેલ, ઔડા-અમદાવાદના સીઈઓ શ્રી ડી. પી. દેસાઈ, શ્રી કે. બી. ઉપાધ્યાય, શ્રી કે. જી. જોષી, શ્રી એ.કે. અસ્થાના તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ●



ગુજરાતની નવી IT પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાત રાજ્ય વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. આ સાથે, ઘણાં ક્ષેત્રો પ્રગતિના પથ પર છે. આ વિકાસશીલ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમાંથી એક છે આઈ.ટી. અને ઇલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટ-અપ. સ્ટાર્ટ-અપ માટેની શ્રેષ્ઠ તકો ગુજરાતમાં ઉપલબ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઈન ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપ મિશનનાં સપનાંને સાકાર કરવા ગુજરાત અગ્રેસર રહે તે માટે અનેકવિધ પગલાં

ભર્યાં છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગતિશીલ ગુજરાતે અનેક નવી નીતિઓ અમલમાં મૂકી છે. આ જ દોરને મુખ્યમંત્રીશ્રીએ આગળ ધપાવીને IT અને ITeSની નવી નીતિની ઘોષણા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨થી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી જિતેન્દ્રભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નહેરા તેમજ આઈ.ટી. ક્ષેત્રની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નવ જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોન્ચિંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ટેકનોલોજિકલ ક્રાંતિએ આર્થિક અને વ્યાવસાયિક રીતે વિશ્વને બદલી નાખ્યું છે.

આ નવી અને ઊભરતી IT ટેકનોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ



મુખ્યમંત્રીશ્રીએ આ નવી પોલિસીની વિશેષતાઓ પ્રસ્તુત કરી હતી. તદ્ અનુસાર...

- આ નીતિ CAPEX-OPEX મોડેલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ છે: સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. ૫૦ કરોડની મર્યાદામાં ૨૫ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેક્ટ માટે આ મર્યાદા રૂ. ૨૦૦ કરોડ સુધીની રહેશે. દર વર્ષે રૂ.20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂ.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો OPEX સપોર્ટ
- રાજ્યમાં IT રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યાં છે: A) એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI), પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી, B) આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું 100% સુધીનું વળતર
- રૂ. 5 કરોડ સુધીની ટર્મ લોન પર 7% લેખે વ્યાજની ચુકવણી માટે સહાય
- તમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિસિટી જ્યુટીનું વળતર
- IT ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્રોત ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના.
- કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા

- વ્યક્તિદીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.
- ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાનાં બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટા પાયે માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) કાર્યક્રમો કરવામાં આવશે.
- રૂ.100 કરોડ સુધીના CAPEX સપોર્ટ સાથે IT શહેરો/ટાઉનશિપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI ધોરણોમાં છૂટછાટ આપવી.
- કોઈ પણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્વ કક્ષાની સહકાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી.
- સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી IT કંપનીઓને દર મહિને રૂ.10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.
- ક્લાઉડ ટેકનોલોજીના મહત્વને ઓળખીને, સરકારે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે: ડેટા સેન્ટર: રૂ.150 કરોડ સુધી 25%નો CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી, B કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS): રૂ. 20 કરોડ સુધી 25% CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી.



પર નોંધપાત્ર અસરો ઊભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્યનિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણો માટે ફેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે.

એક મજબૂત અને સક્ષમ પોલિસી ફેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઈકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ‘ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITes પોલિસી 2022-23 લોન્ચ કરી છે.

આ નવી પોલિસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૮ સપનાંઓ પૈકીનું એક સપનું ‘બેરોજગારી સે મુક્ત રોજગારી સે યુક્ત’માં મહત્વનું યોગદાન આપનારી બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાત IT અને ITes પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યું કે, હાઈ સ્કિલ્ડ ઉદ્યોગો માટે IT ટેલન્ટ પુલ બનાવવા, અદ્યતન આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે.

એટલું જ નહીં, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ક્વૉન્ટમ કોમ્પ્યુટિંગ, બ્લૉક ચેન જેવી નવી અને ઊભરતી ટેકનોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે. ગુજરાત IT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટ્સમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે.

IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ

ગુજરાતની નવી IT/ITes પોલિસી - ૨૦૨૨-૨૩ની પ્રથમ ફલશ્રુતિ

નવી IT/ITes પોલિસી-૨૦૨૨-૨૩ની પ્રથમ ફલશ્રુતિ રૂપે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક MoU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ સ્ટ્રેટેજિક MoU સાયન્સ ટેકનોલોજી સચિવ શ્રી વિજય નહેરાના માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા. સાયન્સ ટેકનોલોજી ના નાયબ નિયામક અને QX ગ્લોબલ ગ્રૂપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ શ્રી સ્નેહલ પટેલે આ એમ. ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક MoUને આવકાર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. QX ગ્લોબલના ગ્રૂપ સી.ઈ.ઓ શ્રીયુત ફેન્ક રોબિન્સને આ MoU વેળાએ વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં જણાવ્યું કે, અમદાવાદમાં ૨૦૦૩-૦૪માં તેમના સહયોગથી શરૂ થયેલી આ QX ગ્લોબલ હવે ૨૩૦૦ જેટલા આઈ.ટી. સેક્ટરના પ્રશિક્ષિત માનવબળ સાથે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બની છે. આ સ્ટ્રેટેજિક MoUના પરિણામે આગામી વર્ષોમાં આઈ.ટી. ક્ષેત્રે બે હજાર જેટલી રોજગારીનું સર્જન થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને ૨૫ હજાર કરોડ સુધી લઈ જવા અને IT અને ITes ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે. વર્લ્ડ ક્લાસ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઈમર્જિંગ ટેકનોલોજીમાં ઈનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે.

ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ નાણાકીય પ્રોત્સાહનોનું સારાંશ કોષ્ટક

નંબર	ઇન્સેન્ટીવ કેટેગરી	એપ્લીકેબલ એન્ટિટી	નાણાકીય સહાય
1	CAPEX OPEX મોડલ કેટેગરી - I પ્રોજેક્ટ્સ (GFCI < રૂ. 250 કરોડ)	IT / ITeS યુનિટ	CAPEX સપોર્ટ CAPEX ખર્ચના 25%. વધુમાં વધુ રૂ. ૫૦ કરોડ OPEX સપોર્ટ દર વર્ષે રૂ. 20 કરોડ સુધીના પાત્ર OPEX ખર્ચના 15%, 5 વર્ષ માટે
2	CAPEX OPEX મોડલ કેટેગરી - II પ્રોજેક્ટ્સ (GFCI > રૂ. 250 કરોડ)	IT / ITeS યુનિટ અથવા અન્ય ડીમ્ડ મેગા પ્રોજેક્ટ	CAPEX સપોર્ટ CAPEX વધુમાં વધુ રૂ. ૨૦૦ કરોડ સુધી ખર્ચના 25%. OPEX સપોર્ટ દર વર્ષે રૂ. 40 કરોડ સુધીના પાત્ર OPEX ખર્ચના 15%, 5 વર્ષ માટે
3	આઈટી સિટી/ટાઉનશિપ માટે સપોર્ટ	સિટી/ટાઉનશિપમાં IT ઓફિસ માટે જગ્યા	રૂ. 100 કરોડ સુધીના પાત્ર CAPEX ખર્ચના 25%.
4	સરકાર દ્વારા સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર	IT / ITeS યુનિટ	IT/ITeS યુનિટ્સ માટે પેનલવાળી ઓફિસ જગ્યાઓનો ઉપયોગ કરવા 5 વર્ષ માટે માસિક ભાડાની સહાયતા: પ્રથમ 2 વર્ષ - દર મહિને સીટ દીઠ રૂ.10,000 સુધી 50% સપોર્ટ આગામી 3 વર્ષ - દર મહિને સીટ દીઠ રૂ.5,000 સુધી 25% સપોર્ટ
5	સ્કીલ ડેવલોપમેન્ટ	IT પ્રોફેશનલ્સ અને ગુજરાતના સ્નાતક વિદ્યાર્થીઓ	ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા નાણાકીય સહાય પ્રતિ કોર્સ મહત્તમ રૂ. 50,000 સુધી અથવા કોર્સ ફીના 50% સુધી, જે ઓછું હોય તે
6	એમ્પ્લોયમેન્ટ જનરેશન ઈન્સેન્ટીવસ (EGI)	IT / ITeS યુનિટ	પાત્ર IT/ITeS યુનિટ નવા સ્થાનિક કર્મચારીઓ માટે લાગુ થતા નવા રોજગાર સર્જન માટે એક-વખતની સહાય માટે હકદાર રહેશે જે એક વર્ષના લઘુત્તમ સમયગાળા માટે એક મહિનાના CTCના 50% દરે પુરૂષ દીઠ રૂ. 50,000 અને સ્ત્રી કર્મચારી દીઠ રૂ. 60,000 સુધી જાળવી રાખવામાં આવશે.
7	આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય	IT/ITeS યુનિટ્સ	પાત્ર IT/ITeS યુનિટ્સ નીચેના માપદંડોને આધીન EPF હેઠળ એમ્પ્લોયરના સ્ટેચ્યુટરી કોન્ટ્રિબ્યુશન પર વળતરનો દાવો કરવા માટે પાત્ર રહેશે: મહિલા કર્મચારીઓ માટે 100% પુરુષ કર્મચારીઓ માટે 75%
8	વ્યાજમાં સહાય	IT/ITeS યુનિટ્સ	પાત્ર IT / ITeS યુનિટ્સ 5 વર્ષ માટે વાર્ષિક મહત્તમ રૂ.1 કરોડની મર્યાદા સાથે ટર્મ લોન પર 7% સાથેની ઈન્ટરેસ્ટ સબસિડી મેળવવા માટે હકદાર રહેશે.
9	ઇલેક્ટ્રોસિટી ડ્યુટી ઈન્સેન્ટીવ (EDI)	પાત્ર IT/ITeS યુનિટ્સ	ઇલેક્ટ્રોસિટી ડ્યુટીનું 100% વળતર

નંબર	ઇન્સેન્ટીવ કેટેગરી	એપ્લીકેબલ એન્ટીટી	નાણાકીય સહાય
9	R&D પ્રોત્સાહનો R&D incentive	R&D સંસ્થાઓ / R&D કેન્દ્ર	મશીનરી અને ઈકિવપમેન્ટ, હાર્ડવેર અને સોફ્ટવેર (COTS/ લાઇસન્સ) માટેના ખર્ચના 60% નો વન-ટાઇમ CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.5 કરોડ સુધી
10	ડેટા સેન્ટર માટે સપોર્ટ	ડેટા સેન્ટર	માન્ય CAPEX ખર્ચાઓ માટે 25%નો CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.150 કરોડ સુધી OPEX સપોર્ટ - રૂ.1 / યુનિટ પાવર ટેરિફ સબસીડી
11	કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) માટે સપોર્ટ	કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS)	માન્ય CAPEX ખર્ચાઓ માટે 25% નો CAPEX સપોર્ટ, મહત્તમ રૂ.20 કરોડ સુધી OPEX સપોર્ટ - રૂ.1 / યુનિટ પાવર ટેરિફ સબસીડી

ગુજરાતની IT ઈકોસિસ્ટમમાં આ મહત્વપૂર્ણ IT/ITeS નીતિ (2022-27)થી રાજ્યના માહિતી પ્રાદ્યોગિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની કલ્પના છે. ગુજરાતને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી

રાજ્યોમાંનું એક બનાવવા માટે વિવિધ પાસાંઓને વધુ મજબૂત કરી આઈટી ઈકોસિસ્ટમ માટે ગુજરાત ‘ડિસ્ટિનેશન ઓફ ચોઈસ’ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. ●

નવી IT પોલિસી આઈટી ક્ષેત્રે વિકાસ રોજગારી અને નિકાસને પ્રોત્સાહન આપશે વડોદરાના આઈટી ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ IT પોલિસી આવકારી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨થી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી આઈટી પોલિસીને વડોદરાના આઈટી ક્ષેત્રના ઉદ્યોગકારોએ વ્યાપક આવકાર આપ્યો છે.

ફેડરેશન ઓફ આઈટી અસોસિયેશન ઓફ ગુજરાતના (FITAG)ના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણીએ નવી આઈ.ટી પોલિસીને આવકારતાં જણાવ્યું કે રાજ્ય સરકારની નવી આઈટી પોલિસી ખૂબ જ પ્રોત્સાહક છે, જેના પરિણામે આઈટી ક્ષેત્રનો માત્ર વિકાસ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ થશે. આ નવી પોલિસીમાં માત્ર રોકાણ ઉપર નહીં, પરંતુ સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે આઈટી ક્ષેત્રે નવું વાતાવરણ ઊભું થશે અને મહત્તમ રોજગારીનું સર્જન થશે.

તેમણે જણાવ્યું કે આ નવી પોલિસીમાં આઈ.ઈ.સી કન્સેપ્ટ સાથે ઈન્ફર્મેશન એજ્યુકેશન અને કમ્યુનિકેશન દ્વારા પ્રાથમિક કક્ષાનાં બાળકોમાં આઈટી ક્ષેત્રનું જ્ઞાન વધે અને તેની સાથે-સાથે તેઓ IT સાથે જોડાય તેને સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ પોલિસીમાં નવો સ્કિલ બેઝ પુલ ઊભો કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આવકારદાયક છે.



શ્રી હિતેશભાઈ પટણી



શ્રી કિશોર ગોરસિયા



શ્રી રશ્મિકાંત જોશી

બરોડા આઈટી અસોસિયેશનના (BITA)ના પ્રમુખ શ્રી કિશોર ગોરસિયાએ જણાવ્યું કે નવી નીતિમાં CAPEX-OPEX મોડેલનો એક યુનિક કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે જે સમગ્ર દેશમાં આગવી પહેલ છે.

નવી નીતિમાં સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. ૫૦ કરોડની મર્યાદામાં ૨૫ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેક્ટ માટે આ મર્યાદા રૂ. ૨૦૦ કરોડ સુધીની રહેશે, જે અગાઉ માત્ર એક કરોડનો હતો, જેના પરિણામે

SME નિકાસકારોને ફાયદો થવા સાથે મોટા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. નવી નીતિને કારણે આઈટી ક્ષેત્રે રૂ. ૨૫ હજાર કરોડના રોકાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેને પરિણામ સ્વરૂપ એક લાખ જેટલી રોજગારીની તક પણ ઊભી થવાની છે.

બરોડા આઈટી અસોસિયેશનના સચિવ શ્રી રશ્મિકાંત જોશીએ માત્ર વડોદરામાં જ ૪૫૦ જેટલાં આઈટી SME કાર્યરત છે, ત્યારે નવી નીતિને કારણે BPO અને SMEને વિસ્તરણની તક મળશે, જેથી ઉત્પાદન વધશે અને રોજગારીના સર્જન થવા સાથે નિકાસ બહોળી થશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના સહયોગથી નવી નીતિને અમારા અસોસિયેશન મારફત મહત્તમ લોકો સુધી પહોંચાડી માર્ગદર્શન આપવામાં આવશે. નવી આઈટી નીતિ અમલમાં મૂકવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ●

કેન્દ્રીય બજેટ આત્મનિર્ભર ભારતને સાકાર કરનારું છે : CM

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આત્મનિર્ભર ભારતને સાકાર કરનારું અને લોકરંજક બજેટ ગણાવ્યું હતું. બજેટ અંગે પ્રતિભાવ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન દેશના નાગરિકોને ફી-વેક્સિન, જરૂરતમંદોને ફી-રેશન, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ જેવા આરોગ્ય વિષયક અનેક પગલાંઓનો લાભ આપવા છતાં કેન્દ્ર સરકારે

આ બજેટ જનતા પર વધારાના એક પણ રૂપિયાના કરબોજા વગરનું રાખ્યું છે.

કોરોના મહામારીમાંથી સમગ્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાઓ, મહિલાઓ, ખેડૂતવર્ગો, વિદ્યાર્થીઓ, ધંધા-રોજગારકારો, એસ.સી., એસ.ટી., ગરીબ, ગ્રામીણ સૌના સર્વગ્રાહી વિકાસ અને ઉત્થાન માટેની પ્રતિબદ્ધતાવાળા આ બજેટ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી અને નાણામંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યાં હતાં.

આઝાદીના અમૃતપર્વ વર્ષ ૨૦૨૨નું આ બજેટ અમૃત બજેટ આગામી ૨૫ વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઈ જવાનો પાયો નાખનારું બજેટ છે. ભારત આઝાદીના ૭૫થી ૧૦૦ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીની બ્લ્યુ પ્રિન્ટ અને વિકાસનો રોડમેપ આ બજેટમાં હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ બજેટમાં ચાર પ્રાથમિકતાઓ - PM ગતિ શક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે દેશ અને રાજ્યના વિકાસની ગતિને વેગ આપવાનું ધ્યેય આ બજેટમાં રાખવામાં આવ્યું છે. ગુજરાત પી.એમ. ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે અને હજુ પણ દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શુંખલાઓને



કેન્દ્રીય બજેટે હીરાઉદ્યોગમાં પ્રાણ ફૂંક્યા: કટ-પોલિશ્ડ ડાયમંડ પર ડ્યુટી ઘટાડી



કોરોના સંક્રમણને કારણે વિદેશ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગો પર સૌથી મોટી અસર થઈ હતી, જેને લઈને કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી, જેને કારણે ડાયમંડ ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને એ રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં જે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે તેને કારણે હીરાઉદ્યોગમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રીય બજેટે હીરાઉદ્યોગમાં પ્રાણ પૂરવાનું કાર્ય કર્યું છે. ડ્યુટી ઘટાડાથી રોજગારી સર્જાશે. સુરત ડાયમંડ બુર્સમાં રોકાણ આવશે અને વેપાર વધશે.

કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે એ બજેટમાં કટ અને પોલિશ્ડ હીરા તેમજ જેમ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૫% કરી દીધી છે. તેના કારણે સુરત સહિત ગુજરાતના હીરાઉદ્યોગને ફાયદો થશે. હાલમાં આ ડ્યુટી ૭.૫% છે. જેમ સ્ટોન ઉપર પણ ૭.૫% કસ્ટમ ડ્યુટી લાગે છે. આ ઉપરાંત ઈ-કોમર્સના માધ્યમથી જવેલરી એક્સપોર્ટની સુવિધા શરૂ કરવા માટે સરકાર જૂન, ૨૦૨૨માં સિમ્લિફિકેશન ૨૦૨૦લેટર

ફેમવર્ક લઈને આવશે. વિશેષમાં ઈમિટેશન જવેલરી માટે કસ્ટમ ડ્યુટી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કરાઈ છે.

ગિફ્ટ-સિટીમાં ફિનટેક યુનિવર્સિટી અને આર્બિટ્રેશન સેન્ટર સ્થપાશે

ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં વિશ્વકક્ષાની ફિનટેક યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે. ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના માધ્યમથી વિદેશી કંપનીઓને તેમના એકમો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. શ્રીમતી નિર્મલા સીતારમણની આ જાહેરાતનો ફાયદો એ થશે કે આંતરરાષ્ટ્રીય લવાદમાં ઉદ્ભવતા અનેક વિવાદો ઝડપથી ઉકેલાઈ જશે. જો ગિફ્ટ સિટીના IAESCમાં સ્થાપિત કંપનીઓ સાથે કોઈ વિવાદ હશે તો ઓથોરિટીની હાજરીને કારણે મામલો ઝડપથી ઉકેલાશે. હવે આવા કેસ લાંબા સમય સુધી લટકી રહ્યા છે. ગાંધીનગરમાં ફિનટેક ક્ષેત્રે જાણીતી સંસ્થા અથવા યુનિવર્સિટી આવશે જેનાથી દેશમાં ઊભરતી ટેકનોલોજી અને ફાઈનાન્સનો સમન્વય શક્ય બનશે. ઈન્ટરનેશનલ



મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૮૦ લાખ આવાસોનું નિર્માણ આગામી એક વર્ષમાં થવાથી લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થશે. પી.એલ.આઈ. સ્કિમ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં ૬૦ લાખ યુવાનોને રોજગારીના અવસરથી આત્મનિર્ભર ભારત સાકાર થશે. શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ માટે ડિજિટલ યુનિવર્સિટી સ્થાપવા સાથે પી.એમ. ઈ-વિદ્યા અંતર્ગત એક વર્ગ એક ટીવી ચેનલથી તમામ રાજ્યોના ધોરણ ૧થી ૧૨ માં પ્રાદેશીક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપી શકાશે.

હાલમાં સહકારી મંડળીઓએ અલ્ટરનેટીવ મિનિમમ ટેક્સ ૧૮.૫ % ચૂકવવો પડે છે તે હવે ઘટાડીને ૧૫% કરવામાં આવ્યો છે તેમજ ૧ થી ૧૦ કરોડ સુધીની આવક ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટીઝ પરનો સરચાર્જ ૧૨%થી ઘટાડીને ૭% કરવામાં આવ્યો છે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈનો મુખ્યમંત્રીશ્રીએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાકની આકારણી અને જમીન રેકોર્ડના ડિજિટલાઇઝેશનમાં કિશાન ડ્રોન્સનો ઉપયોગ કરવાની પહેલને ગુજરાતમાં પણ અમલી કરીશું. આ બજેટમાં રસાયણમુક્ત-કેમિકલ ફ્રી પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો જે



નિર્ધાર કરવામાં આવ્યો છે તેને ગુજરાતમાં સફળતાપૂર્વક પાર પાડવાની શરૂઆત થઈ ગઈ છે. બાજરો, જુવાર જેવાં ધાન્યોના મૂલ્યવર્ધન માટે સહાયની બાબતથી રાજ્યના આદિજાતિ પટ્ટાના ખેડૂતોને લાભ થશે. બેટરી સ્વેપિંગ પોલિસી અંતર્ગત શહેરી વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન મળશે. ગુજરાતે પોતાની ઈ-વેહિકલ પોલિસી સાથે આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની નેમ રાખી છે.

ટ્રસ્ટ બેઈઝડ ગવર્નન્સ, ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના ગુજરાતે સાકાર કરેલી છે. આ બજેટમાં ગુજરાતના ગિફ્ટ સિટી સંદર્ભમાં પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ, ફિન્ટેક, ટેકનોલોજી, મેથેમેટિક્સ વગેરે માટે ઈન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થપાશે. ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર પણ ગિફ્ટ સિટી ખાતે શરૂ થશે. સુરતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગકારોને રાહત આપતાં આ બજેટમાં પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ સ્ટોન પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૫% કરવામાં આવી છે તે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને બળ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ લોકહિતને વહેલા અને વિકાસલક્ષી બજેટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતની જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો. ●


આર્બિટ્રેશન સેન્ટર શરૂ થવાથી વિદેશી કંપનીઓ ગિફ્ટ સિટીમાં તેમના એકમો સ્થાપશે.

ગિફ્ટ સિટીમાં ઘઠ ઓફ ડુઈંગ બિઝનેસની સાનુકૂળતા વધશે

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રેએ બજેટ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, દેશની આર્થિક વૃદ્ધિ ઉપર બહુવિધ અસરો જોવા મળશે. કોઈ પણ પ્રકારના પ્રાદેશિક નિયમન વિના વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓની સ્થાપનાથી ફાઈનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રે કુશળ માનવબળની ઉપલબ્ધતા સરળ બનશે. આવકવેરામાં મુક્તિ ગિફ્ટ આઈએફએસસીમાં શિપ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ, ઓફશોર ફંડ મેનેજમેન્ટ અનેફશોર બેંકિંગ પ્રવૃત્તિઓ જેવી વિવિધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.

આંતરરાજ્ય નદી જોડાણથી ગુજરાતમાં સિંચાઈની સગવડ વધશે

કેન્દ્રિય બજેટમાં ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે અંગેના દિર્ઘદ્રષ્ટીપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત



અને મહારાષ્ટ્ર વચ્ચે વહેતી પાંચ નદીઓને આંતરરાજ્ય જોડાણ કરવાની જાહેરાત થઈ છે. આ અંતર્ગત દમણગંગા, પિંજલ, પાર, તાપી અને નર્મદા નદીનું આંતરરાજ્ય જોડાણ કરવામાં આવશે. આ જોડાણથી મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળશે.

આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી ૮૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૨૦ ટકા નાણાકીય સહાય મળશે. આ યોજનામાં અંદાજિત રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ યોજનાથી છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના કૃષિકારોને મળતા લાભમાં પણ વધારો થશે. ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાની કુલ ૪૬,૩૬૮ હેક્ટર જમીનને મળતી સિંચાઈની સગવડમાં પણ વધારો થશે. 402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક 1200 મિલિયન ઘનમીટર કરતા વધુ વધારાના પાણી નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તાર સુધી વહન કરવામાં આવી શકે છે. પાર-તાપી-નર્મદા લીંક કેનાલ દ્વારા દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણ નદીઓના સ્ત્રાવ ક્ષેત્રમાં કુલ સાત જળાશયના બાંધકામનો સમાવેશ થાય છે. ●

ગરીબ કલ્યાણમેળાઓ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે

રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગારી માટે સહાયરૂપ થવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ગરીબ કલ્યાણમેળાની શુંબલા આગામી સમયમાં શરૂ કરવાનો નિર્ણય તાજેતરમાં મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જિતેન્દ્રભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું બજેટ આત્મનિર્ભર ભારતને સાકાર કરનારું બજેટ છે.



કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની જનહિતલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રજૂ થયેલા બજેટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટને આવકારી ટીમ ભારતને અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાતને પીએમ ગતિશક્તિ યોજનાઓનો મહત્તમ લાભ મળવાનો છે. PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં વર્ષ 2022-23માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક વિસ્તરણ કરીને ૨૫,૦૦૦ કિમી સુધી વધારવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-નેશનલ હાઇવે નેટવર્કના વિસ્તરણ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની મૂડી એકત્ર કરીને કામે લગાવવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સ્વદેશી વિશ્વ કક્ષાની ટેક્નોલોજી અને વૃદ્ધિ-કવચ અંતર્ગત ૨,૦૦૦ કિમીનું રેલવે નેટવર્ક લાવવામાં આવશે. રેલવે અને હાઈવેના પ્રોજેક્ટનો લાભ ગુજરાતને મળશે.

આગામી ત્રણ વર્ષ દરમિયાન નવી પેઢીની ૪૦૦ વંદેભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વર્ષ દરમિયાન મલ્ટીમોડેલ લોજિસ્ટિક્સ માટે ૧૦૦ પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ કરવામાં આવશે. આ સાથે ડીએમઆઈસીનો ૩૩ ટકા જેટલો મોટો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે, તેવા સંજોગોમાં ગુજરાતને પીએમ ગતિશક્તિ યોજનાનો વધુ લાભ મળશે.

ગુજરાતની નર્મદા નદીને ઈન્ટરસ્ટેટ જોડાણની મંજૂરી મળી છે. આ જોડાણથી મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી ૮૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૨૦ ટકા નાણાકીય સહાય મળશે. આ યોજનામાં અંદાજિત રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ યોજનાથી છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને પંચમહાલ જિલ્લાના કૃષિકારોને મળતા લાભમાં પણ વધારો થશે. ઉપરાંત સુરેન્દ્રનગર,

મોરબી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાની કુલ ૪૬,૩૬૮ હેક્ટર જમીનને મળતી સિંચાઈની સગવડમાં પણ વધારો થશે.

કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩માં તૈયાર હીરાની જ્યુટીમાં કેન્દ્રે ૨.૫ ટકાનો ઘટાડો કર્યો છે તદ્દુપરાંત કટ એન્ડ પોલિશ્ડ હીરાની આયાત પર સરકાર દ્વારા ૭.૬ ટકા કસ્ટમ જ્યુટી લેવામાં આવતી હતી, જે જ્યુટીને આ બજેટમાં ઘટાડીને ૫ ટકા કરવામાં આવી છે, જેનાથી હીરાઉદ્યોગને ઘણો લાભ થશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોના ઉત્પાદિત પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા. ૧લી ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન કામગીરી શરૂ કરાઈ છે, જે આગામી તા. ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી ચાલશે. ખેડૂતોએ આનો મહત્તમ લાભ લેવા પણ અપીલ કરાઈ છે. અત્યાર સુધીમાં ચણાની ખરીદી માટે ૩૦ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યભરમાં ચણાની ખરીદી માટે ૧૮૭, તુવેરની ખરીદી માટે ૧૩૫ અને રાયડાની ખરીદી માટે ત્રણ કેન્દ્રો શરૂ કરાશે. સમગ્ર ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરાશે.

રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો વધુ ને વધુ મળે એ માટે આગામી અંદાજપત્રમાં વધુ ને વધુ આઉટકમ-આઉટપુટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને વિવિધ યોજનાઓ માટે વિશેષ સૂચના અપાઈ છે. નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને હાલ વિવિધ વિભાગોના અંદાજપત્ર તૈયાર કરવા માટે બેઠકો યોજાઈ રહી છે. પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના મહેસૂલ વિભાગને કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના GIDM ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક અવોર્ડ એનાયત થયો છે, જે માટે રાજ્યના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને કેબિનેટમાં અભિનંદન આપવામાં આવ્યાં છે.

રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જામનગર જિલ્લાના ખીજડિયા વન્ય જીવ અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસના પ્રસંગે આજે નવી રામસર સાઈટ જાહેર કરવામાં આવી છે. હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ દ્વારા ખીજડિયા વન્ય જીવ અભયારણ્યને નવી રામસર સાઈટ તરીકેના દરજ્જાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે એ ગુજરાત માટે ગૌરવરૂપ છે. ●

ભારતરત્ન લતા મંગેશકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

ડી. ડી. કાતરીયા

કોકીલ કંઠી અને સ્વર-સૂરની દેવી અને સંગીત સામ્રાજી પાશ્વ ગાયિકા લતા મંગેશકરનું તાજેતરમાં તા.૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે કોરોના-ન્યુમોનીયા, મલ્ટીપલ ઓર્ગન્સ ફેલ્યોરના કારણે ૯૨ વર્ષની વયે દેહાવસાન થયું. મુંબઈ ખાતે શિવાજી પાર્ક ખાતે સ્વર્ગસ્થનાં પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લતાજીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં તા.૨૮મી સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ મરાઠી પરિવારમાં જન્મેલા અને મહારાષ્ટ્રમાં ઉછરેલા સ્વર અને સૂરના આરાધક ભારત રત્ન અને જાદુઈ અવાજના ધની લતાજીએ દેશની લગભગ ૩૬ જેટલી ભાષાઓના ૩૦,૦૦૦ કરતા વધુ ગીતો ગાયા. પિતા દીનાનાથ મંગેશકર અને ગુજરાતી માતા શેવંતી (સુધામતી)ની ૪ પુત્રીઓ અને એક પુત્ર સહિત પાંચ સંતાનોમાં લતાજી સૌથી મોટા હતા લતાજીના માતા ગુજરાતી હોવાના કારણસર તેઓ અડધા ગુજરાતી હતા. લતાજીનું બાળપણનું નામ કે મૂળનામ હેમા હતું, પરંતુ ‘ભાવ બંધન’ નાટકના લલિતકા પાત્ર ઉપરથી તેઓના પિતાએ તેઓનું નામ લતા રાખ્યું હતું. ગોવાના ‘મંગેશી’ પિતૃક ગામ ઉપરથી લતાજીના પરિવારની અટક મંગેશકર રખાઈ હતી.

લતાજીએ ૧૯૪૪માં માત્ર ૧૧ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિણામ સ્વરૂપ લતાજી ઉપર પોતાના ૪ બહેનો-ભાઈની જવાબદારી તેઓના શિરે આવી હતી. મરાઠી અને કોંકણી સંગીતકાર, ગાયક અને નાટ્યકાર પિતા દીનાનાથની પુત્રી લતાજીએ પોતાની આઠ દાયકાની સંગીત જીવનની યાત્રા દરમ્યાન માત્ર પાંચ વર્ષની વયે સંગીતની શિક્ષા લીધી હતી અને ૧૩ વર્ષની વયે પ્રથમ ગીત ગાઈને ગાયિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ ૧૯૪૯માં લતાજીએ ૨૦ વર્ષની વયે હિન્દી ફિલ્મ ‘મહલ’ના ‘‘આયેગા આનેવાલા આયેગા...’’ ગાયેલ ગીત સુપર હીટ ગયું હતું. ત્યાર પછીથી કદી પાશ્વ ગાયિકા તરીકે પાણુ વળીને જોયું ન હતું. લતાજીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ ભૂષણ (૧૯૬૯), પદ્મ વિભૂષણ (૧૯૯૯) અને ભારત રત્ન (૨૦૦૧) એવોર્ડ અનાયત થયેલ હતા. દાદા

સોહબ ફાળકે એવોર્ડ, લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ, ત્રણ વાર ફિલ્મફેર એવોર્ડ, રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર તેમજ મહારાષ્ટ્ર ભૂષણ

(૧૯૯૯) જેવા અનેક એવોર્ડ અનાયત થયેલા હતા. ફ્રાન્સ સરકારે પણ લતાજીને ફ્રાન્સનો સર્વોચ્ચ એવોર્ડ પણ આપેલ હતો, તેમજ સૌથી વધુ ગીતો ગાવા બદલ લતાજીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળેલ હતું. સૂર સામ્રાજી લતાજીએ લંડન (બ્રિટન) ના વિશ્વ પ્રસિધ્ધ રોયલ આલ્બર્ટ હોલમાં ૧૯૭૪માં મ્યુઝિક પ્રોગ્રામ આપ્યો હતો. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ ૩ મિનિટ સુધી લતાજીને સ્ટેન્ડીંગ ઓવેશન

મળ્યું હતું. ૧૯૫૯માં જગપ્રસિધ્ધ ‘ટાઈમ’ મેગેઝિને લતાજીને વોઈસ ક્વીન તરીકે જાહેર કર્યા હતા. લતાજીની વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમ્યાન રાષ્ટ્રપતિ દ્વારા રાજયસભામાં નોમીનેટ્ડ મેમ્બર તરીકે નિમણૂક થઈ હતી. ભારત-ચીન યુધ્ધ (૧૯૬૨) પછી ૧૯૬૩માં નવી દિલ્લી ખાતે ગણતંત્ર દિને લતાજીએ દેશના ચીન સામેના યુધ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે કવિ પ્રદિપજી લિખિત ‘‘યે મેરે વતન કે લોગો...’’ ગેરફિલ્મી ગીતોને સ્વર આપ્યો હતો. ૧૯૮૩માં ભારતે પ્રથમ વાર ક્રિકેટનો વલ્ડ કપ જીત્યો ત્યારે વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને પુરસ્કાર આપવા માટે લતાજીએ એક મ્યુઝિક કાર્યક્રમ યોજીને નાણાં એકત્ર કરીને બીસીસીઆઈને આપતા બોર્ડ દરેક ક્રિકેટરને એક એક લાખ રોકડ ઇનામ આપ્યું હતું. આ હતી લતાજીની ક્રિકેટ અને દેશ પ્રત્યેની યાહના...

સૂર અને શબ્દના માલિક લતાજીએ ‘બાપા સીતારામ’ ગુજરાતી ફિલ્મમાં ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ...’’ ગાયું હતું તેમજ ‘મહેંદી તે વાવી માંડવે...’ ‘પાંદડું લીલું ને રંગ રાતો...’ ‘હંસલા હાલોને...’ ‘તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી...’ જેવા અનેક ગુજરાતી ગીતો પણ લતાજીએ ગાયા છે. ઈશ્વરની ભારત દેશને સૌથી મોટી ગીફ્ટ સમાન લતાજી અમર રહેશે, તે જ રીતે યુગો યુગો સુધી લતાજીનો અવાજ પણ અમર રહેશે. ગુજરાતના ૬.૫ કરોડ ગુજરાતીઓ સહિત સમગ્ર દેશ અને દુનિયાએ લતાજીના અવસાનથી એક ઊંડા દુઃખની લાગણી અનુભવી હતી. દેશની બેટી, પનોતી પુત્રી અને નારી રત્ન - અમૂલ્ય રત્ન એવી ઉચ્ચતમ કોટિની વિશ્વ પ્રતિભાને શત શત નમન સાથે શ્રદ્ધાંજલિ.●



વડનગર

વિસ્મયભરી વિરાસત...

રમેશ ઠક્કર

દરેક નગરની એક ઓળખ હોય છે. એનો ઇતિહાસ હોય છે. સમય સાથે ટકી રહેવાની ખુમારી હોય છે. વડનગર એક એવું શહેર છે જે અનેક તડકીછાંચડીના ઉતારચઢાવ પછી પણ આજે અડીખમ ઉભું છે. પોતાની ઐતિહાસિક ધરોહર અને પેટાળમાં અનેક અચરજો ભરીને બેઠું છે આ નગર. એની પાસે ભવ્ય અને ભાતીગળ વારસો છે. એક જમાનામાં ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર "આનર્ત પ્રદેશ," તરીકે ઓળખાતો હતો. રાજકીય રીતે અત્યંત શક્તિશાળી એ પ્રદેશની રાજધાની વડનગર હતું.

આ નગરનાં અનેક નામો ઇતિહાસના ચોપડે નોંધાયાં છે. એની એક રસપ્રદ યાદી છે. વડનગર, વૃદ્ધનગર, આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર.

કોઈ શહેરનાં આટલાં નામ નહીં હોય ! ચીની મુસાફર હયુ એન સંગ સાતમી સદીમાં ભારતના પ્રવાસે આવેલા. એ વખતે હર્ષ વર્ધન સમ્રાટ હતો આખા ભારતનો. ચીની યાત્રિકે પ્રાચીન વડનગરની મુલાકાત કરી હતી. વડનગર એ નાગરો માટેનું આધ્યસ્થાન ગણાય છે. હાટકેશ્વર મહાદેવ એ એમના ઈષ્ટદેવ છે. પુરાતન દરવાજાઓ નદીઓળ દરવાજો, ગાસકોળ દરવાજો, અરજણબારી દરવાજો, પીઠોરી દરવાજો આજે પણ સમયની થપાટો ખાઈને અડીખમ ટકી રહ્યા છે. ઈ.સ.1152માં સોલંકી રાજા કુમારપાળે વડનગર ફરતે કોટ બંધાવ્યો હતો. જેને છ દરવાજાઓ હતા. અરજુનબારી દરવાજા ઉપર એનો શિલાલેખ છે.

ગુજરાતની ઓળખ એટલે વડનગરનું કીર્તિતોરણ. વડનગરની ઉત્તરે ભવ્ય કીર્તિસ્તંભ ઉભેલા છે. શર્મિષ્ઠા તળાવ એ વડનગરની વચ્ચે આકાર પામેલું ભવ્ય તળાવ છે. અબુલ ફઝલ નામનો ઇતિહાસકાર "આઈને અકબરી" ગ્રંથમાં નોંધે છે "આ નગરમાં નાનાંમોટાં 300 જેટલાં તળાવો હતાં. 360 મંદિરો, 360 કૂવા,



અને શર્મિષ્ઠા તળાવને 360 પગથિયાં હતાં. આજે પણ વડનગરમાં 75 જેટલાં તળાવો, 200 જેટલા કૂવા અને શર્મિષ્ઠા તળાવનાં 100 જેટલાં પગથિયાં એ ભવ્ય વિરાસતની યાદ અપાવે છે. શર્મિષ્ઠા એ સમેળા તળાવ તરીકે ઇતિહાસમાં જાણીતું છે. સંગીત અને વડનગરને પણ એક અણમોલ નાતો છે. ગુજરાતમાં ગાયન વાદન ક્ષેત્રે જાણીતી તાના અને રીરી નામની નાગર કન્યાઓ અને એના બલિદાનની કથા જાણીતી છે. આ બંને બહેનો વડનગરની શાસ્ત્રીય ગાયિકાઓ હતી જેણે દીપક રાગથી દાહ પામેલા તાનસેન માટે મહારાગ આલાપી એને પીડામુક્ત કરેલો. એ પછી બાદશાહના ફરમાન સામે પોતાની ઈજ્જત બચાવવા એમણે સતી થઈ અમરત્વ પ્રાપ્ત કર્યું છે. તાનારીરીની યાદમાં દર વરસે વડનગરમાં ભવ્ય સંગીત મહોત્સવ થાય છે. એમના નામથી ગાયકોને એવોર્ડ પણ અપાય છે.

વડનગર અનેક મહાપુરુષોની ભૂમિ રહ્યું છે. બીજી સદીમાં મંકણ નામે મહાકવિ થયેલો જેણે વડનગરને ચમત્કારપુરમ્ નામ આપેલું. બીજા એક વિદ્વાન પ્રભાવદત્ત પણ એમનાં ભાષ્યો માટે જાણીતા છે. ભદ્રબાહુસ્વામી જૈન તપસ્વી હતા જેમણે ઘણા જૈન ગ્રંથો રચ્યા છે. અગિયારમી સદીમાં થયેલો ઉવટ વેદોનો નિષ્ણાત હતો. સોલ નામે પુરોહિત જાણીતા છે. ભીમદેવ બીજાનો રાજપુરોહિત સોમેશ્વરદેવ વડનગરનો હતો. કૃષ્ણલીલાનાં અદ્ભુત પદો રચનાર યદુરામ મહારાજ અને કવિચત્રી કપ્તાબાઈ કે જેણે બાલકૃષ્ણ માટે અદ્ભુત હાલરડાં લખ્યાં છે એ પણ આ ધરતીમાં અવતરેલી પ્રતિભાઓ છે. આ યાદી ઘણી લાંબી છે. જે આધુનિક ઋષિ જેવા ડૉ.વસંત પરીખ અને ડૉ.દ્વારકાદાશ જોશીની કર્મભૂમિ અને આધુનિક ભારતના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવા અનેક રત્નો સુધી વિસ્તરે છે. વડનગર હવે પોતાની ભવ્ય વિરાસતના વારસા સાથે આધુનિક કદમ ભરતું એક અતિ ભવ્ય પ્રવાસન સ્થળ તરીકે આકાર પામી રહ્યું છે. આધુનિક સુખસગવડો, સુવિધાઓ, સાથે સજ્જ શર્મિષ્ઠા લેકના આધુનિકીકરણ સાથે એ સજ્જ બન્યું છે. પ્રાચીન સમયમાં ગુજરાતને ગૌરવ અપાવનારું વડનગર એ આધુનિક ગુજરાતનું પણ એક ઉજ્જવળ નગર બનવા તરફ ઝડપથી નવો આકાર પામી રહ્યું છે. ●

મુખ્ય સચિવશ્રીએ વડનગરમાં પ્રવાસન વિકાસ કાર્યોની સમીક્ષા કરી

ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર એક દિવસીય મુલાકાત કરી હતી. મુખ્ય સચિવશ્રીએ તેમની મુલાકાત દરમિયાન વડનગરના અંબાજી કોઠા લેઈક, શર્મિષ્ઠા તળાવના થીમ પાર્ક, તાના-રીરી પાર્ક, મ્યુઝિયમ ઓફ મ્યુઝિક, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, આર્ટ ગેલેરીની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી વિકાસ કાર્યોની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે વડનગરના વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પુરા કરવા માટે અને પ્રોજેક્ટના વધુ સારા ડેવલપમેન્ટ માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. શ્રી પંકજ કુમારે વડનગરના ઇતિહાસને જીવંત કરતી આર્ટ ગેલેરીમાં ટુરિસ્ટ ગાઈડ પાસેથી ઇતિહાસ જાણવામાં, સમજવામાં રસ લીધો હતો. તેમણે અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ ધ્રિડી થીયેટરમાં વડનગરના ઇતિહાસને માણ્યો હતો. આ ઉપરાંત તેમણે શર્મિષ્ઠા તળાવના થીમ પાર્કમાં જીવંત કરાયેલા સંગીતના વિવિધ રાગ પૈકી કેદારરાગ હેડફોન લગાવીને સાંભળ્યો હતો.

તેમણે વડનગરના રેલવે સ્ટેશન પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પોતાના પિતાશ્રીની ચાની જે કિટલી પર કામ કરતા હતા તેની પણ મુલાકાત લીધી હતી. વડનગરમાં તેઓએ પ્રેરણા સ્કૂલ અને નિર્માણાધીન સંગ્રહાલયની મુલાકાત લીધા બાદ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, જૈન દેરાસર, ભવાની મંદિર જવાના આખા રસ્તા પર, ગલીઓમાં પગપાળા ચાલીને ઉત્સાહથી બધી વિગતો મેળવી હતી. આ વેળાએ વડનગરના લોકો તેમને જોવા માટે ઉમળકાથી પોતાની ઘરની બારીઓ અને ઓટલે ગોઠવાઈ ગયા હતા.

મુખ્ય સચિવશ્રીએ વડનગરમાં નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ હોટલ તોરણના કોન્ફરન્સ રૂમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે વડનગરનો વારસો અંતર્ગત જિલ્લામાં કરાયેલી કામગીરીનું



પ્રેઝન્ટેશન, મુખ્ય સચિવશ્રી સમક્ષ કર્યું હતું. તેમણે ગુજરાત પ્રવાસન અને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વડનગરમાં પ્રવાસન અને હેરીટેજ સ્થળ તરીકે વિકસાવાઈ રહેલાં વિવિધ પ્રોજેક્ટની જાણકારી મેળવી, સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત મુખ્ય સચિવશ્રીએ સાબરમતી જળાશય યોજના આધારિત ધરોઈ બંધની મુલાકાત લીધી હતી. તેમણે ધરોઈ ડેમને મહેસાણા જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની શક્યતાના વિવિધ પ્રોજેક્ટોને અમલમાં મૂકવાના ભાગ રૂપે, સ્થળ નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. ધરોઈ ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર આઈડેન્ટીફાઈ કરવામાં આવેલી અમદાવાદની એજન્સી આઈ.એન.આઈ ડિઝાઈનના આર્કિટેક્ટ અને કન્સલ્ટન્ટ શ્રી હર્ષ ગોહલ અને ધરોઈ ડેમના એન્જિનિયર શ્રી પંટેલે તેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર સ્થળો અને વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી.

વડનગરની વિવિધ સાઈટોની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવશ્રી પંકજકુમારની સાથે વડનગરના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સોમાભાઈ મોદી, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી ડો ડી.કે.શર્મા, કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો પાર્થરાજસિંહ ગોહલ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સહિત મહેસાણાના વિવિધ ખાતાના અધિકારીઓ પણ જોડાયા હતા. ●



નવી શિક્ષણનીતિ આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને સાકાર કરશે

શિક્ષણ એ વિકાસનો મૂલાધાર છે. શિક્ષણ જોવા માટેની નવી આંખ અને ઊડવા માટેની પાંખ આપે છે. શિક્ષણ થકી જ વિકાસનાં તમામ દ્વાર ખૂલી શકે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાનો તથા સમગ્ર સમાજ સહિત દેશનો વિકાસ કરી શકે છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે 'સા વિદ્યા યા વિમુક્તે' - અર્થાત્ જે બુદ્ધિ અપાવે તે વિદ્યા મુક્તિ અપાવે છે, આમ જોઈએ તો વિદ્યા વૈચારિક ગુલામીમાંથી મુક્તિ અપાવી વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. શિક્ષણની આવી જરૂરિયાતને ધ્યાને લઈને ગુજરાતના પનોતુ પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી શ્રી જિતેન્દ્રભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં નવી શિક્ષણનીતિના અમલીકરણ માટે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ ત્રણ ફેઝમાં કરવામાં આવશે, જેમાં ફેઝ-1નો સમય 3 વર્ષ છે. આ ફેઝમાં ભારતીય શિક્ષણપ્રણાલીનો પ્રચાર, ઈન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ પ્લાન (IDP), વ્યાવસાયિક અને શિક્ષણનું એકીકરણ, રિસર્ચ અને ઈનોવેશનમાં સુધારા પર ભાર મુકાશે. એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ, મલ્ટીપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ, વિદ્યાર્થીઓને સહાય અને માર્ગદર્શન આપવામાં આવશે. જયારે બીજા ફેઝમાં

મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી(MERUS), મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી પર ભાર મુકાશે. આ સાથે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો(GER)માં વધારો, એક્રેડિટેશન અને ગ્રેડેડ ઓટોનોમી અને પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવશે. આ માટે બીજા ફેઝનો સમયગાળો 3થી 6 વર્ષ રાખવામાં આવ્યો છે. ત્રીજો ફેઝ જે ચાર વર્ષનો રહેશે. એટલે કે 6થી 10 વર્ષ સુધીનો. આ ફેઝમાં કોલેજોનું ડી-એફલિયેશન અને ગવર્નન્સ બાબતે યુનિવર્સિટી એક્ટમાં સુધારો કરવામાં આવશે.

ગુજરાત સરકારે નવી શિક્ષણનીતિના અમલ માટે અગાઉ પણ પ્રયાસ કર્યા છે. આ માટે ગુજરાત સરકારે ઈન્ટર-ડિસિપ્લિનરી/રિસર્ચ યુનિવર્સિટી માટે સાત યુનિવર્સિટીને 'સેન્ટર ઓફ એક્સેલન્સ' તરીકે જાહેર કરી છે. તેમજ એક્રેડિટેશન અને અન્ય

રેગ્યુલેટરી સિસ્ટમ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટશનલ રેટિંગ ફેમવર્ક (GSIRF) શરૂ કરવામાં આવ્યું છે. સરકારી કોલેજોને NAAC/NBA માટે સર્પોર્ટ કરવામાં આવે છે. સાથે સ્ટેટ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન સેન્ટર (SAAC) અને સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સેન્ટર (SDAC) સેન્ટરને પણ મંજૂરી આપી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઓ (MERUS) અને મલ્ટીડિસિપ્લિનરી સંસ્થાઓ માટે યુનિવર્સિટીઓ તેમના કલસ્ટરોને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન સિસ્ટમ માટે દરખાસ્ત કરવામાં આવી છે. એકેડેમિક બેન્ક ઓફ

ક્રેડિટ માટે UGCની માર્ગદર્શિકા મુજબ CBCS માટે માળખામાં સુધારો કરવા માટે રાજ્યની યુનિવર્સિટીઓને પત્ર મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 'Study In Gujarat'(SIG) ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 22 યુનિવર્સિટીઓ અને ચાર કોલેજો સાથે, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો અને પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.

નવી શિક્ષણનીતિના પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, સંશોધન, ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ ક્ષેત્રે વધુ બળ મળશે.

સાથે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધા, શ્રેષ્ઠ શિક્ષકો, લેબોરેટરી, સમૃદ્ધ લાઇબ્રેરી, હોસ્ટેલ જેવી સુવિધાઓ મળશે. આ ઉપરાંત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રોજગાર અને ઉદ્યોગની વધુ તક મળે તે માટે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, કોમ્પ્યુનિકેશન સહિત અલગ અલગ સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રિસર્ચ એન્ડ ઈનોવેશન, એન્ટરપ્રેન્યોરિયલ ઈકોસિસ્ટમ માટે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે 'કોમન ઈનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ પોલિસી'ની સ્થાપના કરવામાં આવી છે. આ યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્ટાર્ટ-અપ અને ઈનોવેશનને વધુ પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન હબ (આઈ-હબ)ની સ્થાપના, મે-2019માં સેક્શન 8 કંપની હેઠળ



ફલેગશિપ નોડલ એજન્સી તરીકે કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત કરવામાં આર્થિક બાબત બાધારૂપ ન બને તેનું ગુજરાત સરકારે પૂરતું ધ્યાન રાખ્યું છે. આ માટે સરકાર દ્વારા શિક્ષણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી બનાવી છે, જેમ કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, શિક્ષણ લોન પર વ્યાજસહાય યોજના હેઠળ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવી વગેરે...

રાજ્યની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટમાં વધારો કરવા ઉદિશા (UDISHA- Universal Development of Integrated Skills through Higher education Agencies) પ્રકલ્પ કાર્યરત છે. જેમાં કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ કૌશલ્યક્ષમતામાં વધારો થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને સુષુપ્ત કળા, કૌશલ્યનો વિકાસ થાય તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સમ્પ્રદાર પ્રકલ્પ કાર્યરત છે.

ગુજરાતની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરની બનાવવા માટે તથા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફેમવર્ક-NIRFના આધારે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોનાં રેટિંગ કરવાના હેતુથી 'ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફેમવર્ક' (GSIRF)ની શરૂઆત કરવામાં આવી છે, જે યુનિવર્સિટીઓ અને કોલેજો GSIRF અંતર્ગત રેટિંગ કરાવે છે તેઓ NAAC, NBA અને NIRFમાં ભાગ લઈને તેઓ સારું પરફોર્મન્સ આપી શકે છે. રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની વિવિધ સંસ્થાઓને શિક્ષણ અધ્યયન અને સંસાધનો, સંશોધન અને વ્યાવસાયિક પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન પરિણામો, આઉટરી જેવા પ્રચલિત માપદંડોના આધારે નેશનલ રેન્કિંગ તેમજ ગ્લોબલ રેન્કિંગ આપવામાં આવે છે.

'સેન્ટર ઓફ એક્સેલન્સ'ના કારણે યુનિવર્સિટીઓ વિશ્વના શૈક્ષણિક જગતમાં પોતાનું આગવું સ્થાન સ્થાપિત કરી શકે છે. આ માટે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ, રિસર્ચ, ઈનોવેશન અને સ્ટાર્ટ-અપને વધુ બળ મળશે. આ ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને તેમને આંતરરાષ્ટ્રીય અનુભવો મળશે.

તથા ઈમેજિંગ ટેકનોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિશિષ્ટ ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાની તાલીમ પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિમાં હોલિસ્ટિક એજ્યુકેશન માટે દેશના આઠ રાજ્યોની કુલ ૧૪ એન્જિનિયરીંગ કોલેજોએ હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને બંગાળી જેવી માતૃભાષામાં અભ્યાસ શરૂ કર્યો છે. જેથી જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભાષા એ બાધારૂપ થશે નહીં અને વિદ્યાર્થીઓને માતૃભાષામાં સારામાં સારું શિક્ષણ મળશે. તેમજ યુનિવર્સિટીઓના નિષ્ણાતો દ્વારા આપવામાં આવતું શિક્ષણ તેઓ ઝડપથી અને સારી રીતે ગ્રહણ કરી શકશે.

શિક્ષણ સંસ્થાઓમાં તજજ્ઞ ફેકલ્ટી મળી રહે તે માટે ફેકલ્ટીની ભરતી, બઢતી અને કેપેસિટી ડેવલપમેન્ટ માટે શિક્ષણ વિભાગ પાસે 'ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ'ની સ્કીમ છે, જેમાં વધુ કેટલાક એડવાન્સ સર્ટિફિકેટ અને ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ ઉમેરી હોલિસ્ટિક શિક્ષણ સ્તરમાં વધારો થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ અન્વયે ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગને

પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધાં છે. ઓપન ડિસ્ટન્સ લર્નિંગ (ODL) માટે માન્યતાપ્રાપ્ત સંસ્થાઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ઓનલાઇન અભ્યાસક્રમો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરી તેમને સહાય આપવામાં

આવશે. આવા ગુણવત્તાવાળા ઓનલાઇન અભ્યાસક્રમોને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના

અભ્યાસક્રમમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં આવશે. આ માટે બ્લેન્ડેડ મોડ (Blended Mode)ને પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત SWAYAM પ્લેટફોર્મ અને વિવિધ MOOC કોર્સિસનો ઉપયોગ ઈન્ટરડિસિપ્લિનરી અભ્યાસક્રમોમાં કેડિટ મેળવવા માટે કરવામાં આવશે, જે ઓનલાઇન અભ્યાસક્રમને વિકસાવવા અને વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન પૂરું પાડશે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત ડિસ્ટન્સ લર્નિંગને વધુ અસરકારક બનાવવા માટે સરકારે સુદૃઢ વ્યવસ્થા કરી છે. નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં ઓપન ડિસ્ટન્સ લર્નિંગને લાગુ કરવામાં શિક્ષકોની મહત્વની ભૂમિકા છે. આથી શિક્ષકો સારામાં સારું પ્રદર્શન કરી શકે તે માટે ODL અંતર્ગત વિદ્યાપ્રવેશ (Vidya Pravesh), નિષ્ઠા ૨.૦ (NISHTHA 20) અને સફળ (SAFAL) જેવી ઓનલાઇન અભ્યાસ તેમજ ટીચર ટ્રેઇનિંગ માટેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝડ વેબસાઇટ કાર્યરત કરવામાં આવી છે. ●



ગુજરાતના સર્વપ્રથમ ઓવરડ્રિજ રૂફટોપ સોલાર દ્વારા વડોદરા મનપાએ વર્ષે રૂ. ૭૫ લાખની કમાણી કરી

દર્શન ત્રિવેદી

સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ વડોદરા શહેરમાં ઓવરડ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયાબજાર પુલ ઉપર કાર્યરત થવાના નવ માસમાં જ રૂ. ૫૦ લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલ મારફત આ નવ માસ દરમિયાન કુલ ૭,૯૨,૦૦૦ યુનિટ ઊર્જા સૂરજદાદાએ આપી છે.

ગત મે માસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિટ પ્રોજેક્ટ માટે ૨૫૨ મીટરની લંબાઈ અને ૪૦ મીટરની પહોળાઈ અને ૧૫.૩૩ મીટરની ઊંચાઈ સાથે ૧૧,૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કુલ રૂ. ૨૩.૨૫ કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ કરવામાં આવ્યું છે.

અકોટા બ્રિજની ઉપર ૩૨૫ વોટ પાવરની કુલ ૩૦૨૪ સોલાર પેનલ મૂકવામાં આવી છે. તેની સાથે ૭૦ કિલોવોટનાં ૧૪ સોલાર ઇન્વર્ટર્સ અને હજાર કિલોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. સોલાર પેનલ બ્લ્યુ વેફર નામના મટીરિયલ્સની છે, જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિયેશનથી બ્લ્યુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વીજળી ઉત્પાદિત કરે છે.

તમામ પેનલોને વાયવ્ય દિશામાં ૧૨થી ૧૮ ડિગ્રી કાટખૂણે બેસાડવામાં આવી છે, જેથી સૂર્યપ્રકાશ દિનભર મળતો રહે. આ બાબતોને જોતાં આ રૂફટોપ સોલાર પ્રોજેક્ટથી પ્રતિદિન ૩૯૪૦ યુનિટ અને વાર્ષિક ૧૪ લાખ વીજ યુનિટ ઉત્પાદન થઈ શકે છે.

મજાની વાત એ છે કે ગુજરાતની ભૌગોલિક સ્થિતિને જોતાં સામાન્ય સંજોગોમાં સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૫.૪૫ વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઈ શકે છે.

તેમાંય બપોરના ૧૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતલબ કે આ ચાર કલાક તેના પિકઅવર્સ છે.

આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઈ જાય એ રીતે સફાઈ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન ૫૦થી ૬૦ પેનલની સફાઈ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે. મે-૨૦૨૧થી જાન્યુઆર-૨૦૨૨ સુધીમાં ૧,૦૬,૪૧૦ યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કુલ ૭,૯૨,૦૦૦ યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું.

ટ્રાન્સફોર્મરને ચાલુ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે, જે પ્રતિમાસ ૭૦૦થી ૮૦૦ યુનિટ વાપરે છે. એટલે તે બાદ કરતાં નવ માસમાં કુલ ૭,૮૫,૧૦૦ યુનિટ સૌરઊર્જા મળી છે. આ યુનિટને મધ્ય ગુજરાત વીજ કંપનીના ભાવ રૂ. ૬.૭ લેખે ગણવામાં આવે તો રૂ. ૪૭,૩૩,૫૫૦નો સીધો ફાયદો નવ માસમાં

થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રિના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કુલ રૂ. ૫૦ લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે.

મધ્ય ગુજરાત વીજ કંપની આ સૌરઊર્જા લઈ વડોદરા મહાનગરપાલિકાને ત્રણ સ્થળે

એચટી વીજળી મજરે આપે છે. તેમાં કુલ ઉત્પાદિત સૌરઊર્જાના ૧૨.૧૮ ટકા ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગને, ૫૪.૯૫ ટકા રાજીવનગર સુએજ પ્લાન્ટ અને ૩૨.૮૭ ટકા અટલાદરા સુએજ પ્લાન્ટ વીજળી આપવામાં આવે છે. આ ત્રણેય સ્થળને આ નવ માસ દરમિયાન સુધીમાં આપવામાં આવેલી સૌરઊર્જાના કુલ યુનિટ અનુક્રમે જોઈએ તો ૮૬,૦૬૩, ૩,૮૮,૨૭૧ અને ૨,૩૨,૨૫૬ છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઝીરો કાર્બન ઉત્સર્જન અને સ્વચ્છ વીજળીની સંકલ્પનાને સાકાર કરતા અકોટા-દાંડિયાબજાર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ‘આમ કે આમ ઔર ગૂટલી ઓ કે ભી દામ’ કહેવત જેવો આ ફાયદો છે.

અકોટા સોલાર બ્રિજે વડોદરા મનપાને નવ માસમાં રૂ. ૫૦ લાખની વીજળી આપી

નડાબેટના સીમાદર્શન પ્રોજેક્ટનાં કામો પૂર્ણતાના આરે

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, કારણ કે પ્રવાસીઓને ગુજરાતમાં સમુદ્ર, પહાડો, જંગલો, જૈવવિવિધતા, યાત્રાધામો મળી રહે છે. તેમાં પણ હવે સરકાર દ્વારા પ્રવાસીઓ માટે બોર્ડર ટુરીઝમનો નવો પ્રકલ્પ શરૂ કરાયો છે. ગુજરાત સરકારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઝીરો પોઈન્ટ નજીક બનાસકાંઠાના સૂઈગામ તાલુકાના નડાબેટ ખાતે બોર્ડર ટુરીઝમને વિકસાવવા વર્ષ ૨૦૧૬માં સીમાદર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ સીમાદર્શનનો સમગ્ર પ્રોજેક્ટ રૂ. ૧૨૫ કરોડના ખર્ચ હવે પૂર્ણતાને આરે છે.

તાજેતરમાં પ્રવાસનમંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતાં વિવિધ વિકાસકામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સીમાદર્શન પ્રોજેક્ટના ઈન્ચાર્જ શ્રી કેયૂર શેઠે મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીને સીમાદર્શન પ્રોજેક્ટ વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમાદર્શન માટે ઝીરો પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ ટુરીઝમનાં કામો કરવામાં આવ્યાં છે, જેમાં વિશાળ પાર્કિંગ, આગમન પ્લાઝા, ૫૦૦ માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરિયમ, ચેન્જિંગ વ્યવસ્થા અને રૂમ, સ્ટેજ, સોવિનિયર શોપ, દુકાનો અને રેસ્ટોરન્ટ, ટોઈલેટ અને પીવાના પાણીની સુવિધા, અજેય પ્રહરી સ્મારક, બી.એસ.એફ. બેરેક, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રિટ્રિટ સેરિમની, જેમાં ઝથી ૫ હજાર માણસોની બેઠક વ્યવસ્થા,



રિટેઈનિંગ વોલ, ૩૦ મીટર ઊંચો ફ્લેગ, ડેકોરેટિવ લાઈટિંગ વર્ક, સોલાર ટ્રી અને સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યાં છે.

રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા નડાબેટ ખાતે જૂનાં લશ્કરી શસ્ત્રો (વોર વેપન) લશ્કરના જુદા જુદા વિભાગો સાથે સંલગ્નમાં રહીને ટી- જંકશનથી ઝીરો પોઈન્ટ વચ્ચે મિગ-૨૭ એરક્રાફ્ટ, ટોર્પીડો, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સરફેસ ટુ એર મિસાઈલ, આર્ટિલરી ગન, ટેન્ક ટી-૫૫ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં સહેલાણીઓ માટે એ/વી એક્સપિરિયન્સ ઝોનમાં ટાઈમ ટુ રિફ્લેક્ટ ૩૬૦ ડિગ્રી પ્રોજેક્શન ઓફ ૭ મિનિટ્સ ડોક્યુમેન્ટરી ઓફ ૧૯૭૧ વોર, બી.એસ.એફ. કિવઝ, ૧૮૦ ડિગ્રી ફોટોબૂથ, સોલ્જર ફોટોબૂથ, ગાર્ડિયન ફોટોબૂથ, છકડા ફોટોબૂથ, હેલ્મેટ સેલ્ફીબૂથ, જોશ મીટર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે.

અહીં આવતા પ્રવાસીઓની સુવિધાઓ માટે અને તેઓ એડવેન્ચર માણી શકે તે માટે રોડ ક્લાઈમ્બિંગ, રેપ્લિંગ, ફી વોલ, જીપલાઈન, સ્કાય સાઈકલ, રોકેટ ઈજેક્ટર, હ્યુમન સ્વિંગશોટ, એટીવી રાઈડ, ગ્લાન્ટ સ્વિંગ, પેઈન્ટ બોલ, કમાડો કોર્સ, લો રોપ કોર્સ, હાઈ રોપ કોર્સ, એર રાઈફલ શૂટિંગ, કોસબો શૂટિંગ સહિત બાળકો માટેની જંગલ જિમ, સ્લાઈડો, રોક ક્લાઈમ્બિંગ વગેરે પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.

ભારત કે વીર- શહીદોની ફેમિલી માટે ડોનેશન કરવાનું બૂથ, જોઈન ધ ફોર્સ- બી.એસ.એફ. જોઈન કરવા માટે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન, એન્ટ્રી ગેટ, ટી-જંકશનથી ઝીરો પોઈન્ટ સુધી બસ દ્વારા પ્રવાસીઓને લઈ જવા- લાવવાની વ્યવસ્થા, ટ્રોય ટ્રેન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.

મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, બી.એસ.એફ.ના અધિકારીઓ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ઉમેદદાન ગઢવી સહિતના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ●

સીમાદર્શન પ્રોજેક્ટ શું છે?

સીમાદર્શન પ્રોજેક્ટ એ એક અનોખો કાર્યક્રમ છે, જેમાં સ્થાનિક લોકોની રોજગારી સાથે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અને સ્થાનિક માહિતીનો સુભગ સમન્વય છે. આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને નડાબેટ- ઝીરો પોઈન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે. આ સીમાદર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઈને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઉજાગર થાય તેવાં શૌર્યસભર દર્શ્યો સર્જાશે.

લાભાર્થીઓને હવે નાણાં સહાય સીધી જ બેંક એકાઉન્ટમાં

ગુજરાત દરેક ક્ષેત્રમાં નવતર પહેલ કરવામાં અગ્રેસર છે. પારદર્શિતા સાથે ઝડપ એ વહીવટી તંત્રની મુખ્ય વિશેષતા છે. તેનો વધુ એક પુરાવો ત્યારે મળ્યો જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિનાવિલંબે પારદર્શિતાથી સીધી જ નાણાસહાય પૂરી પાડવાની દેશભરમાં પ્રથમ પહેલરૂપ પદ્ધતિનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS અન્વયેના ફંડ માટે ફાળવણી અને દેખરેખની કામગીરી હેતુસર, **સિંગલ નોડલ એજન્સી SNA તરીકે સ્ટેટ હેલ્થ સોસાયટી ગાંધીનગરને નિયુક્ત કરીને આ ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો પ્રારંભ કર્યો છે.**

દેશભરમાં એકમાત્ર ગુજરાતે શરૂ કરેલા આ મોડેલના કારણે તમામ નાણાકીય વ્યવહારો - પ્રોસેસ, પી.એફ.એન.એસ પોર્ટલ પર આપોઆપ પ્રોસેસ થશે.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભારત સરકાર રાજ્યને ઈમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ, આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચર મિશન તેમજ 15મા નાણાં પંચ એમ વાર્ષિક અંદાજે 4000 કરોડ રૂપિયા વિવિધ આરોગ્ય કાર્યક્રમો-યોજનામાં સહાય-સહયોગ પૂરો પાડે છે

આવી વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય જેમાં રાષ્ટ્રીય બાલિકા સુરક્ષા યોજના, ટી. બી રોગ નિયંત્રણ અને સારવાર માટેની દવાઓ, અંધત્વ અને દૃષ્ટિ ખામી નિવારણ વગેરે માટેની સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે સ્ટેટ નોડલ એજન્સી SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2 કાર્યરત થઈ છે. દેશમાં સૌપ્રથમ અપનાવાયેલા આ મોડેલ-2ના પરિણામે હવે યોજનાકીય લાભો, સહાયનાં નાણાં, એટ સિંગલ ક્લિક સીધા જ લાભાર્થીઓનાં બેંક ખાતામાં પહોંચી શકશે.

સામાન્યતઃ હાલ જે સહાય લાભાર્થીને અંદાજે ચાર-પાંચ



સપ્તાહમાં મળે છે તે એક જ સપ્તાહમાં મળતી થઈ જશે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ એપ્લિકેશનનું લોન્ચિંગ સંપન્ન કર્યું હતું.

આ પ્રકારનું નવીન મોડેલ-2 લોન્ચ કરનાર ગુજરાત દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત છે. નેશનલ હેલ્થ મિશનની વિવિધ પાયાની આરોગ્ય યોજનાકીય સહાય નાગરિકોને સરળતાએ મળી રહે તે માટે રાજ્ય દ્વારા આ ફંડનું યોગ્ય આયોજન કરીને કેન્દ્ર સરકારના બજેટ માટે દરખાસ્ત કરાય છે.

તદ્અનુસાર ફાળવવામાં આવતી રકમ અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા અલગ

અલગ સંસ્થાઓને તેમના જુદાં-જુદાં બેંક ખાતામાં અપાતી હતી. પરિણામે વિભાગીય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ગ્રાન્ટ-સહાય ફાળવણીમાં પણ વિલંબને કારણે લાભાર્થીને મળતી સહાય-લાભ પહોંચાડવામાં સમય જતો હતો

એટલું જ નહીં, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મળતી સહાયની વિગતોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને મળવાપાત્ર એવા નેશનલ હેલ્થ મિશનના લાભો, વિનાવિલંબે અને સીધાં જ બેંક ખાતામાં ઇલેક્ટ્રોનિક ડિજિટલ સાઈનથી મળતા થવાથી, પારદર્શિતાને વેગ મળતા 'ગુડ ગવર્નન્સ ઈન હેલ્થ સેક્ટર' સાકાર થશે. ●

- દેશભરમાં સિંગલ નોડલ એજન્સી - SNAની પહેલ કરનારુ એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું
- મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં SNAની ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશનનું નવતર મોડેલ 2 લોન્ચ કર્યું

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે માટીની કુલડીમાંથી નિર્મિત ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ



શહીદ સ્મૃતિ અને મહાત્મા ગાંધીના નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુનઃ નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વનાં અને પ્રસ્તુત છે. દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી - સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની ઉજવણીનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું કે, આ મહોત્સવના પગલે 1857થી લઈને 1947 સુધી ભારતની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન વિશે ભારતની ભાવિ પેઢી માહિતગાર થશે, આ અમૃત મહોત્સવ એ આપણને ભારતની આઝાદીનાં 100 વર્ષના લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો પણ અવસર પૂરો પાડે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રિવરફ્રન્ટની ગરિમા અને સુંદરતામાં વધારો કરતું નવું

નજરાણું અમદાવાદને આપવા બદલ શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભારત સરકારના ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રી કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલું બાપુનું આ ભીંતચિત્ર ગાંધી નિર્વાણદિને પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ છે.

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીનું આ ભીંતચિત્ર શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ ભીંતચિત્ર દેશભરના 75 હુન્નરમંદ કારીગરોએ બનાવેલા માટીના 2975 કુલડીથી તૈયાર કરાયું છે. આઝાદ દેશના 75મા વર્ષે 100 સ્કેવરમીટરનું આ ભીંતચિત્ર પૂજ્ય બાપુને પરફેક્ટ ટ્રિબ્યુટ છે. એટલું જ નહીં, સાબરમતીના સંત તરીકે જાણીતા ગાંધીજીના ભીંતચિત્ર માટે સાબરમતી રિવરફ્રન્ટથી વિશેષ કોઈ અન્ય જગ્યા ન હોઈ શકે.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યમંત્રી સર્વશ્રી હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અરવિંદભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ●



કચ્છના સરહદી ગામોના ગ્રામજનો સાથે સંવાદ સાધતા રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાજેતરમાં કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી હતી. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છના ભચાઉ તાલુકાના છેવાડાના રતનપર, અમરાપર, જનાણ, બાંભણકા અને ગણેશપુર જેવા સરહદી વિસ્તારના પાંચ ગામો તથા ભુજ તાલુકાના સરહદી કુરન ગામની ની સૌ પ્રથમવાર મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ સરહદી ગામોની સૌ પ્રથમવાર મુલાકાત લેતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હરખની હેલી જોવા મળી હતી.

રાજ્યપાલશ્રીએ જનતા સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામડાઓએ છેવાડાના નહીં પરંતુ દેશના પ્રથમ ગામડાઓ છે, જ્યાંથી દેશની અને રાજ્યની શરૂઆત થાય છે. અને આ વિસ્તારના લોકો સૈનિકોની જેમ દેશની રક્ષા કરવામાં મહત્વનું યોગદાન આપે છે. આ વિસ્તારના ખેડૂતો બહેનો અને યુવાનો મહેનતુ મજબૂત હોય છે અને પોતાની રાહ જાતે જ પસંદ કરે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ સંસ્કૃતિ સાચા અર્થમાં જળવાઈ રહે છે તેમજ તેમાં આધુનિક વિચારધારા સંમિશ્રિત થતા વિકાસની અનેક નવી દિશાઓ ખુલી છે. ખડીર બેટના ધોળાવીરા નજીક આવેલા ભારત પાકિસ્તાન સરહદ પરના આ ગામડાઓમાં વિશ્વની સૌથી પ્રાચીન પરંપરાની જાળવણી આજની તારીખે પણ જીવંત છે. ધોળાવીરા અને ધોરડોને જોડતો એક નવો વિકાસ માર્ગ તૈયાર થઈ રહ્યો છે. ઘડુલી-સાંતલપુર માર્ગ તૈયાર થયા બાદ ટુરિઝમ, બિઝનેસ અને રોજગારી અનેક નવી તકોનું નિર્માણ થશે. આ માર્ગ ધોળાવીરા અને તેના આસપાસના ગ્રામ્ય



વિસ્તારોને ઉત્તમ શિખર પર પહોંચાડનાર સાબિત થશે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.

આ તકે રાજ્યપાલશ્રીએ યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, વિચારોની તાકાત ખૂબ જ મોટી છે. નવા વિચારો નવા ભારતનું નિર્માણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આત્મનિર્ભર ભારતનો વિચાર કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો વિચાર સાકાર થવા જઈ રહ્યો છે, તેમાં આપનું યોગદાન અમૂલ્ય રહેશે.

વિવિધ સખીમંડળની બહેનો સાથેના સંવાદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહિલાઓનું વિશેષ યોગદાન છે. તેમજ રોજગાર નિર્માણના જન આંદોલનમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની સખીમંડળ વિશેષ યોગદાન આપી રહી છે જેના થકી ગ્રામ્ય સંસ્કૃતિઓ અને ગામડાઓ



સમૃદ્ધ અને મજબૂત બની રહ્યા છે.

ખડીર બેટના સરહદી વિસ્તારોના ગામડાઓમાં ખેતી અને પશુપાલન કરતા નાગરીકોને રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કર્યા હતાં અને પ્રાકૃતિક કૃષિ અપનાવીને ગામડાઓને સમૃદ્ધ કરવા એક નવી રાહ દેખાડી હતી.


રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધર્મશાળા ખાતે આવેલા શહીદ જવાનોની યાદમાં બનાવાયેલા વોર મેમોરિયલ ખાતે દેશના શહીદ જવાનોને ભાવાંજલી અર્પિત કરી હતી. વોર મેમોરિયલની મુલાકાત બાદ રાજ્યપાલશ્રીએ દેશના સીમાડાઓની રાત દિવસની પરવાહ કર્યા વિના નિસ્વાર્થ ભાવે દેશભક્તિ સાથે સેવા બજાવતા સીમા સુરક્ષા બલ (બી.એસ.એફ) ના બટાલિયન ઉના જવાનો સાથે સંવાદ કર્યો હતો.

આ ઉપરાંત કંડલાના પંડીત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટની પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પોર્ટ ઇન્ટ વોટર એરીયા, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાર્ગો જેટી ૧ થી ૧૬ અને લિક્વિડ જેટીની ટગ-ફેરીમાં બેસીને મુલાકાત લીધી હતી. તેમજ પોર્ટની કામગીરી વિષે અવગત થયા હતા. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી રાજ્યપાલશ્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ●

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. (ADC બેન્ક) દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ. સાથે એક લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. બેન્કના કાર્યક્ષેત્રના વિસ્તારમાંથી દસકોઈ, ગાંધીનગર અને દહેગામ એમ ત્રણ તાલુકાના ખેડૂતો માટે બેન્ક દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યશાળામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રકૃતિની રક્ષા સાથે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માગ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. તેમણે ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે ખેડૂતોને રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી મુક્તિ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે. રાસાયણિક કૃષિમાં ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગને કારણે ખેતીલાયક જમીન



પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. એટલું જ નહીં, પાણી અને પર્યાવરણ પણ દૂષિત થાય છે. ખાદ્યાન્નોમાં રસાયણો ભળવાને કારણે લોકો કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. કૃષિખર્ચ વધતો રહ્યો છે અને ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટતું રહ્યું છે, જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે, આ તમામ સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક કૃષિ દ્વારા મળી શકે છે, કારણ કે આ કૃષિપદ્ધતિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

રાજ્યપાલશ્રીએ દેશી ગાયનાં છાણ અને ગૌ-મૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગિતા દર્શાવી પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, આચ્છાદન અને વાપ્સાના મહત્વને સમજાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રશિક્ષણ દ્વારા માસ્ટર ટ્રેનર બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. આ તાલીમ કાર્યશાળામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ, ગુજરાત પ્રદેશના શ્રી દીક્ષિતભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રશિક્ષણ આપ્યું હતું. ●

નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો દીક્ષાંત સમારોહ યોજાયો

નવસારી કૃષિ યુનિવર્સિટીનો સત્તરમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી સમર્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ કૃષિવૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કૃષિવૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન ઈનોવેશન-સંશોધનો કરી, કૃષિસમૃદ્ધિનો નવો માર્ગ કંડારે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરક્ષેત્રમાં વિકાસલક્ષી પરિવર્તન આવી રહ્યું છે ત્યારે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા બાદ ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત-ક્રાંતિ સમયની માગ હતી. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યમી



જગતના તાતની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે. આત્મનિર્ભર ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મનિર્ભર બને તે જરૂરી છે. સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતરમુક્ત કૃષિ ઊપજ પેદા કરવા કૃષિમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અસ્પી કૃષિ સંશોધન અને વિકાસ ફાઉન્ડેશન, મુંબઈના સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટરશ્રી કિરણભાઈ પટેલ, અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ પી. પટેલના હસ્તે ૨૨ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ-૩૪ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કૉલેજના પ્રોફેસરશ્રીઓને બેસ્ટ ટીચર તરીકેના અવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ●

રાજ્યનાં જિલ્લામથકોએ મહેસૂલમેળા યોજાશે

રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓના લાભ ઘરઆંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લામથકોએ 'મહેસૂલમેળા' યોજવા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોના હિતલક્ષી લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી અને મહેસૂલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે નવસારીથી મહેસૂલમેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યાં. મહેસૂલમેળામાં જિલ્લા કક્ષાના આઠ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોવિડની ગાઈડલાઈનને ધ્યાને રાખીને યોજાનારા મેળામાં નામ કમી કરવું, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરાશે. તેમાં જરૂર પડ્યે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.

ગુજરાત હંમેશા ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને અનુસરવાવાળું રાજ્ય છે. રાજ્યમાં આગામી સમયમાં તમામ જિલ્લામાં ચેરિટી કમિશનરની કચેરીના નવા સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે ભરૂચ અને ગોધરા ખાતે ચેરિટી કમિશનરની કચેરીના નવા ભવનનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં અરવલ્લીના મોડાસામાં નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે વધુ સાત જિલ્લામાં નવા ચેરિટી કમિશનરની કચેરીના ભવનનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. ગુજરાતમાં હાલમાં ૩,૨૪,૨૯૪ ટ્રસ્ટો નોંધાયેલાં છે, જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ ટ્રસ્ટોના ૧૮,૦૦૦થી વધુ કેસો પડતર હતા. છેલ્લાં ૫ વર્ષમાં ૧૮,૦૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે સંપૂર્ણ પારદર્શક વહીવટ માટે અત્યાર સુધીમાં ચાર કરોડ દસ્તાવેજોનું ડિજિટલાઈઝેશન કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓની વિગતોની પણ SMS દ્વારા સંબંધિત ટ્રસ્ટોને જાણ કરવામાં આવશે. વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપમાં મોટી સંખ્યામાં મકાનો પડી ગયાં હતાં. આ ઘટના બાદ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને NGO દ્વારા ૨૦ હજાર જેટલાં મકાનો

તૈયાર કરીને લોકોને આશરો આપ્યો હતો. આમાંથી ૬,૦૦૦ જેટલાં મકાનોની સનદ તૈયાર કરી છે, જ્યારે આગામી એક માસમાં બાકીનાં મકાનોની સનદો તૈયાર કરીને તેમને મકાનમાલિકીના હક્કો- અધિકારો આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા સહાયરૂપ બનવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ગરીબ કલ્યાણમેળાનો ૧૨મો તબક્કો આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યનાં તમામ જિલ્લામથકોએ યોજાશે, જે અંતર્ગત અંદાજે ૩૭ ગરીબ કલ્યાણમેળાનું આયોજન કરાયું છે. રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણમેળાઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. મુખ્યમંત્રીશ્રી તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે, તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે અને તા. ૨૬મી ફેબ્રુઆરીના રોજ અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. જિલ્લામથકોએ યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓ,

સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે પણ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિભાગોમાં ભરતીપ્રક્રિયાઓ હાથ ધરી છે. આ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જિતેન્દ્રભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, વનવિભાગમાં વનરક્ષકની ૩૩૪ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રહેલી આ ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરાશે. જેમાં ઉમેદવારો દ્વારા જે તે વખતે ભરેલાં ફોર્મ માન્ય રહેશે. આ ભરતીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે ૭૭૫ જેટલી વધુ નવી જગ્યાઓ માટે પણ ભરતીપ્રક્રિયા હાથ ધરાશે.

દેશના નાગરિકોને કોવિડ-૧૯થી સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વનુ સૌથી મોટું રસીકરણ અભિયાન દેશભરમાં યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ૧૦ કરોડથી વધુ ડોઝથી નાગરિકોને સુરક્ષિત કરીને દેશભરમાં અગ્રિમ સ્થાન હાંસલ કર્યું છે. આગામી સમયમાં પણ ૧૦૦ ટકા રસીકરણ થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહ્યું છે. રાજ્યમાં ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવા બદલ મુખ્યમંત્રીશ્રીએ તમામ આરોગ્યકર્મીઓ તથા સહકાર આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યાં છે. ●



સ્વાતંત્ર્યસેનાની અબ્બાસ તૈયબજીને પુષ્પાંજલિ



સ્વાતંત્ર્યસેનાની અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમસ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા શ્રી નીમાબહેન આચાર્ય દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ડૉ. નીમાબહેન આચાર્ય જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના પ્રિય તૈયબજીના જીવનમાંથી પ્રેરણા લઈ પ્રામાણિકતાના પ્રહરી બનવું જોઈએ. તૈયબજીનો જન્મ તા. ૧લી ફેબ્રુઆરી, ૧૮૫૪ના રોજ વડોદરામાં થયો હતો. તેઓ લંડન જઈને બેરિસ્ટર બન્યા હતા અને સયાજીરાવ ગાયકવાડ સરકારમાં તેઓશ્રી ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ ગાંધીજીની વફાદાર વ્યક્તિ હતા. તિલક સ્વરાજ્ય ફંડની ઉઘરાણી અંગે પણ સૌથી વધુ ફંડ ઉઘરાવી તેઓ પ્રથમ રહ્યા હતા.

આ પ્રસંગે પશુપાલન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા, વિધાનસભાના સચિવ શ્રી ડી. એમ. પટેલ તથા વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહીને શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યાં હતાં.

મહાનગરપાલિકાનાં વિકાસકાર્યોની સમીક્ષા



શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે સમીક્ષા બેઠક તાજેતરમાં યોજાઈ હતી, જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં નગર આયોજન વધુ સુવ્યવસ્થિત થાય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારમાં નગર આયોજન વધુ સુદૃઢ અને સુવ્યવસ્થિત થાય તે માટે વધુ ને વધુ નવી નગરરચના યોજનાઓ ઝડપથી બનાવી અને આ યોજનાઓનો પરામર્શ નિયત કરેલી ૬૦ દિવસની સમયમર્યાદામાં અચૂક આપવો. ટાઉન પ્લાનિંગ સ્કીમો અંતર્ગત મહાનગરપાલિકાઓને સંપ્રાપ્ત પ્લોટોમાં થયેલાં દબાણો દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરાશે અને જરૂર જણાયે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ વધુ સુદૃઢ બને અને વિકાસનાં કામોને વધુ વેગ મળે તે ધ્યાનમાં લઈ વેરાવસૂલાતની કામગીરી વધુ વેગવંતી બનાવાશે.

પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન FRC કોર્ષમાં SC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

રાજ્યભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે વિગતો આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ સુધી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન-એફ. આર.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ચૂકવવામાં આવતી હતી. તે જ ફી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય ત્યા સુધી ચૂકવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અભ્યાસક્રમોમાં ફી રેગ્યુલેટરી કમિટી” અસ્તિત્વમાં છે અને જેની ફી નિર્ધારણની સમય મર્યાદા વર્ષ ૨૦૨૦-૨૧ સુધી હતી પણ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફી નક્કી કરવાની બાબત હાલ કાર્યવાહી હેઠળ છે, તેવા અભ્યાસક્રમો અંતર્ગત પણ અગાઉના વર્ષમાં “ફી રેગ્યુલેટરી કમિટી” દ્વારા જે ફી નક્કી કરવામાં આવેલી હોય તેટલી જ ફી ચૂકવવાની રહેશે. જ્યારે ફી રેગ્યુલેટરી કમિટી” ફી નક્કી કરે ત્યારે તે મુજબ ફી ચૂકવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓને વર્ષ ૨૦૧૯-૨૦ સુધી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલ હતી અને વર્ષ ૨૦૨૦-૨૧થી બાકીના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ ચૂકવી શકાયેલ નથી. તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાના ઉમદા હેતુથી અને વિદ્યાર્થીના વિશાળ હિતને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગોધરામાં જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનું લોકાર્પણ

ગોધરા ખાતે રૂ. 1.78 કરોડના ખર્ચે નિર્મિત જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનું લોકાર્પણ તાજેતરમાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન ટ્રસ્ટો, એનજીઓએ કરેલી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે આપણે સર્વેને જાણકારી છે. ચેરિટી કમિશનર કચેરી કોરોના મહામારી



દરમિયાન પણ સતત કાર્યરત રહી હતી અને દર મહિને 700થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવતો હતો. ત્યારે આ ટ્રસ્ટોની અગત્યને ધ્યાનમાં રાખીને તેમને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ બહેતર બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગોધરા ખાતે નવી ચેરિટી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચેરિટી કમિશનરની કચેરી દ્વારા અરજદારોને સરળતા રહે તે માટે 4 હજારથી વધુ દસ્તાવેજોને ડિજિટલાઇઝ કરવામાં આવ્યા છે અને ચુકાદાઓ, ટ્રસ્ટીઓનાં ફેરફાર અંગેની માહિતી સહિતની વિગતો ઓનલાઇન મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોના કટોકટી દરમિયાન મહેસૂલ વિભાગની સુંદર કામગીરીની સરાહના કરતાં મહેસૂલમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડથી રાજ્યભરમાં મહેસૂલમેળાની શરૂઆત કરી લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ થશે. મહેસૂલ વિભાગના કોઈ પણ કક્ષાના અધિકારીને લગતી ફરિયાદોની તપાસ માટે એક 17 સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) બનાવવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કામિનીબહેન સોલંકી, સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, કાલોલનાં ધારાસભ્ય સુશ્રી સુમનબહેન ચૌહાણ, ચેરિટી કમિશનર શ્રી વાય.એમ. શુક્લ, અધિકારીઓ-વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં વિવિધ કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરાશે

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે એ માટે ન્યાયતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ. ૮૧ કરોડની વહીવટી મંજૂરી રાજ્ય સરકારે આપી છે. કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ અને ફેમિલી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીશ્રીઓનાં રહેણાકો માટે ક્વાર્ટર બની રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં રૂ. ૮૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

મંત્રીશ્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સ્પીડી જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ્સના મહત્વના પરિબળ એવા એટલે કે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રિમતા આપી છે. તેના ભાગરૂપે હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના ન્યાયાલયના નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૬૦.૩૩ કરોડ અને થરાદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. ૧૨.૩૩ કરોડ મળી કુલ રૂ. ૭૨.૬૭ કરોડની વહીવટી મંજૂરી આપી પ્રજાલક્ષી અભિગમ અપનાવ્યો છે. આ કોર્ટ બિલ્ડિંગ અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ થતાં નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તથા તે જગ્યાએ કાર્યરત કર્મચારી/અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

તેમણે ઉમેર્યું કે દિવ્યાંગો માટે વડાપ્રધાનશ્રીના એક આગવા અભિગમને આગળ વધારતાં રાજ્યની કલોલ, દહેગામ, માલપુર, ઈંડર, તલોદ, ભીલોડા ખાતેની અદાલતોમાં દિવ્યાંગ વ્યક્તિ સુગમતાથી પ્રવેશ કરી શકે અને એમના માટે વ્યવસ્થાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકારે રૂ. ૫૧.૬૭ લાખની વહીવટી મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધામાં વધારો કરવા માટે રૂ. ૩.૪૪ કરોડની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે.

બિલેશ્વરપુરામાં મોડેલ ઇ-ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

ગાંધીનગરના કલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ બિલેશ્વરપુરામાં અંદાજે રૂ. એક લાખના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલા પુસ્તકાલયનું ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિલેશ્વરપુરા ગામ ઇ-ગ્રામ સેવામાં છેલ્લા ચાર વર્ષથી જિલ્લા સ્તરે પ્રથમ આવતા રોકડ પુસ્તકાર મળેલ છે. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ઇ-ગ્રામ પંચાયતને આર.ઓ.મશીન, બેટરી બેકઅપ, જમ્બો પ્રિન્ટર, લેમીનેશન મશીન અને અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરી આપીને મોડેલ ઇ-ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. આ તકે મોડલ ઇ-ગ્રામ પંચાયતનું પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ ગ્રામ પંચાયત અને એન.જી.ઓ. થકી તૈયાર કરવામાં આવેલા મોડેલ નંદધરની પણ મુલાકાત લીધી હતી. આ નંદધરમાં જે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. તેની માહિતી પણ મેળવી હતી. તેમજ નંદધરનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ગામમાં તૈયાર કરવામાં આવેલા ધ્યાનકર્ષિત ચબુતરાની પણ મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીની મુલાકાત દરમ્યાન તેમની સાથે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દેવાંગી દેસાઈ, કલોલ પ્રાંત અધિકારી શ્રી કિષ્ના વાધેલા, કલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



પોલીસસેવાઓ હવે વધુ સરળ બનશે...



દેશભરમાં કાયદો-વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ - કર્મચોગીઓને જાય છે. શાંતિ ઝંપતી ગુજરાતની ખમીરવંતી પ્રજા હર્મેશાં રાજ્ય પોલીસના પડપે રહી છે. પોલીસ સરળતાથી લોકોની સેવા કરી શકે એ માટે ગુજરાત પોલીસને પેટ્રોલ કાર, સી- ટીમ વાન, પી. સી.આર. વાન અને મોટરસાઈકલ મળી કુલ - ૯૪૯ વાહનોને ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યાં હતાં.

ગૃહ વિભાગ દ્વારા પોલીસસેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદાયેલાં વાહનોને પ્રસ્થાન કરાવતાં ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા રાજ્યનાં ૪ મહાનગરો ખાતે She ટીમ કાર્યરત કરવામાં આવી છે. She ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતાં કાર્યો કરવામાં આવ્યાં છે. તેમનાં આ ઉમદા કાર્યોને વધુ વેગમાન બનાવવા માટે આ ટીમને ૬૮ બોલેરો ગાડી આપવામાં આવી છે.

એક જ દિવસમાં રાજ્યના પોલીસ વિભાગની સેવાને વધુ ઝડપી બનાવવા માટે વિવિધ જિલ્લામાં ૯૪૯ વાહનોનો ઉમેરો થયો છે, જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓની કામગીરીમાં સરળતા લાવવા માટે ૧૦૦ સ્કૂટર આપવામાં આવ્યાં છે તેમજ પોલીસ જવાનોની ટ્રાફિક, તપાસણી અને અન્ય કામગીરી માટે ૨૯૮ આધુનિક બાઈક આપવામાં આવ્યા છે. તેમજ ૪ મહાનગરોમાં કાર્યરત She ટીમ માટે ૬૮ બોલેરો આપવામાં આવી છે. તેમજ ૫૫ પી.સી.આર.વાન અને શહેર- જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ઘોરીમાર્ગોની સલામતિ જેવી કે, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ, નાગરિકોની સુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા માટે ૪૦૦ પેટ્રોલ વાન આપવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારીશ્રીઓના કાર્યોની સરળતા માટે ૨૮ ઈનોવો ગાડી આપવામાં આવી છે.

જન-જનને ભૂજલ



રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે અટલ ભૂજલ યોજના શરૂ કરાઈ છે. તાજેતરમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અટલ ભૂજલ યોજના અંગે માહિતી પહોંચતી કરવા ગાંધીનગરથી 'અટલ ભૂજલ રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

રાજ્યના અંતિમ નાગરિક સુધી અટલ ભૂજલ યોજનાનો સંદેશો પહોંચતો કરી “જન-જનને ભૂજલ” માટેનો સંકલ્પ કર્યો હોવાનું જણાવી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના પાણીથી અસરગ્રસ્ત

વિસ્તારોમાં 'અટલ ભૂજલ યોજના' અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરીને પાણીના સ્તર ઊંચા લાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાવો હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત દેશભરમાં શરૂ કરાયેલી 'અટલ ભૂજલ યોજના' અંતર્ગત સરકાર અને સમાજના સહિયારા પ્રયાસ અને જનભાગીદારીથી પાણીના ટીપેટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય, પાણીનો વ્યય ઘટે અને સંગ્રહમાં વધારો થાય, ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ દ્વારા પાણીની અછતવાળા વિસ્તારોમાં ભૂગર્ભ જળ સંસાધનોના સંચાલનને વધુ સુદૃઢ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

અટલ ભૂજલ યોજના અંગે જનજાગૃતિ વધે તે માટે ગુજરાત રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્યના ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ ૬ જિલ્લાઓના ૩૬ તાલુકાઓનાં ૨૨૫૨ ગામડાંઓમાં અટલ જલ રથનું ભ્રમણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શ્રેષ્ઠ અમલવારી માટે વિવિધ રાજ્યો માટે કુલ ૬૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યને કુલ રૂ. ૭૪૧.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવ્યો છે, જેમાં રૂ. ૨૦૨.૧૨ કરોડ ઈન્વેસ્ટમેન્ટ કમ્પોનન્ટ માટે અને રૂ. ૫૩૯.૧૧ કરોડ ઈન્સ્ટિટ્યુટ કમ્પોનન્ટ માટે ફાળવણી કરવામાં આવી છે.

પારડી નગરપાલિકાને વિકાસકાર્યોની ભેટ

પારડી નગરપાલિકાને લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ તથા જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી માર્ગોના વિકાસકામોની ભેટ મળી છે. નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદહસ્તે રૂ. ૧૪૧.૬૧ લાખના ખર્ચે લાઈબ્રેરી, રૂ. ૮૭.૭૪ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ અને રૂ. ૧૩૬.૫૮ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોના સી.સી. તથા આર.સી.સી. રસ્તાઓનાં ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નૂતનનગર તથા સ્વાતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્વાતિ કોલોનીનાં કામોનાં લોકાર્પણ મળી કુલ રૂ. ૪૩૧.૬૪ લાખનાં વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પારડી નગરપાલિકા ટીમની



કામગીરીની બિરદાવતાં જણાવ્યું હતું કે, પારડી વિસ્તારમાં અનેકવિધ વિકાસકાર્યો થઈ રહ્યાં છે. આવનારા સમયમાં પણ અનેકવિધ કામો થકી નગરપાલિકા વિસ્તારને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. સફાઈ કામદારો માટે

મકાનો બનાવવા, શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરીનું સુચારુ આયોજન કરવા તેમજ સોલિડ વેસ્ટ સાઈડની કામગીરી એક વર્ષમાં પૂરી થાય તેમજ કિલ્લાના વિકાસ માટે આગવી ઓળખ તરીકેની સુવ્યવસ્થિત યોજના બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

રાજકોટમાં મીડિયાકર્મીઓ માટે પ્રિકોશન ડોઝનો કેમ્પ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીડિયાકર્મીઓ માટે કોરોનાના વેક્સિનેશન - પ્રિકોશન ડોઝ કેમ્પ પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દુનિયાના બીજા દેશો હજુ કોરોનાના નિયંત્રણ માટે મથામણ કરી રહ્યા છે. દેશ અને રાજ્યમાં રસીકરણના માધ્યમથી લોકોને કોરોના સામે સુરક્ષિત કરવામા આવી રહ્યા છે. રાજ્યમંત્રીશ્રીએ આ તકે કોરોના વેક્સિન લેવામાં જે બાકી હોય તેવા લોકોને વહેલી તકે વેક્સિન લઈ લેવા બધાને સુરક્ષિત થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા, મેયર શ્રી ડો. પ્રદીપ ડવ, કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબહેન શાહ, સ્ટેનિંગ કમિટીના ચેરમેન શ્રી પુસ્કરભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કેમ્પમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના



માર્ગદર્શન હેઠળ ડો. ભાવિન મહેતા, ડો. યોગિતા મુંગરા અને આરોગ્ય સ્ટાફે કામગીરી બજાવી હતી. આ કેમ્પમાં ૧૨૦ જેટલા મીડિયાકર્મીઓ અને તેમના પરિવારના સભ્યોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો.

ઓલપાડનાં ગામોને પાઇપલાઇનથી ગેસ મળશે

ઓલપાડ તાલુકા પંચાયત કચેરીમાં સરપંચ-ઉપસરપંચો અને અધિકારીઓ સાથે કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાનાં તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઇન પહોંચાડવાનું લક્ષ્ય છે. ઓલપાડ તાલુકામાં હાલ ૬૧૦૦ ગેસ કનેક્શન છે, જેમાં વધુ ૧૭ જેટલા ગામોને પણ ગેસપુરવઠો પૂરો પાડવાનું નક્કર

આયોજન છે.

હળપતિ આવાસ અંતર્ગત હવે પાકાં મકાનો બનાવવામાં આવી રહ્યાં છે, જેનાથી હળપતિ લાભાર્થીઓને શ્રેષ્ઠ આવાસીય સુવિધાઓ મળશે એમ જણાવતાં મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર ઉભરાટ, તીથલ, સુરત, ભરૂચ, ખંભાત, ચોરવાડને જોડતો નવો કોસ્ટલ હાઈવે બનાવશે, જેનું મેપિંગ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ હાઈવેથી દક્ષિણ ગુજરાતની યાતાયાતની સુવિધાઓમાં અને વિકાસની તકોમાં અનેકગણો વધારો થશે, જેનો લાભ ઓલપાડ તાલુકાને પણ મળશે.

મંત્રીશ્રીએ નવા ચૂંટાયેલા સરપંચ-ઉપસરપંચશ્રીઓને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે સંવેદનશીલતાના ભાવ સાથે પ્રજાજનોનાં કામ થાય, ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશ પટેલ, અગ્રણી મનહર પટેલ, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષ ચાવડા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ, સરપંચ-ઉપસરપંચશ્રીઓ, અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ●



ભોજનની શુદ્ધતાની ચકાસણી કરતી ફૂડ રિસર્ચ લેબોરેટરી

વિપુલ ચૌહાણ

બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય સરકારની સૂચનાથી આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીનગરસ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરી (FRL) દ્વારા આ મામલે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ચોખા પ્લાસ્ટિકના ચોખા નહીં, પરંતુ પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા છે. બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા મૂળભૂત ચોખામાં પ્રોસેસ કરી પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે.

ફૂડ રિસર્ચ લેબોરેટરીના પ્રોજેક્ટ હેડ તેમજ ડાયરેક્ટોરેટ ઓફ રેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી એચ. પી. સંઘવી અને અગ્ર અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક શ્રી તુષાર ધોળકિયાએ આ અંગે વધુ વિગત આપતાં કહ્યું હતું કે, ફોર્ટિફાઈડ ચોખામાં માર્ઠકો ન્યુટ્રિયન્ટ્સ - ફોલિક એસિડ (વિટામીન B9), વિટામિન B12 તથા આયર્નની માત્રા ઉમેરવામાં આવે છે.

નાગરિક પુરવઠા નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સંજય મોદીએ જણાવ્યું કે, માર્ઠકો ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખાના દાણા કરતાં સહેજ જુદા રંગના-થોડા પીળાશ પડતા અને આકારમાં પણ થોડા જુદા હોય છે.

ભારત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૧થી સમગ્ર દેશમાં પોષણયુક્ત ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહ્ન ભોજન યોજના (MDM) હેઠળ વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરી છે. ચોખાના જ લોટમાંથી ફોર્ટિફાઈડ ચોખા તૈયાર કરવામાં આવે છે. તેમાં માર્ઠકો ન્યુટ્રિયન્ટ્સ - ફોલિક એસિડ, વિટામીન B12 તથા આયર્નની માત્રા ઉમેરી, તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા



જ દાણા તૈયાર કરવામાં આવે છે. તેને તાંત્રિક ભાષામાં FRK (Fortified Rice Kernel) કહેવામાં આવે છે. આ ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખામાં ૧૦૦:૧ના પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.

પોષણક્ષમ ફોર્ટિફાઈડ ચોખા મધ્યાહ્ન ભોજન યોજના

(MDM) હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં શાળાઓ બંધ હોવાથી આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઈ જઈને રાંધીને તેનો વપરાશ કરે છે, જેથી ફોર્ટિફાઈડ ચોખા ટેખાવમાં સહેજ અલગ રંગ અને આકારના જણાતા હોઈ સામાન્ય નાગરિકોમાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તી રહી છે.

રાજ્યના નાગરિકોમાં પ્લાસ્ટિકના ચોખા અંગે ગેરમાન્યતા પ્રવર્તતા રાજ્ય સરકારે નિગમ સંચાલિત ફૂડ રિસર્ચ લેબોરેટરી

મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજનમાં અપાતા ચોખા, પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ દૂર કરતી ફૂડ રિસર્ચ લેબોરેટરી (FRL)

(FRL) દ્વારા વૈજ્ઞાનિક ઢબે જરૂરી પરીક્ષણ કરી ચોખાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ફોર્ટિફાઈડ ચોખા રાંધતા મૂળભૂત ચોખાની જેમ જ રંધાઈ જાય છે, તેને બાળવામાં આવે તો પ્લાસ્ટિક જેવી દુર્ગંધ આવતી નથી તેમજ આ ચોખા પાણીમાં નાખવાથી ફૂલીને પોચા પણ પડી જાય છે. ●

ખીજડિયા વન્યજીવ અભયારણ્ય રાજ્યની ચોથી રામસર સાઇટ

વિરેન્દ્રસિંહ પરમાર

જામનગર જિલ્લાના ખીજડિયા વન્યજીવ

અભયારણ્યને વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day)ના પ્રસંગે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તે ચોથી રામસર સાઇટ બન્યું છે. લોકો તેમજ પૃથ્વી માટે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આર્દ્ર ભૂમિના મહત્વ અંગે થયેલી 'રામસર સંધિ' પર થયેલા હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે ૨૭ ફેબ્રુઆરીના રોજ વૈશ્વિક આર્દ્રભૂમિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.



બીજી તરફ દરિયાનું ખારું પાણી હોઈ એક અલગ વિસ્તારનું નિર્માણ થયું. ખીજડિયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે.

ભારતના જાણીતા પક્ષી નિષ્ણાત સલીમ અલીએ ૧૯૮૪માં ખીજડિયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની ૧૦૪ જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું. આ અંગે વધુ વિગતો આપતાં ખીજડિયા પક્ષી અભયારણ્યના આર.એફ.ઓ. સુશ્રી

હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે ખીજડિયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ખીજડિયા પક્ષી અભયારણ્ય એ ૬.૦૫ કિ.મી.ના વિસ્તારમાં તાજા પાણીનાં તળાવો, ખારા તેમ જ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જતું રોકવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને

દક્ષાબહેન વઘાસિયાએ જણાવ્યું હતું કે, અહીં જૈવ વૈવિધ્ય ખૂબ જ દુર્લભ છે. આ અભયારણ્ય લુપ્ત થતી પ્રજાતિનું પણ ઘર બન્યું છે અને અહીંના સાનુકૂળ વાતાવરણને કારણે આ દુર્લભ પ્રજાતિની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.

ભારતમાં કુલ 49 રામસર સાઇટ થઈ છે. દર વર્ષે તેમાં નવાં નવાં સ્થળો ઉમેરવામાં આવે છે. વર્ષ 2012માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઇટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણ તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીકના ખીજડિયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતાં કુલ હાલ ગુજરાતમાં રામસર સાઇટનો આંક ચાર પર પહોંચ્યો છે.

કયા દેશનાં પક્ષીઓ બને છે ખીજડિયાનાં મહેમાન

શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઈબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઈગ્રેટ થઈ પક્ષીઓ ખીજડિયા અભયારણ્ય ખાતે આવે છે. ઈન્ડો-એશિયન ઉડ્ડયન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું બન્યું છે. અહીં પક્ષીઓની ૩૧૪ જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે, જેમાંના ૧૭૦ જાતિનાં પક્ષીઓ યાયાવર છે, જ્યારે ૨૮ જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે, જેમાં કાળી ડોક ટૉક (બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચિયા (કોમન પોચાર્ડ), નાની કાંકણસાર (ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી (ગ્રેટ કેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.

રામસર સાઇટ શું છે?

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળસંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે, જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઈકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા સસ્તેનેબલ (ટકાઉ) માનવજીવન માટે ઘણું જ મહત્ત્વ ધરાવે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે. તાજો મુખ્ય પુરવઠો સંખ્યાબદ્ધ જળસંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે.



દાડમની ખેતીમાંથી મેળવી મબલખ કમાણી...

હેમલતા પારેખ



‘પાણી બચાવીને ડ્રીપ ઈરિગેશનથી ખેતીનું મહત્વ સમજી જો ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો સિસ્ટમબદ્ધ ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે. ડ્રીપ પદ્ધતિ, સિસ્ટમેટિક ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન થાય છે. ઓછું નીંદામણ અને ખર્ચ પણ ઘટે તેમજ ઉચ્ચ ગુણવત્તા અને વધુ પાક મેળવી શકાય છે.’ આ શબ્દો છે તાજેતરમાં રાજ્ય સ્તરે બેસ્ટ આત્મા ફાર્મર્સ અવોર્ડ મેળવનાર પ્રગતિશીલ ખેડૂત શ્રી વિનોદભાઈ માવજીભાઈ વેકરિયાના! કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના નારણપર ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી વિનોદભાઈ વેકરિયાએ તાજેતરમાં જ એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, ગુજરાત ‘આત્મા’ દ્વારા રાજ્યસ્તરનો પ્રથમ બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવ્યો છે.

૧૮ એકરના ફાર્મમાં ૧૫ એકરમાં દાડમનું, બે એકરમાં ટ્રેગન અને બે એકરમાં આંબાનું વાવેતર કર્યું છે. વર્ષ ૨૦૧૯માં દાડમના ઉત્તમ વાવેતર માટે રાજ્ય સરકારનો બેસ્ટ આત્મા ફાર્મર્સ અવોર્ડ મળ્યો છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માના હાથે શ્રી વિનોદભાઈ વેકરિયાને રૂ. ૫૦ હજારની ઈનામી રકમ, પ્રમાણપત્ર ને શિલ્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

વિનોદભાઈએ જણાવ્યું કે, ‘મને વર્ષ ૨૦૧૯માં પાંચ હજાર દાડમના ઝાડમાંથી ૨૨૫ ટન દાડમ ઉત્પાદનમાંથી બજારભાવ રૂ. ૩૫ હતો ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધારે રૂ. ૬૫ના કિલો મેળવેલા હતા. રૂ. ૧.૨૫ કરોડની આવક થયેલી, દાડમ ફળની સારી ગુણવત્તા માટે સનબર્નથી બચાવવા ઝાડને ઢાંકવું, ડ્રીપ ઈરિગેશન કરવું, સેન્ટ્રિય ખાતરનો ઉપયોગ કરવો, રોગ જીવાત સમયે યોગ્ય દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોમિત્રોને પોતાનો અનુભવ શેર કરતા વિનોદભાઈ કહે છે કે, અત્યારની ખેતી ખર્ચાળ છે. સિસ્ટમથી ખેતી કરવી જોઈએ ડ્રીપ નહીં અપનાવીએ, પાણીનો બગાડ કરીશું અને આયોજન વગર ખર્ચ કરીશું તો ઉત્પાદન અને આવક પર તેની ધારી આવક નહીં મળે. ●

સરકારી સહાયથી વ્યવસાય કુલ્યો ફાલ્યો...

મહેન્દ્ર પરમાર

નાનાં ગામડાંઓમાં રહેતી મહિલાઓ પણ સારી ધંધાકીય સૂઝ ધરાવતી હોય છે. તેમના બિઝનેસ આઈડિયાને પાંખો મળે તે માટે નાણાકીય રીતે પ્રોત્સાહન મળી તે પણ એટલું જ જરૂરી છે. સરકારની વાજપેયી બેન્કેબલ યોજના આવી મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે. દાહોદના એક નાનકડા ગામની મહિલાએ આ યોજના અંતર્ગત લોનસહાય મેળવીને પોતાના ધંધાને પાંખો તો આપી જ છે સાથે અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી છે.

દાહોદના કઠલા ગામનાં સુમિત્રાબહેન બામણ રેડીમેડ ગારમેન્ટનો નાનાપાયે વેપાર કરતા હતા, જેમાંથી કામચલાઉ આવક મળી રહેતી. રેડીમેડ ગારમેન્ટ બિઝનેસની તમામ આંટીઘૂંટી તેઓ સમજી ચૂક્યા હતા. આ ધંધામાં કઈ રીતે આગળ



વધાય અને સારી એવી આવક મળતી થાય તેનો રસ્તો તેઓ જાણતા હતા.

સુમિત્રાબહેનને આ બિઝનેસ વિકસાવવા માટે નવાં મશીનો ખરીદવા તેમજ કાચા માલની ખરીદી કરવાની હતી, પણ આ માટે જરૂરી મૂડી તેમની પાસે હતી નહીં. તેમણે આ માટે મહિલાઓને સ્વનિર્ભર બનાવતી સરકારની વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રૂ. ૨.૮૦ લાખની સહાય મેળવી.

આ લોનસહાયમાંથી તેમણે રૂ. ૩૦ હજારનાં નવાં મશીનો લીધાં તેમજ બાકીની રકમથી કાચા માલની ખરીદી કરી, નાના પાયે કામગીરી શરૂ કરી દીધી. વાજપેયી બેન્કેબલ યોજનાનો લાભ લઈને હજારો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે. સાથે અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહી છે. કઠલા ગામના સુમિત્રાબહેન બામણ જણાવે છે કે, ‘વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોન સહાય મળતાં હું રેડીમેડ ગારમેન્ટના બિઝનેસને વિસ્તારી શકી છું. છેલ્લાં બે વર્ષમાં માસિક આવક વધીને રૂ. ૫૦ હજાર પહોંચી છે. બે કારીગરો રાખ્યા છે. તેમને પણ પગાર આપી રહી છું.’ ●

વાત જસદણના યુવાનની કે જેણે 'વેસ્ટ'માંથી 'બેસ્ટ' સર્જન કર્યું

રાજ લક્કડ

ગુજરાતના યુવાનો નવી વિચારધારા અપનાવીને સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે. રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો ટેકનોલોજીની બાબતોમાં વિકસિત છે. જસદણ તાલુકામાં વર્ષોથી શ્રેસર, ટ્રેક્ટરની ટ્રોલી તથા ખાસ કરીને પટારા ઉદ્યોગ સહિતના ઉદ્યોગો વિકસિત થયા છે. આ દિશામાં ઈ-બાઈક પ્રોડક્શનના ઉદ્યોગનો નવો પાયો નાખવા આતુર નવલોહિયો અને તરવરિયો યુવાન ભાવિન કવૈયા છે, જેણે પોતાના કૌશલ્ય અને કોઠાસૂઝથી જાતે બાઈક ડિઝાઈન કરીને બનાવ્યું ઈ-બાઈક અને આ એક બાઈક છે, મોપેડ કે સ્કૂટર નહીં.

જાતમહેનતે તૈયાર કરેલા ઈ-બાઈક અંગે જણાવતાં શ્રી ભાવિન કવૈયા કહે છે કે, મેં આઈ.ટી.આઈ.-જસદણમાંથી વર્ષ ૨૦૧૮માં કમ્પ્યુટર ઓપરેટર અને વર્ષ ૨૦૨૦માં મિકેનિકલ ડીઝલનો કોર્સ કર્યો છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેટ જીરોના અભિયાનને આગળ ધપાવવા માટે મારા મગજમાં ઘણા સમયથી ઈ-બાઈકનો વિચાર હતો. કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થતાં આ

સમયના સદુપયોગના ભાગરૂપે મેં જાતે જ મારા બાઈકની ડિઝાઈન તૈયાર કરી.

ભાવિન કહે છે કે, મારા પિતાજી ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. તેમના તરફથી મને ખૂબ જ મદદ મળી છે. બાઈક બનાવવા માટે મેં ભંગાર બજારમાં જઈને જરૂરી સામાનની ખરીદી કરી. મારી ડિઝાઈન મુજબ તેને ફિટ કરીને બાઈકનું સ્ટ્રક્ચર બનાવી લીધું હતું. તેમાં આખા બાઈકની કરોડરજજુ સમાન એવી લિથિયમ ફોસ્ફેટની બેટરીને જોડીને તેને કાર્યરત કરવાનું હતું, જે થતાં તેની સાથોસાથ તેમાં ઘણા બધા પ્રયોગો પછી તેમાં રિવર્સ ગિયર સિસ્ટમ પણ કાર્યરત કરી શક્યો, જેનો અનેરો આનંદ છે. આવી રિવર્સ ગિયર સિસ્ટમ ધરાવતું બાઈક આખા ભારતમાં માત્ર મારી પાસે જ છે.

બાઈક વિશે માહિતી આપતા ભાવિને કહ્યું કે, મારું આ

ઈ-બાઈક સંપૂર્ણ ચાર્જ થયા બાદ ત્રણ કલાક સુધી પ્રતિ કલાક ૮૦ કિ.મી.ની સ્પીડ આપે છે. તેમાં ત્રણ પ્રકારની ગિયર સિસ્ટમ છે. મારું બાઈક સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. સમગ્ર ચોમાસાના ચાર મહિના દરમિયાન મારું બાઈક ક્યારેય બંધ નથી થયું. તેમાં એન્ટી થેફ્ટ સિસ્ટમ લગાવેલી છે, જેથી બાઈક ચોરી કરવાની કોઈ કોશિશ કરે તો તરત ખબર પડી જાય. બાઈક વિશે માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન વિકસાવી રહ્યો છું, જેથી આવનારા સમયમાં બાઈકને

લગતી તમામ વિગતો એક સિંગલ ક્લિક પર ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ટુ લોકલ, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, ઇનોવેશન સહિતનાં અભિયાનોમાં ભાગીદારી નોંધાવવા મારો આ પ્રયત્ન છે. શ્રીન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે તે માટે મારે અફોર્ડેબલ કિંમતે ઈ-બાઈક ઉપલબ્ધ કરાવવાનો મારો પ્રયત્ન સફળ થયો છે. ઈ-બાઈકના પ્રોડક્શન માટે અન્ય કોઈ સંસ્થાની મદદ મળશે તો નજીકના સમયમાં જ પ્રોડક્શન ચાલુ કરીને જસદણ-વીંછિયા વિસ્તારના યુવાઓને રોજગારી પૂરી પાડવાનો મેં સંકલ્પ કર્યો છે.

ઈ-મોપેડ કે ઈ-સ્કૂટર પ્રકારનાં વાહનો ૭૫-૮૦

હજારની કિંમતે માર્કેટમાં મળે છે અને ઈ-બાઈકની કિંમત રૂ. ૧ લાખથી વધુ હોય છે. આજ ઈ-બાઈક અમે માત્ર ૫૦-૬૦ હજારની કિંમતે ટેઈલર મેઈડ ફીચર સાથે બનાવી શકીએ છીએ. આ બાઈક પહેલાં મેં એક ઈ-બાઈક રૂ. ૪૦ હજારની કિંમતે મારા મિત્ર માટે બનાવ્યું છે. મારા મિત્ર પણ ઈ-બાઈકની સરળતાથી સવારી કરે છે. આ પ્રકારનાં બાઈક બનાવવામાં જસદણ આઈટીઆઈના ડીઝલ-મિકેનિક ટ્રેડના શિક્ષકો તથા બાઈક માટે એપ્લિકેશન બનાવવા માટે આઈટીઆઈના કમ્પ્યુટર ટ્રેડના શિક્ષકશ્રી ડી. કે. મકવાણાનું સતત માર્ગદર્શન મળતું રહે છે. ઈ-બાઈકની બેટરી ઇલેક્ટ્રિકિટી વડે ચાર્જ થાય છે, પરંતુ આવનારા સમયમાં સૌર ઊર્જાના ઉપયોગ વડે 'જીરો એક્સપેન્સિવ' - ઈંધણનો ખર્ચ શૂન્ય કરવાના પ્રયત્નો પણ રહેશે. ●



સંજીવની સાબિત થતી પ્રાકૃતિક કૃષિ

✍ સુરેશ મિશ્રા

પાદરા તાલુકાના રાજુપુરાના આ ખેડૂત 'આત્મા'ના માધ્યમથી ખર્ચ વગરની કહી શકાય એવી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી - પ્રચારક છે, જ્યારે ગત વર્ષે કરજણ અને પાદરા તાલુકા સહિતના વિસ્તારોમાં કપાસના પાકમાં વિચિત્ર બીમારી લાગુ પડી હતી. પાદરા તાલુકાના રાજુપુરા ગામના ગૌમાતા આધારિત પ્રાકૃતિક ખેતી કરતા જયેન્દ્રભાઈ પટેલના ખેતરના કપાસનો પાક સલામત રહ્યો હતો. તેમનું કહેવું છે કે, ગૌમૂત્રમાંથી બનાવેલા પ્રવાહી જીવામૃત અને ખાટી છાશ મારા કપાસ માટે સંજીવનીનું કામ કર્યું.

૧૫ વીઘાના આસામી જયેન્દ્રભાઈને જ્યારે ખેતીનો વારસો મળ્યો ત્યારે મોટા ભાગે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની મદદથી ખર્ચાળ ખેતી થતી હતી. મોંઘાં તત્ત્વોને લીધે મળતર ઘટતું હતું અને જમીન કસ વગરની બની રહી હતી. તેમણે માલસરમાં ખેડૂતકલ્યાણ સંસ્થા આત્મા પાસેથી સાત્ત્વિ અને ઓછા ખર્ચવાળી સંપૂર્ણપણે ગૌદ્રવ્યો પર આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. ખેડૂત તરીકેની કોઠાસૂઝથી ગાયના ગોબર, ગૌમૂત્ર, ગાયના દૂધની ખાટી છાશ અને શેઢા પાળેથી મફત મળતી આકડા જેવી કડવી પણ ગુણકારી વનસ્પતિઓની મદદથી પ્રવાહી જીવામૃત અને ઘન જીવામૃત બનાવ્યાં. તેના ઉપયોગથી ખેતીમાં ઉત્તમ પરિણામ મળતાં તેઓ પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રચારક બની અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપે છે.

પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં ધીરજ રાખો...

જયેન્દ્રભાઈ કહે છે કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ વપરાશથી જમીન કસાડીન હોવાથી ધીરજ રાખવી પડે છે. ગાયના છાશ અને ગોબર તેમજ ગાયના દૂધની ખાટી છાશની મદદથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતના ઉપયોગથી બેત્રણ વર્ષમાં જમીન પોચી

છિદ્રાળુ અને કસદાર બને છે, જમીનમાં સારા બેક્ટેરિયા અને અળસિયાં વધે છે અને તે પછી નહીંવત્ ખર્ચે સવાયું ઉત્પાદન મળે છે.

તેઓ કહે છે કે, 'મારી પાસે ત્રણ ગાય અને બે વાછરડી છે, જેના છાશ અને ગૌમૂત્રથી હું ૧૫ વીઘાના પાકોને આપું તો પણ વધે એટલું જીવામૃત થાય છે. હું મારી જરૂરિયાત કરતાં વધારાનું છાશ અને ગૌમૂત્ર અન્ય ખેડૂતમિત્રોને આપું છું અને તેમને આ ખર્ચ વગરની, સાત્ત્વિક અને તંદુરસ્ત ખેતી તરફ વાળવા પ્રયત્ન કરું છું.'

આડકતરો ફાયદો થયો

કપાસના પાકમાં ગૌમૂત્ર અને ખાટી છાશના દ્રાવણના છંટકાવથી સફેદ માખી, લીલી પોપટી, પાનમાં કથીરિયા, ગેરુઆ જેવી જીવાતોનો ઉપદ્રવ લગભગ ઘટી ગયો. તેની સાથે મોટો અને આડકતરો ફાયદો એ થયો કે તેની ગંધથી ખૂબ નુકસાન કરનારાં ભૂંડ આવતાં અટકી ગયાં. આ ગંધથી ફૂદાં આવતાં નથી એટલે ઈયળ પણ થતી નથી.

નવા પ્રયોગો...

જયેન્દ્રભાઈ પ્રાકૃતિક ખેતીથી જીવાતમુક્ત કપાસ, મગ, ઘઉં, રીંગણનો પાક લે છે. હાલમાં બ્રોકોલી પણ વાવી છે. તેમણે આ ક્ષેત્રના કર્મશીલ ભરતભાઈ પરસાણાને અનુસરીને મગ અને ઘઉંમાં પોષણ વધારવા પ્રમાણસર ગાયનું દૂધ, કાળો ગોળ અને પાણીનું દ્રાવણ છાંટ્યું તો ફૂલ વધ્યાં અને છોડ તંદુરસ્ત થયો. ખાટી છાશ, હિંગનું પાણી અને ગૌમૂત્રના દ્રાવણના છંટકાવથી જીવાતમુક્ત રીંગણનો પાક ઊતર્યો. તેઓ કહે છે કે મારે ખેતી માટે બહારથી કશું લાવવું પડતું નથી અને હું આત્મનિર્ભર બન્યો છું.

રાજ્ય સરકારની યોજનાઓ ખૂબ સારી છે...

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ગૌપાલન અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવા જે યોજનાઓ અમલમાં મૂકી છે તે ખૂબ સારી છે. ગાયઉછેરને પ્રોત્સાહિત કરતી યોજના હેઠળ માસિક રૂ. ૮૦૦ પ્રમાણે એક ગાય માટે વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ નિભાવખર્ચ આપવામાં આવે છે. અન્ય યોજનાઓ પણ છે, જેનો લાભ લેવો જોઈએ. તેઓ કૃષિસભાઓમાં પોતાની ખેતી અને પ્રયોગોનું માર્ગદર્શન આપે છે. સરકારે તેમને પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે સિક્કિમ મોકલ્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે જયેન્દ્રભાઈ કહે છે કે, આત્મા અને અન્ય સંસ્થાઓનું માર્ગદર્શન લઈ, સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને ગાયને પાળી, સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લઈ આ ખેતી કરનારાને નિરાશ નહીં થવું પડે. ●

રાજ્યનાં ૪ મહાનગરોમાં વિવિધ વિકાસકામો માટે કુલ ૨૫૩ કરોડ રૂપિયાનાં કામોની મંજૂરી



ત્વરિત નિર્ણય એ ઝડપી વિકાસ માટે અનિવાર્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાતા ત્વરિત નિર્ણયોથી ગુજરાતમાં વિકાસકામોની ગતિને વેગ મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનાં મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસકામો તથા આઉટગ્રોથ વિસ્તારનાં કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે રાજ્યનાં ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને ૨૫૩ કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી આપી છે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં ૮૧ જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઈન, પીવાના પાણીની પાઈપલાઈન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસયોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજથી કરણી માતાના ચોક સુધીના ફ્લાય ઓવરબ્રિજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

એટલું જ નહીં, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીનાં કામો, જુદા જુદા સી. સી. રોડ, સ્ટ્રીટલાઈટ, ડ્રેનેજ લાઈન તથા પાણીની પાઈપલાઈનના મળીને ૧૧૨૯ કામો માટે ૬૩.૫૩ કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી આપી છે.

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-૯ રસ્તાનાં કામો માટે ૯.૧૬ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યનાં આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસકામો માટે સમગ્રતયા રૂ. ૨૫૦ કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ●

વનરક્ષક જગ્યાઓ માટે સીધી ભરતી કરાશે

વનરક્ષક વર્ગ-૩ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઈને આ મોકૂફ રહેલી ભરતીપ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે.

રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કરતાં વનમંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ આગામી ટૂંક સમયમાં સીધી ભરતીથી હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.



આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતીપ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે. આ ૩૩૪ જગ્યાઓની ભરતીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવા વન રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતીપ્રક્રિયામાં જે અરજદારોએ 'સામાન્ય કેટેગરી'ના ઉમેદવાર તરીકે અરજી કરી હોય તેઓ જો 'આર્થિક નબળાં વર્ગ' કેટેગરીનો લાભ મેળવવા માગતા હોય તો તેઓને 'ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ' (OJAS) ઉપર આ વિગતો ભરવા માટે ૧૦ (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે. તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માગતા હોય તેઓએ તા. ૦૧-૦૨-૨૦૨૨ની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના "આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની વિગતો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ" (OJAS) ઉપર અપલોડ કરવાની રહેશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતીપ્રક્રિયાને લગતી કોઈ પણ અદ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. વર્ષ ૨૦૧૮માં હાથ ધરેલા અને અનિવાર્ય કારણોસર મોકૂફ રહેલી ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોઈ આ ભરતીપ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી. આ ૩૩૪ જગ્યાઓની ભરતીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગુજરાત કલા અને સાહિત્યનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું રાજ્ય છે. તેમાં પણ સાહિત્ય એ સાંપ્રત સમયનું પ્રતિબિંબ જીવી માનવીમાં મૂલ્ય-સંસ્કારનું સિંચન કરે છે. સાહિત્યનું આયમન કરવાના ઉમદા હેતુથી આપના માનિતા સામયિક 'ગુજરાત' પાક્ષિકના આ અંકથી 'પારિજાત' સ્વરૂપે સાહિત્યનો વિભાગ શરુ કરવા જઈ રહ્યા છીએ. આપ જાણો છે કે, 'ગુજરાત' પાક્ષિક બહોળો વાચક વર્ગ ધરાવે છે. પાક્ષિકમાં ગુજરાતની જનહિતલક્ષી ગતિવિધિઓ અને વિકાસગાથાની વાતો સાથે ગુજરાતી સાહિત્યની કૃતિઓને પ્રસ્તુત કરવાનો આ વિનમ્ર પ્રયાસ આરંભી રહ્યાં છીએ. જેમાં ટૂંકી વાર્તા, કવિતા, અભ્યાસ લેખ વગેરે પ્રસ્તુત કરવામાં આવનાર છે. ગુજરાત પાક્ષિકના રસથાળમાં 'પારિજાત'ની વાંચન સામગ્રી આપને ગમશે...

ગીતા એક મહાજ્ઞાન

ડૉ. અશોક નારાયણ

સાચું કહું તો આપણું ચિત્ત શરીરથી સુપેરે પરિચિત છે. શરીરની સુંદરતા માટે આપણે એટલી માવજત, એટલી કાળજી લઈએ છીએ કે આખા શરીરમાં ઉપરછલ્લું આ શરીરનું જ પલ્લું ભારે છે. શરીર ભારે છે એ વાત સાચી, પણ જે હલકા શરીરનો સૌથી અગત્યનો ભાગ છે તે આત્મા. જે દેખાય છે તે તો છે જ, પણ નથી દેખાતો તે આ આત્મા સર્વોપરી છે. એના વિના શરીરની કોઈ વીણા કામ કરી શકે નહીં. આત્મા વગરનું શરીર જડ, અચેતન બની જાય. આપણને કાયાની માયા મોટીમસ લાગે, પણ આત્માની માયા જે અવિરત સમગ્ર શરીરને જ નહીં, પણ માનો ને માણો તો સમગ્ર અસ્તિત્વમાં નવા જોમ ને શક્તિ પ્રેરનાર છે. તેના તરફ પૂરતું લક્ષ્ય એટલે મન લગાવવામાં આવે તો તેનાં સુખદ પરિણામો ભોગવવા મળે, પણ આપણું દુર્લક્ષ્ય, બેધ્યાનપણું શરીરના અણુએ અણુમાં આત્મિક આનંદ પ્રસરવા દેતો નથી. તે એક ચિંતાનો વિષય જ લેખાય. ભગવાને પવિત્ર ગીતામાં આત્મા વિશે કેટલી સુંદર અને ગહન વિચારસરણી દર્શાવી છે. અંતઃકરણપૂર્વક તેમાં દર્શાવેલી મૂળભૂત બાબતોને લક્ષ્યમાં લેવામાં આવે તો માનવજીવન ઉચ્ચ સ્તરે બિરાજમાન થઈને જ અટકે એમાં કોઈ શંકા નથી.

આત્માને છેદી શકાતો નથી. બાળી શકાતો નથી. શોષી શકાતો નથી કે ભીંજવી શકાતો નથી. વળી તે કાયમી અને સર્વવ્યાપક છે તેમજ તેનો અંત છે જ નહીં. આપણે દરેક ભૌતિક પદાર્થ ફળ, ફૂલ વગેરે કાપી શકીએ છીએ. ચીરી શકીએ છીએ, ટુકડા કરી શકીએ છીએ, પણ આપણો આત્મા એવું તત્ત્વ છે કે, જેને આપણે કાપી કે ચીરી શકતા નથી. વળી કોઈ પણ ચીજને કાપવા કે ચીરવા

જોવી તો પડે ને... આત્માને કેવી રીતે જોઈએ? તેનો આકાર ન હોવાથી તેને પકડી પણ શકતા નથી, તેને શોષી પણ શકાતો નથી, કેમ કે આત્મા કોઈ પ્રવાહી સ્વરૂપનો થોડો છે તે શોષી શકાય... આત્મા કાયમી છે, તેનો સમયગાળો કોઈ નિશ્ચિત નથી. દેહમાંથી આત્મા નીકળી જાય પછી દેહ નિશ્ચેતન પડી રહે. દાટીને કે બાળીને તેનો નિકાલ થાય. આ દેહ અનિત્ય પણ આત્મા તો નિત્ય છે સનાતન છે. આત્મા મરતો નથી, તેનો અંત પણ થતો નથી. આમ જે જન્મે નહીં તે મરે કઈ રીતે? આપણે સૌએ આત્માની સર્વવ્યાપકતાને સ્વીકારીને દેહના મરણ સંબંધી શોક કરવો જોઈએ નહીં. એટલે જ માનવીને કલ્યાણકારી પ્રવૃત્તિમાં સતત રમમાણ રહેવું જોઈએ. કલ્યાણકારી કાર્ય કરનાર કોઈ પણ દુર્ગતિને પામતો નથી. એટલું જ નહીં કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પરોવાયેલા તે પુરુષોનો નાશ આ લોકમાં કે પરલોકમાં પણ થતો નથી. જો તમે તમારો નાશ ન થાય એવું ઈચ્છતા હો તો તમારે સદાય કલ્યાણકારી કાર્યો હૃદયમાં વસાવી તે તરફ પ્રયાણ કરવું જોઈએ.

મને લાગે છે કે કલ્યાણકારી પ્રવૃત્તિઓના બે ભાગ પાડી શકાય. પહેલા ભાગમાં એવી પ્રવૃત્તિઓ સમાજના કે કોઈ ચોક્કસ વ્યક્તિના ભૌતિક કલ્યાણને જ ધ્યાનમાં રાખી કરવામાં આવે, જ્યારે બીજા ભાગમાં અભૌતિક એટલે કે લોકો અથવા તે વ્યક્તિઓના આત્મિક કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે... જેને હૈયે લોકોનું માત્ર અને માત્ર કલ્યાણ જ વસેલું હોય તેને ભગવાન પણ શું કામ કોઈ તકલીફ આપે? કલ્યાણકારી કાર્યોથી જ આત્મસંતોષ મળે અને તેનો આનંદ અવર્ણનીય જ હોવાનો... પછી અહીં દુર્ગતિની વાત જ ક્યાં? હંમેશાં સારું થવાની ભાવના રાખનાર માણસને કોઈ તકલીફ કે વિટંબણા થતી જ નથી એ સાવ સ્પષ્ટ જ છે. આવો, આપણે આપણા જીવનને લોકકલ્યાણના યજ્ઞમાં જોડી દઈએ.

ગીતાજ્ઞાન ગહન છે... તેને સમજવા માટે આત્મા રેડવો પડે. જીવને દુન્યવી માયાથી અલિપ્ત કરીને મનને તેમાં પરોવવું પડે. ખરેખર જો તેમ થાય તો ગીતાજ્ઞાન જેવું મિષ્ટ, મધુરું સર્વોચ્ચ જ્ઞાન સમગ્ર અસ્તિત્વને પુલકિત કરી દે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સમગ્ર વિશ્વ માટે ગીતાજ્ઞાન એક અદ્ભુત, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે... એનો રસાસ્વાદ માણનાર પોતાના જીવનને ધન્ય બનાવી દે એવી મહાશક્તિ તો ગીતાજ્ઞાનથી જ મળી શકે.

અસ્તુ... ●





આંસુની ઓળખ...

નીલમ દોશી

સાવ જ અણધારી રીતે એ આ ઘરમાં આવી ગયો હતો. એ સાંજની પહેલી મુલાકાતની વાત... એ દિવસે સોનુ સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે એની સાથે એક અજાણી વ્યક્તિને જોઈ સેલિનાએ સવાલોનો મારો ચલાવ્યો હતો.

આપનો પરિચય? અને એક સ્પષ્ટતા... ખોટું બોલવાવાળા લોકો માટે મને નફરત છે.

યુવક એકાદ ક્ષણ આ યુવતી સામે જોઈ રહ્યો.

‘મારી વાત માનવી કે ન માનવી એ તમારે નક્કી કરવાનું છે. હું ગ્રહનિકાલ થયેલી એક વ્યક્તિ છું.’

‘ગ્રહનિકાલ? સમજાયું નહીં?’

‘જેમ તમે લોકો દેશનિકાલ કે એવું કશુંક કહેતા હો એ રીતે.’

‘તમે લોકો અર્થાત્?’

‘અર્થાત્ હું આ ગ્રહનો... તમારી પૃથ્વી પરનો માણસ નથી.’

મને મશ્કરી પસંદ નથી.’

‘આ મશ્કરી નથી. હકીકત છે. સૌરી, હું તમને વધારે માહિતી તો નહીં આપી શકું. અમને મનાઈ હોય છે, પણ એકાદ નાનકડી ભૂલ થતાં અમને આવી કોઈ સજા કરવામાં આવે છે, જેથી અમારે બીજા કોઈ ગ્રહમાં એટલો સમય રહેવું પડે છે. એટલે કે, તમારા માટે હું એલિયન ગણાઉં.’

ક્યાંય સુધી બંને વચ્ચે સવાલ-જવાબ

ચાલી રહ્યા.

આખરે સેલિનાને સંતોષ થયો. તેની આંખોમાં અપાર અચરજ ઊમટ્યું હતું, પણ ભાવનાઓને ભીતરમાં જ ધરબી રાખવા કદાચ તે ટેવાયેલી હતી.

‘One More Quesation...

તમારા કહેવા મુજબ તમને એક કલાક પૂરતી જ ગ્રહનિકાલની સજા થઈ છે. એક કલાક તો મારા ખ્યાલથી પૂરો થવા આવ્યો. નાઉ યુ કેન ગો.’

‘હા, પણ એ એક કલાક અમારો... અમારા ગ્રહનો... અહીંનો નહીં.’

‘અર્થાત્?’

‘અમારો એક કલાક એટલે પૃથ્વી પરનું તમારું પૂરું એક વરસ. ગુરુત્વાકર્ષણના મોટા તફાવતને લીધે આવું થાય છે.’

યુવકે આખી ગણતરી વિગતવાર સમજાવી.

ધ્યાનથી સાંભળતી સેલિનાની આંખો નર્યા વિસ્મયમથી પહોળી થતી રહી.

‘ઓહ... મતલબ પૂરા એક વરસ સુધી તમે અહીં રહેશો...?’

‘ગભરાશો નહીં, આપને તકલીફ નહીં આપું. હું બીજે ક્યાંક...’

‘અધવચ્ચે જ ન જાણે કેમ પણ સેલિનાથી કહેવાઈ ગયું.’

‘તમે અહીં રહી શકો છો. એક વરસ સુધી.’

‘રિયલી? થેન્ક્યુ. સાચું કહું તો મને મારો નાનકડો દોસ્ત, સોનુ બહુ ગમી ગયો છે.’

‘પણ તમારા આવવાથી સોનુના એજ્યુકેશનમાં કોઈ...’

‘એની ચિંતા ન કરો. એને શીખવવાની જવાબદારી મારી. અમારો ગ્રહ અહીં કરતા ઘણો જ એડવાન્સ છે. અહીંની ભાષા શીખતાં મને તમારી પાંચ મિનિટ લાગેલી.’

ક્યાંય સુધી બંને વચ્ચે વાતો થતી રહી. આખરે સેલિનાને દોસ્તની વાત પર શંકા કરવાનું કોઈ કારણ ન દેખાયું.

અર્જુનને દેખાતી પક્ષીની માત્ર એક

આંખની જેમ સેલિનાને સોનુના અભ્યાસ સિવાય બીજું કશું દેખાતું જ નહોતું. જીવનના બધા રસ સુકાઈ ગયા હતા. સમયની એક ફૂંકથી એક ચુલબુલી યુવતીમાંથી એક જવાબદાર ગૃહિણીની ભૂમિકામાં તે મુકાઈ ગઈ હતી. વહાલાં બહેન-બનેવી પાછળ મન મૂકીને નિરાંતે બે આંસુ સારવાનો સમય સુધ્યાં તેને ફાળે નહોતો આવ્યો. સઘળાં આંસુઓને ભીતરમાં જ શમાવીને તેણે સોનુને પાંખમાં લીધો હતો.

પણ હવે કદાચ કાળે ફરી એક વાર કરવટ બદલી હતી. અહીં આવ્યાના બીજા જ દિવસથી દોસ્તે ફક્ત સોનુનો જ નહીં, પૂરા ઘરનો કબજો લઈ લીધો છે. સોનુ તેની પાસે ખૂબ ઉત્સાહથી શીખી રહ્યો છે. ઘરનાં પણ બધાં જ કામ દોસ્તે ઉપાડી લીધાં છે. મિનિટોમાં એ બધાં કામ પૂરી ચોકસાઈથી કરી શકે છે. ફક્ત અભ્યાસમાં જ નહીં, સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં સોનુની પ્રગતિ જોઈને સેલિના તો સાવ હળવીફૂલ. કોઈ અજાણ્યા ગ્રહ પરથી આવેલા આ દોસ્ત એલિયનને લીધે પાંચ વરસ પછી આવેલી આ હળવાશની પળોએ સેલિનાનું મૂળ



સ્વરૂપ તેને પાછું બક્ષ્યું છે. ગંભીર ગૃહિણીનું ફરી એક વાર નટખટ, ચંચળ, હસતી, ગાતી, ચુલબુલી યુવતીમાં રૂપાંતર થતાં વાર ન લાગી.

એક સાંજે ગુમાવી દીધેલી સુગંધનો સળવળાટ તેની છાતીમાં... અને અકાળે ખરી ગયેલાં શમણાંઓને, અબોટી ઈચ્છાઓને પાંખો ફૂટી. સોનું તરફથી નિશ્ચિત બનેલી સેલિનાની ચેતના જાણે કેસૂઝાના રંગે રંગાઈ રહી. ગુલાલ ભરેલી તાસકમાંથી સરી પડ્યું કોઈ ઝાલરટાણું. સમય નામના સારથિનો આ કેવો ચમત્કાર. સોનુ માટે તો જાણે દિવસો સોનેરી અને રાત રૂપેરી.

સોનુ તો હવે વૃક્ષો સાથે વાતો કરતાં, વાયરા સાથે કલ્પનાની પાંખે વિહરતાં, પતંગિયાં સાથે ઊડતાં કે ફૂલો સાથે ખીલતાં શીખી ગયો છે.

રોજ સાંજે ત્રણેની ત્રિપુટી દરિયાની ભીની રેતીમાં દોડતી, બલૂન ઉડાડતી, હસતી ગાતી અચૂક જોવા મળે. કદીક દરિયાના પાણીમાં ઊભાં રહીને એકમેક પર પાણીની છોળો ઊડતી રહે, તન, મન ભીંજાતા રહે. સેલિનાના ગળામાંથી પંખીના ટહુકાની જેમ ગીતો ગુંજતાં રહેતાં. હસીને લોટપોટ થઈ જતાં કે ગીતો ગાતાં માસીને શરૂઆતમાં તો સોનુ બાઘાની જેમ જોઈ રહેતો. સેલિનાનું મન એની પોતાનીયે

જાણ બહાર મોર બનીને થનગની ઊઠ્યું. સોળે કળાએ ખીલી ઊઠેલી એક ભરપૂર જિંદગી જિવાતી હતી. જાણે પાંચ વરસનું સાટું વળી રહ્યું હતું.

કદી વનભ્રમણ, કદી બોટિંગ, કદી પર્વતો, ઝરણાંઓની મુલાકાત તો કદીક કોઈ ઉદ્દેશ વિના અજાણી કેડીએ રખડપટ્ટી. સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગો રોજ એક નવી સવાર લાવતા. આ વરસે તો મેઘરાજા પણ મન મૂકીને વરસી પડ્યા છે. વરસતા વરસાદને ઝીલવાની મજા આજ સુધી સોનુએ ક્યાં માણી છે? હવે સોનુ, સેલિના અને દોસ્તની ત્રિપુટી આભના આ નર્યા નીતરતાં નીરને ઝીલવા નીકળી પડે છે. અત્ર, તત્ર, સવત્ર ઘેરા લીલા રંગની બિદ્યાત. જડ અને ચેતન બધા ભેળા થઈને મેઘની સરગમ ગાતાં હતાં. ક્યાંક કોઈ ભેદ નહીં, વાદવિવાદ કે વિસંવાદ નહીં, તરલ, સરલ રોમાંચથી ભર્યું ભર્યું જીવન. વરસાદની મોસમ આવી સરસ હોય, ભીની માટી આવી મધમઘતી હોય?

દોસ્ત સામે પણ રોજ રોજ જીવનના અપાર, નિતનવાં, કદી ન જોયેલાં, ન જાણેલાં વિસ્મયકારી રૂપો ઊઘડી રહ્યાં છે.

એ સાંજે સેલિનાને એક કૌતુક જોવા મળ્યું. તેની બહેનપણીના લગ્નમાં જવાનું હતું. દોસ્ત પણ તેની સાથે હતો. આખું વાતાવરણ જોઈ તે મંત્રમુગ્ધ. વિદાય વખતે

કોણ આવી પોંખશે ?

ઉમેશ ખેશી

અસ્ત પામી કોણ આવી ઊગશે?
બંધ પાંપણ કોણ આવી ખોલશે?
જીદ તારી કાં હશે મારી, હવે -
મૌન હોઠે કોણ આવી ખોલશે?
ને ઉદાસી આંખમાં બિડાય છે,
રાત આખી કોણ આવી જાગશે?
એ જ શંકા રોજ પજવે છે મને,
સ્નેહ સગપણ કોણ આવી જોડશે?
શ્વાસ પહેરી લાશ આવી તોરણે,
માંડવામાં કોણ આવી પોંખશે?

બધાની ભીની આંખો, આંસુઓ તે નકરા અચરજથી જોઈ રહ્યો. શું છે આ

બધું? કોઈ કારણ સિવાય તેની આંખો પણ ભીની બની કે શું? એને પોતાને નવાઈ લાગી... બાપદીકરીને ભેટીને વહાલનો જે દરિયો વહી રહ્યો. દોસ્ત સ્તબ્ધ... અને સાથે સેલિના પણ... શું દોસ્તે આવું કદી જોયું જ નહીં હોય?

કદીક કંઈક પૂછવાનું મન થાય છે, પણ સેલિના કશું પૂછતી નથી. મિત્ર જવાબ ન આપી શકે એવું કશું પૂછવાનું તેને મન નથી થતું.

બેચાર દિવસ પછી સેલિના સાથે તે બાળકોની હોસ્પિટલમાં ગયો હતો. નાનાં બાળકો, જેઓ આ દુનિયામાં થોડા સમયના જ મહેમાન હતાં... તેમની ઝિંદાદિલી જોઈને, મેઈક એ વિશવાળા લોકોને નિઃસ્વાર્થભાવે તેમની ઈચ્છાઓ પૂરી કરતાં જોઈને દોસ્તની ભીતરમાં કશુંક ખળભળી રહ્યું હતું.

એક દિવસ સેલિના એની સાથે કોઈ સેવાભાવી સંસ્થાની મુલાકાતે ગઈ હતી. ત્યાં રક્તપિત્તથી પીડાતા દર્દીઓની જે ભાવથી સેવા, માવજત થઈ રહી હતી એ જોઈ દોસ્તની આંખમાં પ્રગટેલી ચમક પારખવા સેલિના મથી રહી.

કદીક બીમાર પતિની સેવા કરતી પત્નીને, તો કદીક ઝૂંપડપટ્ટીમાં બાળકોને

ભણાવતા કૉલેજિયનોને, તો ક્યાંક પ્રણયની મસ્તીમાં ડૂબેલાં યુગલોને તે ન જાણે કેવીયે રીતે નીરખી રહેતો. આવાં દૃશ્યો પોતે કદી જોવા નથી પામ્યો. આ બધી સંવેદનાઓ તો તેને માટે સાવ અપરિચિત, નવીનકકોર...

સેલિનાની જેમ દોસ્ત સામે પણ જીવનનાં અપાર, નિતનવાં રૂપો ઊઘડી રહ્યાં હતાં. તેની ભીતરમાં એક દ્વન્દ્વ સાથે રોજ એક નવી સવાર અનેક આશ્ચર્યો લઈને ઊઘડતી હતી.

અરીસામાં એક ચકલી ચાંચ મારી મારીને પોતાના હરીફને હંફાવવામાં પોતાને જ થકવી રહી હતી. દોસ્ત પણ કદાચ પોતાના જ પ્રતિબિંબને ખોતરી રહ્યો હતો.

સમય દોડી રહ્યો હતો. એક વરસ તો આંખ ઝપકતાં ઊડી ગયું એ ખ્યાલ સેલિનાને છેક છેલ્લી રાત્રે આવ્યો... તેના મનમાં અજંપાનાં બેબાકળાં હરણાંઓ દોડી રહ્યાં.

શું ખરેખર દોસ્ત ચાલ્યો જશે? હંમેશ માટે? ના, ના...

આખી રાત સેલિના જાત સાથે સંઘર્ષ કરતી રહી. શું કરી શકે તે આ દોસ્તને રોકવા માટે? જીવનના કેલિડોસ્કોપમાં સર્જાયેલું રંગીન, મોહક ચિત્ર કાલે વિખેરાઈ જવાનું? તેની બંધ આંખોમાં ભીનાં ભીનાં

...તરફ છે જવાનું

વિનોદ ગાંધી

વતનમાંથી વૈકુંઠ તરફ છે જવાનું,
ભલે લાખ કરીએ થશે જે થવાનું

અમે એટલે બહુ ઉતાવળ કરી છે,
બધા જણ કહે, 'સ્વર્ગ ત્યાં છે મજાનું'

અમે તો સ્વયં સાવ સાજા થયા છીએ,
અને નામ લોકો તો લે છે દવાનું

રહસ્યો ઊઘડશે તો ભોંઠા પડાશે,
તમે ખોલશો ના એ પુસ્તકનું પાનું

તમે દેવ ઉપરની શ્રદ્ધા ટકાવો,
ભલે હોય મંદિર મોટું કે નાનું

બધાં લોકરો હું જોઈ વળ્યો છું,
પરંતુ છે ઉત્તમ હૃદયનું જ ખાનું

વાદળોની ભીનાશ...

એ સવારે હજુ તો પ્રભાતનું પહેલું કિરણ સુધ્યાં ફરક્યું નહોતું. ઝાંખાપાંખા અંધકાર અને ઉજાસનું અદ્ભુત સાયુજ્ય રચાયું હતું.

અચાનક હીંચકાની ઘૂઘરીનો મંદ, મીઠો રણકાર કાને અથડાતા સેલિના ઝબકી પડી.

સામે નજર કરી તો ફળિયામાં હીંચકા પર બેઠેલો દોસ્ત આકાશ સામે એકીટશે જોઈ રહ્યો હતો.

આજે દોસ્ત આટલો વહેલો? હમણાં તો સપનામાં પોતાની સાથે હતો. આટલી વારમાં બહાર?

કશુંક બબડતી સેલિના ધીમેથી ઊભી થઈ. ઘસઘસાટ ઊંઘતા સોનુ પર એક નજર



નાખી તે બહાર નીકળી.

દોસ્તનું ધ્યાન ન જાણે ક્યાં હતું ? તેની હાજરીની દોસ્તને જાણ સુધ્યાં ન થઈ. સેલિનાને જરા ઓછું આવી ગયું. સેલિનાને જોઈ હીંચકાની સામે ઊભેલો આસોપાલવ મર્માળુ સ્મિત વેરી રહ્યો. આસોપાલવને વહાલથી વળગીને કોઈ અનામી વેલી ઉપર ચડી રહી હતી. વેલીને વૃક્ષ વિના કદી ચાલ્યું છે ખરું ? સેલિનાના મનમાં જો વીજળીનો ઝબકારો અને કોઈ અદ્રશ્ય મોતી પરોવાઈ ગયું. તે ધીમેથી દોસ્તની બાજુમાં હીંચકા પર ગોઠવાઈ, દોસ્ત ચોંકી ઊઠ્યો.

‘ઓહ... સેલિ, તું અત્યારમાં? આટલી વહેલી?’

‘કેમ વહેલા ઊઠવાનો ઈજારો તેં એકલાએ રાખ્યો છે?’ સેલિના મીઠું હસી પડી. દોસ્ત તેની સામે જોઈ રહ્યો.

આમ બાઘાની જેમ આકાશમાં શું જોઈ રહ્યો છે ?

થોડી મૌન ક્ષણો...

વાતાવરણમાં ઠંડીનો કંપ, ચમકારો હતો. ઘાસની નીલમણિ બિંદાત પર ખરતા પીળાશ પડતા સુકાં પાંદડાંઓનો ઝીણો રવ પવનની લહેરખીઓ સાથે એક અદ્ભુત લય રચી રહ્યો હતો. આખું વાતાવરણ કોઈ સંતને ભલે પવિત્ર લાગે એવું હોય, પણ સેલિનાને તો અત્યારે એ રોમેન્ટિક, માદક, મદહોશ કરી દે એવું દેખાતું હતું.

તેણે ફરીથી દોસ્ત સામે જોયું. કંઈક સમજવા મથી રહી.

પણ દોસ્તની નજર તો આસમાનમાં સ્થિર.

‘શું જુએ છે? કોને શોધે છે આસમાનમાં?’

‘કોઈને જ નહીં, અમારે વળી શોધવાનું શું?’

‘એટલે? સમજાયું નહીં.’

‘સાચું કહું તો મનેય પૂરું સમજાતું નથી કે મને શું થાય છે?’



સેલિનાના ચહેરા પર ચંદ્ર વિનાની રાત્રે પણ ચાંદનીનો ઉજાસ...

‘દોસ્ત, તેં પહેલે જ દિવસે કહેલું કે અમને વધારે માહિતી આપવાની મનાઈ છે, એથી આજ સુધી મેં કશું જ નથી પૂછ્યું. અને આજે પણ તારા મુલક વિશે કંઈ નહીં પૂછું, પણ એક અંગત સવાલ પૂછી શકું?’

‘તને ના પાડવાની હિંમત મારામાં હવે છે એમ તું માની શકે છે?’

સેલિના દોસ્ત સામે જોઈ રહી.

‘તારા જીવનમાં ત્યાં તારી સાથે બીજું કોણ છે? તારાં લગ્ન...’

સેલિના વાક્ય પૂરું ન કરી શકી...

‘સેલિ, અમારે ત્યાં આવી કોઈ ભાવનાઓ જ નથી. લગ્ન જેવી સંસ્થા જ નથી. અમારે તો છે માત્ર સગવડો અને ભૌતિક સાધનોની ભરમાર. લાગણી કે સંવેદનાનો પરિચય તો મને અહીં આ ગ્રહ પર, તમારી પાસેથી થયો. અમારા ગ્રહ પર આંસુ, વિરહ, મિલન, ખુશી, ઉદાસી વગેરે સંવેદનાઓનો સદંતર અભાવ... કોઈ પરિચય, કોઈ નાતો જ નથી અમારે આ બધા શબ્દો સાથે.

અચાનક સેલિના સાવ સીધા સપાટ શબ્દોમાં બોલી ઊઠી,

‘કાલે તારો છેલ્લો દિવસ એમ?’

દોસ્તનું માથું હકારમાં હલ્યું.

‘તારે નથી જવાનું, ક્યાંય નથી જવાનું,

ક્યારેય નથી જવાનું કહી દીધુંને એક વાર.. શું સમજ્યો?’

દોસ્ત કોઈ જવાબ આપ્યા સિવાય તેની સામે જોઈ રહ્યો. તેના ચહેરા પર કળી ન શકાય તેવી લાચારી...

અચાનક સેલિના દોસ્તને બે હાથે ધડાધડ મુક્કા મારતી મોટેથી ચીખતી રહી.

‘એક વાર કહ્યું ને નથી જવાનું એટલે નથી જવાનું. સમજાય છે મારી વાત ? મારા હાથનો માર ખાઈશ.’

તેની આંખો વરસતી રહી, હાથ ચાલતા રહ્યા.

થોડી વારે થાકીને સેલિના અટકી...

‘દોસ્ત, તેનો અવાજ રૂંધાયો.’

‘સેલિ, તને ખબર છે? અહીંથી જઈને હું મારા દેશવાસીઓને શું ભેટ આપવાનો છું?’

દોસ્ત આંખો બંધ કરીને જાણે એકલો એકલો બોલી રહ્યો હતો.

‘હું ત્યાં જઈને તેમને આ બધી સંવેદનાઓની ઓળખ કરાવીશ. વિરહ, મિલન એટલે શું ? ખુશી, ગમ, પીડા, વ્યથા, સેવા, કરુણા, સમર્પણ એટલે શું ? હું તેમને આંસુની ઓળખ આપવાનો છું.’

‘ના... ના... નો વે...’ સેલિના ચિત્કારી ઊઠી.

દોસ્તને કશું સમજાયું નહીં. તે બાઘાની જેમ તેની સામે જોઈ રહ્યો. ●

EMPOWERING GUJARAT FOR THE NEXT TECHNOLOGICAL REVOLUTION



Shri Bhupendra Patel
Minister, Chief Minister of Gujarat



Shri Narendra Modi
Prime Minister of India

Gujarat IT/ITeS Policy 2022-27

નવી આઇ.ટી પોલિસીની વિશેષતાઓ

- આ નીતિ CAPEX-OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ, સમગ્ર દેશમાં પ્રથમ.
- સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. ૫૦ કરોડની મર્યાદામાં ૨૫ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેક્ટ માટે આ મર્યાદા રૂ. ૨૦૦ કરોડ સુધીની રહેશે.
- દર વર્ષે રૂ. ૨૦ કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂ. ૪૦ કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે ૧૫%નો OPEX સપોર્ટ.
- રાજ્યમાં IT રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ.
 - A-એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI), પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી.
 - B-આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું 100% સુધીનું વળતર.
- રૂ. 100 કરોડ સુધીના CAPEX સપોર્ટ સાથે IT શહેરો/ ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI ધોરણોમાં છૂટછાટ આપવી.
- તમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું વળતર.
- રૂ. 5 કરોડ સુધીની ટર્મ લોન પર 7% લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય.
- IT ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના.
- કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.
- શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટા પાયે માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) કાર્યક્રમો કરવામાં આવશે.
- કોઈપણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્વ કક્ષાની સહ-કાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી.
- સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી IT કંપનીઓને દર મહિને રૂ. 10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.



વસંતના વધામણા...

Published on Date 16-2-2022. R.N.I. NO. 38351/81, Regd. No. G/GNR/10/2021-23 Valid upto 31/12/2023, LPWP No. WPP PMG/NG/061/2021-23 Valid upto 31/12/2023

• Licensed to Post without Prepayment At Post : PSO/1 - Ahmedabad/Rajkot/Surat/Vadodara on every 3 to 11 and 18 to 26 E.M.,
Gujarat (Fortnightly) Annual Subscription Rs. 50.

48 + 4 Cover = Total 52 Pages • Editor and Published by Director of Information on behalf of Directorate of Information,
Block No-19, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar, Gujarat. Printed by Sahitya Mudranalaya Pvt Ltd, City Mill Compound, Ahmedabad &
Gujarat Offset Pvt Ltd, Vatva, Ahmedabad • If undelivered pl. return to, Information Department, Sector no. 16, Gandhinagar Respectively.

To,

ગુજરાત પાલિકા કાર્યાલય :-

માહિતી નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, બ્લોક નં. ૧૯/૧, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮૨૦૧૦